

ઓપિનિયન

યો વે ભૂમા તત્ત્વ સુખમાં ।

સંપાદક : વિપુલ કલ્યાણી

પુસ્તક : 12 ◆ પ્રકરણ : 10/11 ◆ સર્જન અંક : 142/3

26 ફેબ્રુઆરી 2007

વાર્ષિક લવાજમ : £ 25 / £ 40

સાનું કી લભ્યા ?

□ દેવકુમાર ત્રિવેદી

થોડી ઓળખાણવાળા એક પરિચિત ભાઈ બબલસ મલ્ઝોના (નામ પરિવર્તિત) બલુ અભિમાનથી બારેખમ મોહું કૂલાવીને કહે છે, ‘માય ચિલ્દન હોન સ્પીક પંજબી’. વાત વાતમાં જ્ઞાનવા મળ્યું કે કરોડો કમતા દીકરા પાસે પરદેશમાં પાંચ મર્યાદિસ મોટરો છે. તો કહે કે, ‘સાનું કી?’ - એમાં મારે અહીં દિલ્હીમાં શું? બનેવી લુધિયાનામાં મોટા ઉઘોગપતિ છે. તો કહે કે, ‘ઓદે ઈચ મિન્નુ કી લભ્યા?’ - એમાં મને શું મળ્યું? દીકરી ને લાઠીચાર્જ થયા. ૨૧મી ફેબ્રુઆરી ૧૮૮૨ને દિવસે વિદ્યાર્થીઓના મુખીયમાં મશાલૂર અભિનેત્રી છે. તો કહે ‘સાફડા કી કશ્યદા?’ - મને શો શાંતિપૂર્ણ શયા. ભાષાપ્રેમ માટે વહાવેલા એ લોહીથી શરૂ થયેલી રાણીય અસ્મિતાને શિકારીનું છે. મારી પ્રવૃત્તિ - તીર મારવાથી મારા હાથમાં શું આવશે? મોઢામાં શું મળશે? પેટ ભરાશે?

બલભલા બાળછીના નિષ્ણાતો, કેળવણીકારો, ડાંકટરો અને વિષ્યાત માનસશાસ્ત્રીઓ કહે છે કે વહ્યાલથી ઉભરાતી માની ધારીનાં ઉભાભ્યાં કુદરતી દૂધથી ઉછરેલાં બાળક અને બજીરમાંથી ટીનના ડબામાં આવેલાં પાવરામાં પાણી મેળવી ભાસ્કૃતી આયાએ બાટીથી ઉછરાયેલાં બાળકની પ્રતિભામાં લાંબે ગાળે ઘણો ફર પડે છે. પહેલું દિલ્હીમાં મુસલમાન શિક્ષક સંસ્કૃત સાથે એમ.એ. પારંગત થયા બાદ સ્વસ્થ ઊર્મિસભર, તંદુરસ્ત અને ચુસ્ત નીકળે છે. બીજાનો સ્વભાવ સરકારી સ્કૂલમાં પ્રેમથી સંસ્કૃત શિખવારે છે. ગુજરાતી ભાષામાં ઉત્તમ ઉત્તાવળ્યો, ચીદ્યો અને અધૂરૂપભ્યો જ્ઞાનવા માંડે છે. માતૃભાષાથી સાહિત્ય લખાયું છે, કશ્યર વાવેસ, જોસેફ મેકવાન અને મરીજ દારા. કોઈ સિંચાઈને ઉછેલેવી અને ઘરધાટીની ભાષા કે સમાજની પરભાષાથી રંગાયેલી બ્યાંકિટ વિશે પણ કાંઈક આંદુ જોવા મળે છે.

દુનિયામાં સરવાળે પાંચ હજાર ભાષાઓ બોલાય છે. સૌથી વધારે બોલાતી ચીનની મે-નેરિન, અને ત્યારે પછી વારો અંગેળુંનો, જેમાં કુલ આશરે પાંચ લાખ શબ્દો છે, પણ સામાન્ય વ્યક્તિ ત્રણ હજાર પણ માંડ વાપરે. શેકસ્પિયરે તેત્રીસ હજાર શબ્દો વાપર્યા છે. પપૂઆ ન્યૂ ગિની નામના દેશમાં પહાડ વચ્ચે પાસે પાસે આવેલી પણ જરા ય સંકળાયેલી નહીં એવી ખીશોમાં રહેતી જનજીતિઓ ૫૦૦ જુદી જુદી ભાષાઓ બોલે છે. એમાંની કેટલી ય હવે ધીમે ધીમે લુપ્ત થવા માંડી છે, સેટેલાઈટ ટેલિવિઝનના જમાનામાં. સમૃધ્ય ભાષાઓમાં પણ જેમ લેટિન અને સંસ્કૃત રાજીકી બોલચાલમાંથી એકદમ ઓસરી ગઈ છે એવી જ પરિસ્થિતિ કદ્દી ગુજરાતી ભાષાની થઈ શકે? એવું જો થાય તો અને ત્યારે, એમાં કોણો અને કેટલો કણો?

ઈતિહાસમાં લોકોના ડેયામાં સંસ્કૃતિમાં ભાષાનું બલુ મહત્વનું સ્થાન છે. બાંગલાદેશને એક રાઝું તરીકે આપણે જ્ઞાનીએ હીએ. વિશ્વની સમૃધ્ય ભાષાઓમાં ગણાતી બંગાળી ભાષાનો અને સર્જનમાં બલુ મોટો કણો છે. ૧૮૪૭માં પાકિસ્તાન સર્જયા બાદ પૂર્વ પાકિસ્તાન પર ઉર્દુ વાતો કરી એમનામાં આત્મસ-માન જગ્યાવશે? વ્યક્તિત્વના વિકાસમાં,

ભાષા થોપવા માટે ત્યાંની સરકારે જુદી જુદી રીતે દબાણ વધારવા માંજું. ૧૮૪૮થી જ એવો પ્રચાર થવા માંજો કે પૂર્વ પાકિસ્તાનની બંગાળી ભાષા તો છિંદુઓની ભાષા છે. બંગાળીમાં ઉર્દુ અને કશરી શબ્દો બળજબરાથી ધૂસાડવાના પ્રયત્નો થયા. પણ બંગાળીપ્રેમી મુસલમાનોએ અનો વિરોધ કર્યો. રસ્તા પર દેખાવો, સરધસો, રમભાણો તો કહે કે, ‘ઓદે ઈચ મિન્નુ કી લભ્યા?’ - એમાં મને શું મળ્યું? દીકરી ને લાઠીચાર્જ થયા. ૨૧મી ફેબ્રૂઆરી ૧૮૮૨ને દિવસે વિદ્યાર્થીઓના મુખીયમાં મશાલૂર અભિનેત્રી છે. તો કહે ‘સાફડા કી કશ્યદા?’ - મને શો શાંતિપૂર્ણ સરધસ પર ગોળીબાર થતાં કેટલા ય યુવાનિયાઓ શહીદ કશ્યદા? આ માનસ કોઈ સંકારી મૂલ્યાંથી નથી - એક લિસ્ક - આપણે એવી કોઈ સંકારી મૂલ્યાંથી નથી. તો કહે ‘સાફડા કી કશ્યદા?’ - મને શો શાંતિપૂર્ણ સરધસ પર વાતાવરણ કર્યો. પણ રૂષીને ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે માનવામાં અને ઉજવવામાં આવે છે.

કરાંચીમાં આજે પણ ગુજરાતી ભાષાપ્રેમી ઈસ્લામધર્માંઓ આપણી વેલનોનમાં હજારો જિસ્તીઓ અરબી ભાષા નિયમિત વાપરે છે. લેબનોનમાં હજારો જિસ્તીઓ અરબી ભાષા નિયમિત વાપરે છે. ઉછરાયેલાં બાળકની પ્રતિભામાં લાંબે ગાળે ઘણો ફર પડે છે. પહેલું દિલ્હીમાં મુસલમાન શિક્ષક સંસ્કૃત સાથે એમ.એ. પારંગત થયા બાદ સ્વસ્થ, ઊર્મિસભર, તંદુરસ્ત અને ચુસ્ત નીકળે છે. બીજાનો સ્વભાવ સરકારી સ્કૂલમાં પ્રેમથી સંસ્કૃત શિખવારે છે. ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય લખાયું છે, કશ્યર વાવેસ, જોસેફ મેકવાન અને મરીજ દારા. કોઈ ભાષા કોઈ વિશેષ ધર્મનો એકાવિકાર ઈજારો નથી.

હિલ્હીમાં લાંબા સમયથી વસ્તા કે સ્થાયી થયેલા કેટલા ય ગુજરાતીભાષી કુટુંબોને માટે એક મૂંગુલશ છે અને એક પહ્કાર પણ છે : ગુજરાતીભાષી બાળું માટે એક પહ્કાર વસ્તા ગુજરાતીઓ ગુજરાતીપણું કેવી રીતે જ્ઞાની રાજે? સગી માઝે ઘવડાવેલાં અમૃત પીતાં પીતાં, અને એની સાથે બચપણમાં વાતો કરતાં, બોલતાં, શીખતાં દુનિયા સાથે થયેલો પહેલો અને તાજે અનુભવ કેટલો પોષક હોય છે. જગત સાથેના પથમ સંપર્કની તાજગીની ભાષા અને બાળપણના જેમથી ઉત્પન્ન અદર્મ ઉત્સાહને પરિવારમાં પ્રેમથી કેવી રીતે ટકાવી રાખવો?

આપણી ઓળખ સમાજમાં શી છે? મૂળ સોતાં ઉખડી આવેલાં સૂક્ષ્મ તણખાલાં? શિમળાનાં રૂનું હવામાં અધર ઉહાતું, આમથી તેમ હડ્દોલાંતું, ધોળી ઝંવાતીવાળું હલ્કુ કણા બીજાનું ટ્યુક? કે પૃથ્વીમાં ડેરેર ફેલાયેલી ગુજરાતી બિરાફારીનાં ઊંડા મૂળવાળા કબીરવર્જની એક મજબૂત જાળી? આપણી ઓળખ સમાજમાં બાંધુ અસ્મિતાની વાતો અંગેજ ભાષામાં કરશું? ગાંધીજીના બાંગલાદેશને એક રાઝું તરીકે આપણે જ્ઞાનીએ હીએ. વિશ્વની સમૃધ્ય ભાષાઓમાં ગણાતી બંગાળી ભાષાનો અને સર્જનમાં બલુ મોટો પાઠ્યપુસ્તકોમાંથી વાંચવાની રહેશે? ઘરના વડીલો અને સ્વમાનથી કણો છે. ૧૮૪૭માં પાકિસ્તાન સર્જયા બાદ પૂર્વ પાકિસ્તાન પર ઉર્દુ વાતો કરી એમનામાં આત્મસ-માન જગ્યાવશે? વ્યક્તિત્વના વિકાસમાં,

ઓપિનિયન

- 'ઓપિનિયન' ગુજરાતી ભાષાનું માસિક વિચારપત્ર છે અને દર માસની રજીમાટારીને બહાર પડે છે.
- 'ઓપિનિયન'ના ગ્રાહક ગમે તે અંકથી થઈ શકાય છે. સરનામાંથી કેરક્ષર થાય તો કાર્યક્રમને તુરત જાણ કરવી.
- 'ઓપિનિયન'ના શક્ય હોય તાં સુધી જહેરખબર ન લેવાની અમારી નેમ છે.
- એમાં વ્યક્ત થાય વિચારો માટેની જવાબદરી જે તે વેખાળી છે.
- 'ઓપિનિયન'ના ધોરણ અને સ્વરૂપને અનુવળને વૈખાળે પોતાની ફુતિઓ મેકલવી. ધાર પુરકારનું ધોરણ નથી. પરંતુ છાપ્યેણી ફુતિના વેખને જે તે અંક બેઠ મેકલવાની પ્રથા છે.
- લાખાં શાહીથી ચોપાણ આખરે અને કાગની એક જ બાજુએ લખું. નામા લેણો અસ્વીકૃત બનશે.
- ભાષા સારી મારી હતે તેને વિષે લખનારે જરા પણ અચ્યકાવાનું નથી. અમારી શક્તિ પ્રમાણો અમે સુધારી લઈશું. ઓછામાં ઓછી ગુજરાતી જ્ઞાનપાર વાચક પણ સમયિક્ની મારણે જેણી ધાર વર્ષ થઈ તેટલી ધાર દેવી એ અમે અમારી કર્ય સમજશું.
- જેઓ લાખી ન શકતા હોય તેઓ બીજાની પારે લાખાંને લાખાં મેકલવી શકે છે.

લવાજમના દર

- વાર્ષિક લવાજમ આ દેશ માટેદરપ તેમ જ પરદેશ માટેદર૦ છે. ધ્રુટ નકલ : રૂ. ૫૦ . 'Parivaar Communications'નો નામે ચેક યા પોસ્ટસ્ટલ ઑર્ડર અથવા પ્રકટ મેકલવો.

લવાજમ - સંપદકીય પત્રવ્યવહાર

"ઓપિનિયન"

'Kutir', 4 Rosecroft Walk,
WEMBLEY, Middlesex,
HA0 2JZ [U.K.]

Tel.: [+44] 020 - 8902 0993

ભારત માટે લવાજમ ભરવાનું ડેકાશું

Villa Bellevue
30, Avantikabai Gokhale Street
Opera House, MUMBAI - 400 004

Tel.: [022] 2386 2843

Fax. : [022] 2826 1155 / 2826 1166
e.mail : bharti_parekh@hotmail.com

સંપર્ક: ભારતીબહેન પારેખ

ક્રેડિટ નંબર: રેક કે રોકડ
"Vipool Kalyani" ને નામે જ મેકલવા

ગ્રાફ પત્રિકા

Name:

Address:

Post Code:

Telephone:

Subscription: £25 / £40

Date:

સ્વમાનના ઘડતરમાં પ્રેમનો, આદરનો મોટો ફણો છે. જેને પોતાની સંસ્કૃતિ દેશ, માર કુટુંબ, ભાષા સૌ પ્રત્યે લગાવ છે એનું વિડિતત્વ મજબૂત બને છે. અને જેને એ સૌ માટે શરમ આવે, હીણપત્ર લગે, તે અંતે આકમક પરદેશીઓથી દ્વારાને હારીને, આ દેશને, સંસ્કૃતિને પરાદીન બનવા દે છે. શું એનું ફીરીથી થઈ શકે ? અંગેજનું શાસન ગયું પણ અંગેજનું શાસન ફીરીથી ફ્લાઇટ જાય. એક હિવસ એવો આવી શકે કે જ્યારે ભારતના સંવિધાનમાં સ્વીકૃત બધી જ ભારતીય ભાષાઓ લુપ્ત થઈ જાય સિવાય અંગેજા, અને આબાલવુધ સૌ એમાં જ વાતચીત કરતાં રહે. બીજી ભાષાઓ શીખવામાં જરૂર વ્યાખ્યાર શાશપણ છે જ, પણ બાળપણથી શીખેલી ભાષા ભૂતનારા જીણે કે એનો સેલ્ફિન ગુમાવી જસે છે. જેમાં બધા અનુભવોનો ડેટાનેજ હતો. સ્પાઇલ્સ માટે જગપ્રાયાત નોભલપ્રાઇઝ વિજેતા રચિયાના નવલકથા લેખક એલેકન્જર સોલેનીસીને જ્યારે વર્ષો સુધી સંજોગોને કરણે દમનવાદી રચિયાથી બહાર રહ્યા ત્યારે એમોણ ઊંડા દર્દીથી લખ્યું હતું કે રચિયન ભાષાભાષી સમજની એમના આત્માની પોષક નસો કપાઈ જતાં એમને આધ્યાત્મિક વંદ્યાત્મ્ય આવી ગયું હતું.

કેદુંના રિવેઝન બિનન આવી રહ્યા છે. એમનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ બેન્ટ લાયબેરી સર્વિસીસેને સંયુક્ત ઉપકરે, શનિવાર, તુ માર્થ ૨૦૦૩ની સાંજે રૂ.૦૦ વાગ્યે, બેન્ટ ટાઉન હોલના પરિસરમાં એમનો એક જાહેર કાર્યક્રમ યોજાયો છે.

ગુજરાતીપણું, આપણી આગવી ઓળખ શામાં છે ? રહેશીકરણી, રસોઈ, વારતહેવાર, ધાર્મિક પ્રસંગો, પહેરવેશ, બોલચાલ, અભિગમ અને મૂલ્યો, બધું ખરું, પણ આ સૌ સાથે સૌ પથમ, પોતાની બોલી, ગુજરાતી ભાષા. ભાષા એટલે માત્ર સંસ્કૃતિક શબ્દોનો સમૂહ નહીં પણ સંસ્કૃતિને આગળ ધ્યાપવતી નહીની મુખ્ય ધારા. દરેક ભાષામાં પોતાની સંસ્કૃતિક ચેતના હસોઠસ ભરી પડી છે. એમાં અનન્ય સૌન્દર્ય પણ હોય છે. જરા ધ્યાન આપો તો માણી શકશો કે ભલ લટકાં કરે ભલ પાસે, પરમાત્માની અદ્ભુત લીલાં અને કુર્કુરિયાં ગેલ કરે; આ ત્રણો વર્ણનમાં શબ્દો લટકાં, લીલાં, ને ગેલ માટે અંગેજામાં સંતોષજનક પર્યાય નથી. નહેને માટે એક જ શબ્દ વપરાય, "પ્રે". આપણી

ભાષામાં 'અમે' અને 'આપણો' વચ્ચેનો સૂક્ષ્મ તશીંવત વર્ણવવા અંગેજામાં અસરકારક શબ્દ નથી. માત્ર એક જ સામાન્ય શબ્દ છે, 'વી'.

ઉદ્ઘિયું, ઢીકળાં, ખાંડવી, નવરાત્રના ભાતાત્રિળ પહેરવેશ, તળપદી ભાષાની લઢા, ઉત્તરાણના પત્રગશાસ્ત્રની ઝીજાવટબરની છાંબાવટ, લોકગીતોની ધૂન, રાસગરબાના હીચ તાવની ધીમી મસ્તીથી ચગવા સુધીની લયની રમણ, વધારના વૈવિધ્યની વરણગાળી, આ સૌ આપણી પોતાની મુદ્દમાં છે. એને જ્યાંવવા, ફ્લેબાવવા, 'ગુજરાતધારા'નો સતત ને સંજ્ઞા સજ્જન પ્રયાસ, રાસગરબાને અંતર્પ્રાતીય પચલન આપવા સંયોજન કરતા હોશીલા લોકોની મહેનત, આ સૌ અવશ્ય પણસાને પાત્ર છે. દિલ્હીમાં સ્થાનીય ગુજરાતીઓ ધાર્મિક પવોંબે મૌલિક સર્જનના સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો, સંગીતરૂપકો, નૃત્યપવર્વો, ૫૦, ૭૦, ૮૦ના દશકમાં કરતા. હવે એ પ્રવૃત્તિ મંદ છે. સ્થાનીય કળાકારોના કાર્યક્રમને બદલે બહારથી પેસા ખરચી સ્પોર્ટસર્ટ નાટકો, લાવવાનું ચ્યલેજ શરૂ થયું છે. મૌલિક કાર્યક્રમો માટે સર્જન, આયોજન, નિમાણવ્યવસ્થા, રિહર્સલ કરવા, કળાકારોને માંજુને તેચાર કરવા આ સૌ માટે સમય, સાધનો, ધગશ, લગન વગરે જોઈએ. ધાર્મિક તહેવારોને સમયે પોતાની ભાષામાં પ્રકાશિત પુસ્તકોના વેચાણ માટે બુકસ્ટોલનું આયોજન તાપમિલભાષીઓ, મરાઠીઓ, નંગાળીઓ કરે છે. એમની આ સારી પર્યાયો આપણે શીખવા જેવી છે. પણ વળી સાહિત્યને નામે તો આપણે મિડિયની આગળ એકડો શોધવાનો છે.

તો એકદે એકની, સો વાતની એક વાત. પહેલી વાત. પાડેશમાં, સ્કૂલમાં, જેલના મેદાન પર, કે મિનો સાથે ભલે દિલ્હીમાં જનોલા ઉછ્વેલા બાળકો કોઈ પણ ભાષા બોલે. મંજૂર. એમને સમૃદ્ધ વિડિતત્વમાં ટ્રિકાસ મળશે પણ ધરની આપણા ધરની ચાર દીવાલો વચ્ચે, કુટુંબમાં તો પરસ્પર આપણે આપણા ધરની જ ભાષા બોલીએ ને ? કે પછી શરૂઆતમાં ઉત્વેજિત મહાશય બબલ્સ મલ્યોત્ત્રાની જેમ કહીશું કે 'સાનું કી લય્યા ?' ગુજરાતી ભાષા મારે શું કામની?

(સંભાવ : "ગુજરાતધારા", ૧૫ ઓગસ્ટ ૨૦૦૬)

[11 Madhuvan, NEW DELHI - 110 092, India]

થાય છે, અમદાવાદની એ યાદગાર સભા (શનિવાર, 20 જુનુઆરી 2007ના હિવસે પતીજા ન. શેઠકૃત 'ઈમેલ્સ ઑફ ટ્રાન્સફર્મેશન : ગુજરાત અંડ નરેન્દ્ર મોદીના લોકપણની સભા) વિશે ને મિશે (ગુજરાત શાહ, 'રસરંગ' પૂર્તિ, "દિવ્ય ભાસ્કર", ૧૧.૦૨.૨૦૦૭થી) થોડી ઓર વાત કરીએ. નરેન્દ્ર મોદી ઉપર લખાયેલા અંગેણું પુસ્તકના લોકપણ નિમિત્તે પેનલ ડિસ્કશનનો એ અવસર ગુજરાતબાઈને સપુર એ કારણે વિશે સાદી સમજ હોય એ પૂર્તું છે.

યાદગાર છે કે એમના અને આ લખનાર સહિતના વક્તાઓના મિન મિન મતની અભિવ્યક્તિ છતાં, 'સમગ્રપણે સભાનો ગેસ' જળવાઈ રહ્યો હતો. મને જો કે એનું યાદગારપણું જરી બીજે છેદેથી સચિવાષ વાગે છે. છેલ્લાં પાંચ વરસમાં કદાચ આ પહેલો જ પ્રસંગ હતો જ્યારે 2007ના ઘટનાકમ વિશે સત્તા-પ્રતિષ્ઠાન કરતાં મિન મત ધરાવનારને (આ ડિસ્ટ્રિક્યુનામાં ભીજું પારેખ અને પકાશ ન. શાહને) મધ્યધારા અથવા મુખ્ય પ્રવાહના મંચ પર નિમિત્ત કરવામાં આવ્યા હોય. એ રીતે ગણેશ દેવીના તહેલકા વિધાનો આસપાસ છેલ્લા થોડા મહિનાથી શરૂ થયેલી મુક્ત ચર્ચા હે. કથિત મુખ્ય પ્રવાહમાં થઈ શકે છે. સત્તા - પ્રતિષ્ઠાન કરતાં વિરોધી મત એક જ મંચ પરથી, અને તે પણ મુખ્ય પ્રવાહના મંચ પરથી, પાંચ વરસે પગટ થઈ શક્યો; જુદી મત હોઈ શકે છે એવી એક વિરેકસરની સ્વલ્પ પણ સ્વીકૃતિ આટલે મોડે ય થઈ એથી આ અવસર યાદગાર બની રહ્યો અને ગેસ કહેતાં શાલીનતા ને સુખમાંથે સોંપી રહ્યો, એમ જ કહેવું જોઈશે.

2007ના ગોધરા - અનુગોધરા ઘટનાકમ સાથે નરેન્દ્ર મોદીએ જે રીતે કામ પાજું અને ન પાજું તેમ જ જે રીતે ચૂંટણી જરી બતાવી એ કારણે એમની મુક્ત કર સિક્ટદર શી એક ઇન્જિ જરૂર બની છે, અને તાજેતરના ગાળામાં એમની રીતનો અગર તો વિકાસપુરુષ તરીકેની છાપના ખરીદારોની પણ પભુક્ષપણે ખોટ નથી. જોવાનું એ છે કે 2007માં નમોના ટીકાકાર રહેલા પ્રવીજા શેઠેને પણ એમનો આ નવો તબક્કો ખુલ્લા મને જોવાનું વલણ સ્પશ્શ શકે છે.

સવાલ એ છે કે ગોધરા - અનુગોધરા ઘટનાકમમાં જેમણે નમોને વીરનાયક તરીકે નહીં પણ અન્યથા જોવા, મૂલવ્યા, એમનીએ તે વખતની સમજ ને મૂલ્યાંકન વાઈબ્રન્સીના વાયરાથી ઓજપાઈ જાય એ શક્ય છે ખરું? પ્રવીજા શેઠે નવા તબક્કાને સહદ્યતાથી જોવા સાથે અને છતાં આગલા તબક્કા બાબતની પોતાની આકર્તી ફરિયાદોને વળણી રહેવું પસંદ કર્યું છે. ભીજું પારેખ અને પકાશ તો ત્યારે પણ નનોના ટીકાકાર હતા. ભીજું બાજુએ આપકાને કહેવામાં આવે છે કે કોઈ રાજકારણી પાસે સંત જેવી અપેક્ષા ન રાખી શકાય. વળી ઉમેરવામાં આવે છે કે ટીકાકારો મોદીને ખાસ્સ કર્યા છે. અહીં થતી વિમાસણ એ છે કે જાલ્યો તે રહ્યો એમ કહીને તેમ જ એ તો ભાઈ રાજકારણી છે એમ મન વાળીને ગુજરાતનું વિવેકધન 2007 બાબતે નેતૃત્વ દાયિત્વ અને ઉત્તરાધિત્વ વિશે કેવળ ને કેવળ મૌન(બલકે, મુખર મૌન)નો જ મહિમા કરીને છૂટી પડવાનું હોય તો આપકાને શો જવાબ આપી શકવાના હતા.

ગોધરા - અનુગોધરા આખરે શું છે? આપણું તે વખતનું શાસન શૂચિંદ્રક નહીં એટલે ન બનવાનું (અને તે પણ નિઃશ્વાસ નિર્ધિશ્વ) બનીને રહ્યું બનતું રહ્યું. શાસન કાં તો નિઃશાસન બની રહ્યું કે પછી દુઃશાસન બની રહ્યું. નેતૃત્વની આ અનવસ્થા વિશે સંસદમાં સત્તાવાર સ્વીકૃતિ

પણ થયેલી છે, અને વાજેયો - અડવાઝી સહિતનાં વચ્ચે પણ એ બાબતે પૂરતાં પગટ થયેલાં છે. શાસને ત્યારે શાસનપણું ખોયું હતું અને નેતાબે ત્યારે નેતાપણું ખોયું હતું એ કહેવા અને જોવા સારુ કોઈએ ચીતરી ચેતે તેવા સેક્યુલર તો શું, 'આતરરાષ્ટ્રીય કક્ષાના મોદીવરોદી' હોવું પણ જરૂરી નહોતું ને નથી. નાગરિક સમાજ અને કાયદાના શાસન નિમિત્તે પેનલ ડિસ્કશનનો એ અવસર ગુજરાતબાઈને સપુર એ કારણે વિશે સાદી સમજ હોય એ પૂર્તું છે.

મોદીના દાયિત્વ ને ઉત્તરાધિત્વ વિશે ઝેડ પાંચા વગર એક બીજી અફ્લાટાનું વાત એ ગીકવામાં આવે છે કે અરુંધતી રોય, રજીની કોન્ટારી, આશુતોષ વાણ્ણેય, વિમલા ઠકર એ 'ચારે મહાનુભાવોની વાતનો ગુરુત્વમાં સાધારણ અવયવ એ જ કે કોઈ પણ પક્ષ સેક્યુલર નથી.' ભાઈ, કોંગ્રેસ વગેરેનાં સિસ્ટસ ઔફ ઓમિશાસ અંડ કમિશન્સ જીણીતાં છે. એ બાબતો એમને ઝૂલવામાં આ નાનકાજ ગુજરાતમાં આ નાનકાજ લખનાર જેવા કંઈક કશી કસર છોડી નથી. પણ કંગ્રેસને કોમવાદી કહેવાથી નમોને કેવી રીતે કલીન ચીટ મળે છે એનો ખુલાસો કોઈક તો કરો. બલકે, આ મહાનુભાવોનું 2007ના સંદર્ભમાં જે નમો - મૂલ્યાંકન છે એ હીલા મોદીવરોદી કરતાં તત્ત્વતઃ જુદું નથી, તે એમનો હવાલો આપતી વેળાએ જ્યાલવામાં રહેવું જોઈશે.

જાણે તેમ પણ, ગોધરા - અનુગોધરા ઘટનાકમને કાયદાના શાસનથી હીને કોમવાદ ને સેક્યુલરવાદની રીતે જ જોવાનું વલણ હોય તો જે બાબતોમાં સ્પષ્ટ થઈ જનું જરૂરી છે. એક વાત તો એ કોમવાદના મામલે સિસ્ટસ ઔફ ઓમિશાસ અંડ કમિશન્સ પ્રકારનો તકવાદ સર્વ પક્ષોને નામે જેમ હોઈ શકે છે તે સાચું; પણ અયોધ્યાઓટર ભાજપે કોમવાદને એક પૂર્ય કદના રાજકીય વિચારધારાનું રૂપ આપ્યું એનો કદાચ કોઈ જ સરખામણી નથી. સંસ્કૃતિક રાષ્ટ્રવાદની રાજનીતિએ વિભાજન વેળાના જીજાના છિદ્દું અધિયાઓની એક આખી પંગત સ્વરાજ પદી ખડી કરી દીધી એ આપક્ષી સામે છે.

બીજી વાત એ કે 'સંસ્કૃતિક રાષ્ટ્રવાદ'ની ગળથૂથીમાં 'ધ અધર' માટેનો એક દ્રેષ પટેલો છે. ધારો કે મોદીના મૂલ્યાંકનો પણ આપક્ષો ચુકાવવા માગતા હોઈએ તો બલે, પણ 'સંસ્કૃતિક રાષ્ટ્રવાદ' એના ગળથૂથીગત કારણોસર હાડે કરીને હરતોકસ્તો સેન્ઝેપર સિન્ઝ્રૂમ છે, એના કેન્દ્રમાં દર્શાણ છે. એટલે આ એક એવી રાજકીય વિચારધારા છે જે સિનિયોસિસ (જેના પાયામાં પરસ્પરાવલંબન છે) અને સિનઞ્ચ (જેના હાઈમાં બને પક્ષોમાં રહેલી શક્તિનો જાહુઈ સરવાળો છે), આ બેનુંથી એક વાના વાસ્તે પૂર્ક, ઉપકારક અગર સંસ્કારક તો શું કેવળ ન કેવળ વિરોધક ન વિપરીતપરિણામી પુરવાર થઈ શકે છે. ગુજરાતના વિવેકધને આ મુજૂસ ચૂંકે કેમ ચાલશે? કંગ્રેસ હોય કે ભાજપ, પોતપોતાની પસંદગીના જહાનમાં કે જનતામાં સુખેથી જઈ શકે છે, પણ મને (એક નાગરિકને) તો આટલીએક બુનિયાદી સુધ્યબુધ હોવી જોઈશે. ન.

ગુજરાતના ઘટનાકમની ચર્ચામાં સત્તા-પ્રતિષ્ઠાનના બચાવવારો અગર તો સેક્યુલરિઝમના ટીકાકારો પ્રસંગોપાત ગંધીથી માંડીને આશિષન નંદી લગીનાને ટંકતા માલ્યમ પડે છે. નંદીનું એ નિરીક્ષણ જીણીતું છે કે આપક્ષો ત્યાં પદ્ધતિમની ફલે સેક્યુલરિઝમ ન ચાલી શકે. એમાં ગંધી, કબીર સહિતની ભારતીય પરિભાષા ને પરંપરાથી કામ લેવું જોઈશે. પણ આ જ નંદીનું મોદી - મૂલ્યાંકન 'ચીતરી ચેતે તેવા' સેક્યુલરોથી જુદું નથી, એનું શું

ગુજરાતમાં નશાબંધી અને પરદેશસ્થિત ગુજરાતીઓ

□ ઈલા પાટક

પરદેશોમાં વસતા ભારતીય નાગરિકો કે સવિશેષ કરીને ગુજરાતી નાગરિકો ગુજરાતમાં આજ સુધી જેવી તેવી પણ મોટા ભાગે ચાવતી આપેલી ગુજરાત સરકારી દાડુંબંધીની નીતિ વિશે શું વિચારે, તે જાણું અમને ગુજરાતમાં વસતી અને ગુજરાતની વર્તમાન સમસ્યાઓ સાથે બાબતી લીડતી સ્ત્રીઓને ગમે.

તાંત્રયાત્રાનું ગુજરાત સરકારે વર્ષોથી ગુજરાતમાં ચાલી આપતી નશાબંધીની નીતિમાં હજવાશ મુકવાનો વિચાર કર્યો છે. નશાબંધીના કાન્દામાં હવે એવી જોગવાઈ કરવામાં આવનાર છે કે 'સ્પેશિયલ એકોનોમિક ઓન' કહેતો 'સેઝ' નામના રેન્ઝિસ વિસ્તારો સ્થપાયે અને રેમાં માર્કિયસેન માટે સવિશેષ સવલતો અપાયે જેવી કે ક્રેન્કરન્સમાં દાડું પીવા સમાહિક પરમીટ અપાયે, પરદેશીને હોટલના મેનેજર કે અન્ય કોઈ દાકાર (એટબે કે રિવિલ સર્જન જ આપે તેવું નથી) દાડું પીવાની પરમીટ આપી શકે. આવી

કરીશું, કહો જોઉં. અથવા તો, સેક્યુલરિઝમ નહીં પણ ગાંધીની પાટીએ સર્વધર્મસમભાવ સહી, અને કહેવામાં વાંધો નથી. પણ સર્વધર્મસમભાવની ભૂમિકાએ ઊભીને ગાંધીએ જિંદગીના છેલ્લા મહિનાઓમાં બંગાળની મુસ્લિમ બહુમતીને અને બંગાળના લીગી શાસકોને તેમ બિહારની હિંદુ બહુમતીને અને એની કાંગ્રેસ સરકારને જે કદ્યું હતું એ જ મોદીના ટીકાકારોએ ૨૦૦૨માં કદ્યું છે. તેથી ગાંધી અને નંદીને નામે સમગ્ર વિમર્શને તકાતીકીમાં નાખવાનું કોઈ કારણ નથી.

મુદ્દે ગાંધી-ચશે સેક્યુલરિઝમની ટીકા કરનારાઓએ, ડાનેરીઓએ ને બીજી પ્રગતિશીલોએ, રેશનચિલ્સોએ ને ખૂબ સેક્યુલરિસ્ટોએ ગાંધી સાથે કામ પાડતી રેણાએ એમને રાષ્ટ્રપિતાની ટૂંકી ઓળખથી ઊઠીને જોવાની જરૂર આપે છે એટલી ક્યારે ય નહીંતી. કેવળ હિંદુ કે કેવળ મુસ્લિમની નહીં પણ સૌની બાલાશ જ્ઞાનારો એ જીવ હોઈ સુભાષબાબુએ મહાત્માને રાષ્ટ્રપિતા કદ્યા એ ભાવનાની આપણે કદર કરીએ. પણ નવી દુનિયામાં રાષ્ટ્ર-રાજ્યથી બધ્ય અભિગમે ચાલવાનું નથી. તથાકથિત સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો તો સવાલ જ નથી, પણ રાષ્ટ્રવાદનોએ પણો ટૂંકો પડે છે. ગાંધી એ અંતે તો સમગ્ર, રિપાર્ટ, સમગ્ર મનુષ્યજીતિ ને માનવસમાજ જ નહીં, જીવમાત્રા સિવિલાઈઝેનલ કલક પર વિચારનારા જણી હતા. આજના શ્રાદ્ધધર્મ એટલું લેસન પારું કરીએ તો ખોડું નહીં. તાજી કલમ તરીકે જરી ઉત્તવણે એટલી પણ એક નોંધ કરી લેવી જોઈએ કે પરમાણું સત્તા અને જીવી તરેહની મોટી દર્ઢીત, વખતોવખત કંઈક અમૂર્ત, રાષ્ટ્રની ખયાલવાતથી હીને માનવ વિકાસ અંકની કસ્ટોડીએ અને સ્વરાજ જ તે જ્ઞે જ્ઞે ભોગવાની જ્ઞાસ છે એ ગાંધીદર્શિએ રાષ્ટ્રવાદની સ્થાપિત વ્યાખ્યાને તાકિટ ઠમીઓરવાપણું છે.

દરમિયાન, હમજું તો ગુજરાતના પરિવર્તન અને તેના નેતૃત્વનાં પ્રતિરૂપોની જલક આપતા પુસ્તકના લોકપણ પ્રસંગે મુખ્ય ધારમાં શક્ય બનેલ ચચણને અનુષેંગ એટલું જ કહેનું બસ થશે કે નરવી, સૌધર્યવુક્ત, સ્થાયી ને સંપોદિત વાઈબ-ન્સી સારુ, કાયદાનું શાસન એ પાયાની શરત છે : નેતૃત્વની ઓળખ ને પરખની એક દૂર્ઘીયે એમાં પહેલી છે. આટલું સમજવાની શરૂઆત થાય તો એ સભાને જરૂર યાદગાર બનું.

(સફભાવ : "દિવ્ય ભાસ્કર", ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૭)

[Prakash', Behind Navrangpura Post Office, Navrangpura,
AHMEDABAD - 380 009, India]

સવલતો આપવાનું કરણ કહેવાનું છે કે ઉથોગે વિકસાવવા છે અને તેને માટે દાડું પીવાની પરવાનગી આપવી જરૂરી છે.

ગુજરાતમાં આજ સુધી અમે વોડી હજવી એવી દાડુંબંધી જોઈ છે. તેને પરિસ્થિતી અમે માનીએ છીએ કે સ્ત્રીઓ રાત્રે મોટે સુધી બદાર નીકળીને છી દ્વારા થકે છે. જાહેર સત્તા પર કારણે કોઈ પીવેવા સામે ભટકાઈ પડે એવા અનુભવ અમને વધા નથી. જાહેર ચીતે હુકાનોમાં દાડું કે નશીલા પદાર્થ વેચાતા નથી, તેથી તેવી કોઈ જ્યાએ નથી જ્યાં પીવેવાઓ લેવા વઈને ધમાલ કરતા હોય. તમે જ્ઞો છો તેમ ગુજરાત આર્થિક દાખિયે પહેલા નંબરે છે, એમ કહેવાય છે. ગુજરાતની આર્થિક જમતા તેમાં રહેવી શ્રમિક વર્ગની સંતોને લીધે છે. આ ચાંતિ જોગવાઈ છે કેમ કે પીનાચાને છુપાઈને પીઠું પડે છે. પીનાચાને પીવાનું મળી રહે છે અને ખરું પણ જાહેરમાં તેનો ઉપદ્રવ નથી. તેવી ઉપાદાનને, ખાસ કરીને ઔદ્યોગિક ઉપાદાનને, તે નથું જાણું નથી. આવા ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારોને વિકસાવવા સરકાર નશાબંધીની નીતિ હજવી કરવા તરફ જાય તારે અમારા ચિન્તામાં અનેક સવાલો ઉકે છે.

તેમ સૌ જ્યાં દાડુંબંધીનું કોઈ નામ નથી કેવાયું તેવા રાજ્યમાં રહે છે. ત્યાં છદ્ધી મળતી મહિયા ત્યાંના સમાજમાં સ્વીકાર્ય છે, તે જાહેર છે. અમારો સપાલ તમને ગુજરાતસોને છે કે તેમાચો તે સમાજનો અનુભવ સું છે ? અછી જે સમાજના લોકો ગેરકાયદે ગળાતો દાડું મેળવીને પીએ છે તે તેમની સ્ત્રીઓ તો અત્યંત દુઃખી છે જ કેમ કે એકવાર શરૂ થયેલું વ્યસન પરી રોગ બનીને વળ્ગે છે. ગરીબ પુરુષ દાડું પીતો વાય અને ધીમે ધીમે પીવાનું પ્રમાણ વધારતો જાય તારે તે નિર્બંધ બનતો જતો હોઈ કામ અને કાંબાં છોડી દેતો હોય છે. તેની સ્ત્રી, તેની કુટેવ, તેનો રોગ સમજુને નિબારે છે અને છેવે આખું કુદુંબ બેલાલી તરફ વળે છે.

ન વર્ષ પહેલા, નશાબંધી નીતિમાં ગુજરાત સરકારે છૂટ મુકવાની ઘોષણા કરી ત્યારે અને એક રેલી કાઢી હતી. તેમાં એક વૃદ્ધ જોગયા હતું. મે મહિનાની બળબળતી બપોરે એકથી સાગત્રણ સુધી અમારી ચાયે ચાલવા એ બહેનને મે પૂર્બજું હતું કે, 'આવરી ઉંમરે તાપ ક્ષય માણી વીધી?' તેમને જવાબ હતો, 'મારો ઘરવાળો પીતો તે વેજું, મારો છોકરો પીતો તે નથી સહેવાતું ત્યાં વળ્ગે તેનો છોકરો પીવા લાગ્યો છે. એ કેવા બાળે છે, આ તાપ તો સું છે જ?'

આ પહેલાં ગુજરાત સરકારે જેટલી વાર છેલ્લાં નષ્ટ વર્ષમાં નશાબંધી નીતિ હજવી કરી તેટલી વાર ગરીબોને મળતા દાડું પર અસર પડતી હતી અને અને ગરીબ સ્ત્રીઓને સાથે વાઈ વિચેદ કરતાં. આપે ગુજરાત સરકાર જે કરવા જઈ રહ્યી છે તેની અસર સ્ત્રીઓ મધ્યમ વર્ગના જીવાનો પર પડ્યે, એટું જ્યારી રહ્યું છે. 'સેઝ'નું ગુજરાતીકરણ છે. 'વિશેષ નાસ્થીકીય સવલત વિસ્તાર' એટબે ટંકામાં, 'વિનાસ'. (હીકુકો વિનાસ જ ને ?) એ 'વિનાસ' વિસ્તારમાં ભેદોલા ગેલોવા તરવાયા જીવાનોને નોકીએ ચાખવામાં આવશે. એકાઉન્ટન્સીમાં, મેનેજમેન્ટમાં કે આઈટીમાં નિષ્ણાત થેવો જીવાનો ત્યાં

નોકીએ લેવા જશે અને ધીમે ધીમે મહિયસેવનમાં પણ સરકારો. તેમનું સું થશે ? તેની સાથે તેમનાં પત્ની અને બાળકોનું સું થશે ? તેમનાં માતાપિતાનું સું થશે ?

વિશે વસ્તાં ગુજરાતીઓ, સવિશેષ ગુજરાતસ્થોનો, આ વિશે અનુભવ જ્ઞાનો ગમે. તેમની ચિચાર્ણા ય સમજવી ગમે.

[Ahmedabad Women's Action Group - AWAG, AWAGKunj, Bhudarpura, Ambawadi, AHMEDABAD - 380 015, India]
e.mail : awagbox@yahoo.com

સમાનતામૂલક હિમત જવેરી

‘સારું હોવું એ પૂરતું નથી. સમજણું હોવું પણ જરૂરી છે. સમજણ એટી જ જરૂરી છે જેટી ભવાઈ.’ હિમત જવેરીના એક ગુરુ રામમનોહર લોહિયાએ, સન ૧૮૬૧માં, હેરિસ તુશેર્કૃત ‘લોહિયા - અમેરિકા મિટ’ પુસ્તકના આમુખમાં આમ લખ્યું છે. આ પુસ્તકમાં રામમનોહર લોહિયા અને આલ્બર્ટ આઈન્સ્ટાઇન વચ્ચે પ્રિસ્ટન ખાતે થયેલી મુલાકાતનો ય વિષદ્ધ હેવાલ છે. લોહિયા આગળ જતાં, હિમત જવેરી અનુસાર, લખે છે : ‘આઈન્સ્ટાઇન સાથે મારે આ વાતનો નિકાલ લાવવો હતો કે જેમ વિજ્ઞાનમાં સમજણ લાવવી શક્ય છે એમ રાજનીતિમાં શક્ય ખરી ... અમારા દેશમાં તો દુર્જીનો કરતાં સજીનો અને બુધ્યુંઓ ઘણી વાર વધારે હુદ્ધ હોય છે.’

નગીનદાસ સંદ્ગતી એમને ‘મોટા ગજીના ચિંતનાત્મક કટાર લેખક’ ગણે છે. વળી, નગીનદાસભાઈ ઉમેરે છે : ‘જે જેવું છે તેને તેવું જેવું, નોંધવું અને કહેવું એ હિમતભાઈના જીવતરનું શાસ્ત્ર છે.’ ઘટના અને સંવેદનાંનામના હિમત જવેરીના તાજીતર લેખસંગ્રહમાંના લેખોમાંથી પસાર થતાં થતાં સતત જણાયું કે જીઝો કે આ લોહિયાવાડીને જ જીઝો કે કેન્દ્રસ્થ કરીને પોતાનો ચીપિયો હિમત જવેરીએ ખાગદાચા જ કર્યો છે.

આ સ્વતંત્રસેનાની તેમ જ મહાત્મા ગાંધીને વરેલા આ સમાજવાદી વિચારક, લેખક અને સપ્માંજિક કાર્યકર હિમત હરછીન જવેરીનું બુધવાર, ૧૩ ડિસેમ્બર ૨૦૦૫ના દિવસે પરોઢીએ, ટૂંકી માંદળી બાદ, જૂલીસિથ આરોગ્યનિધિ હોસ્પિટલમાં નિધન થયું. અંગેજીમાં કહેવું હોય તો સહજપણે કહેવાય : Long live his tribe.

રમેશ પારેખ, જ્યન્ત પંજ્યા, દેવવત્ત પાઠક અને હવે કિરીટ બહુ ઉપરાત હિમત જવેરીનું, એકાદ વરસમાં જ, એક પણ એક, આ નિષ્ઠમજણ આકરું જરૂર છે. આજના આ સવાગીણ સંકુચિત માનસવાળા કાળમાં, ગુજરાતી જીવનના અને એ દ્વારા તળ તેમ જ બૃહ્દ ગુજરાત સહિત રાષ્ટ્રીય જીવનના વિવિધ પાસાંને પ્રભાવક રીતે સ્પર્શિત એ દેરેકનું પ્રદાન કેટલું વ્યાપક હતું અનો કદાચ હાલ અંદાજ નહીં આવે.

રામમનોહર લોહિયા, રોહિત દવે, કરસનદાસ માણોક, મધુ દંહવતે, સુરેશ જોખી, ઉખાબહેન મહેતાનાં તેઓ અંતર્ગત સાથી અને સહકાર્યકર હતા. શાંત, સરળ અને નિખાલસ સ્વભાવના હિમતભાઈ ગાંધી સ્મારક નિધિ અને મણિભવન જેવી સંસ્થાઓમાં સક્રિય હતા. ગાંધી સ્મારક નિધિના એક ટ્રેસી ય હતા. કીર્તન કેન્દ્રીના સ્થાપના અને વિકસમાં તેમનું સહિત યોગદાન આરંભથી રહ્યું હતું. કીર્તન કેન્દ્રના અધ્યક્ષપદેથી એમજો કુનેહપૂર્વક વરસોથી સેવાઓ આપી હતી. ક્ષર્જસ ઓપિનિયન/Opinion

૦ વિપુલ કલ્યાણી

ગુજરાતી સભાના હાલના એ માનવ સલાહકાર પણ હતા. દિગ્ંત ઓજા લખે છે તેમ ‘એકત્રફ સમાજવાદી પ્રતિબદ્ધતા, દરિદ્રો માટેની

સંવેદના અને બીજી તરફ

સાહિત્યપીતિ અનું સાયુજ્ય એટલે હિમતભાઈ. ...

“સારથિ”, “નચિકેતા”,

“એતદ” જેવાં સાહિત્યક સામયિકોનાં સહતંત્રી અને

આ પરામર્શક, ક્ષિતિજ સંશોધન ટ્રસ્ટના સ્થાપક

ટ્રસ્ટી હતા તો અંગેજી સામયિકો “મેનકાર્હિન”


(સ્થાપક રામમનોહર લોહિયા) અને “જનતા”

(સ્થાપના ૧૯૮૫) જોડે પણ એમનો સક્રિય નાતો. ... “જનતા”ના ઘટતરમાં એના કેવાવામાં ચઢ-ઉિતર આવતાં રહ્યા, પરંતુ હિમતભાઈ તેનું કોન્સ્ટન્ટ ફેક્ટર રહ્યા છે. હિમતભાઈએ ખૂદ કહ્યું છે : ‘આ બને સમાજવાદી સામયિકી હોઈને એમાં હું અવારનવાર સક્રિય રહ્યો છું.’

“જન્મભૂમિ”માં એમજો વરસો સુધી સાંપ્રદાત્રી છાણવાટ કરતી કોલમ ચલાવી હતી. “લોકસત્તા - જનસત્તા”માં પણ એમની કલમ ફરી વળેલી. “લોકતંત્ર”, “સમકાળીન”, “નવનીત - સમપ્રકાશ”, “નિરીક્ષક”, “ભૂમિપુત્ર” જેવાં સમસમાયિકોમાં હિમત જવેરીનું કટારલેખન થતું રહ્યું. અંગેજી સામયિક “ગાંધીટ્રે”ના પણ એ તંત્રિપદે હતા. જાણીતા સમાજવિશાની ડૉ. અક્ષયકુમાર ર. દેસાઈએ એકદા કહેવું : ‘દર અઠવાસ્યે ચોક્કસ શબ્દોની મયાર્દામાં, એટલે કે લાઘવમાં તમામ તિચારો અને જીજુકારીને અસરકારક રીતે બ્યક્ટ કરતું ખૂદ અધરં કામ છે. મારે એ શીખવાનું છે. હિમતભાઈ તે સતત કરતા રહ્યા છે. જેનું મૂલ્ય ઓછું નથી.’ પાંચપાંચ દાયકાના નિષ્ઠ મિત્ર દિગ્ંત ઓજા, ખરેખાત, લખે છે : ‘તેમનું ગઢ માંજેલું, સ્પષ્ટ છે અને તેના શબ્દો સમયસરના તેમ જ અભિપ્રાય પૂર્ણ છે અને તેમના બધેબધા લખાણોમાં સાંપ્રદાત્રી સાથેની નીતરતી રહે છે.’ શેખાદમ આબુવાલા પારિથોષિક સૌ પથમ હિમતભાઈને એનાયત થયું હતું તે આની સાહેદી જ પૂર્ણ છે.

‘ઘટના અને સંવેદના’ પુસ્તકમાં ‘કટારલેખકની કેફિયત’ હેઠળ, આરંભે, હિમતભાઈ લખે છે તેના થોડા વાક્યો બેદા લઈએ તો જ આ માણસને સમાજવા સહેલું પડે. ‘મારું વૈચારિક [ideological] ઘટતર થયું, ૧૯૪૨(બેતાલીસ)ના આજાદી આંદોલનના - ‘કિવટ ઈન્જિયા’ના દિવસોમાં, સપ્ત-આઠ ઔંગસ્ટે

ક્રિબુઅારી 2007



આજિલ ભારતીય કોણેસ મહાસમિતિ (એઆઈસીસી)ની નેટક મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાનમાં (આજનું ઔગસ્ટ કાંતિ મેદાન) મળી હતી, જેમાં હું પણ, બીજા અસંખ્ય નિરસ્તવાન લોકોની જેમ, તાં પેશક તરીકે હાજર રહ્યો હતો. જો કે એ પહેલાંના ૧૮૪૦ના વડ્કિતગત સત્યાગ્રહ (ઇન્ડિવિઝ્યુઅલ સત્યાગ્રહ)ની અસર યે બરી. ખાદી પહેરવાનું ત્યારથી શરૂ કરેલું. મારી મોટી બહેન ચંદ્રા, જેનું ભાષ્ણતર ચાર ચોપડી જેટલું જ હતું (એ દિવસોમાં, ૧૮૪૨ પહેલાંના વર્ષોમાં મધ્યમવર્ગાઓ ગુજરાતી કુટુંબોમાં છોકરીઓને - દીકરીઓને બહુ ભણાવાતું નહીં) એણે ખાદી અપનાવેલી, જેના પ્રભાવ ડેઢા દાળના પહેરવાનું એણે છોકરી દીધેલું, મોટાઓમાં એના એ પગલાં બદલ નારાજગી હોવા છતાં. ખાદી અપનાવે, દાળના પહેરે નહીં તો વર-મૂરતિયો મેળવો મુશ્કેલ બને એવી પરિસ્થિતિ ત્યારે હતી. ૧૮૪૧માં એનું લગ્ન ગાંધીજીના આશ્રમમાં ઉછરેલા, અમારી ન્યાતના નહીં (તે દિવસોમાં ન્યાતની બહાર પરણાં લગભગ વજ્ર હતું, એ માટે શિક્ષા બોરવાની આવે) એવા કાન્તિભાઈ પારેખ સાથે, રવિશંકર મહારાજની વિધિથી ગોઠવાયેલું. આમ, મારી બહેનની અસર પણ મારા પર પડેલી. વધુ તો, બલ્કે, મુખ્ય અસર એ વખતના રાષ્ટ્રીય વાતાવરણની હતી, ગાંધીમય - ખાદીમય - પ્રભાતકેરીમય - સ્વરાજ્યમય વાતાવરણની હતી.'

મુદુના એક પડેશી માણેકલાલ વખારિયાની સત્યાગ્રહની લજતમાંની વિવિધ પ્રવૃત્તિઓ, પ્રિન્સેસ સ્ટ્રીટમાંની લિબરી હાઈસ્ક્વુલના આચાર્ય બી.એન. શાહ, એ નિશાળમાં કરાચીથી આવ્યા કેદ સન ૧૮૪૧માં શિક્ષક તરીકે જોડાયેલા કરસનદાસ માણેક એમને માટે ભારે પ્રભાવક નીવડે છે. માણેક સાથેના 'સંબંધ એમના આયુષ્ણના અંત સુધી વધુ ને વધુ નિકટનો, મૈત્રી અને સંસ્થાકીય સહકારી સુધી વિસ્તરી ગયો.' આમ, સમાજવાદી વિચારસરણીથી હિમત જીવેરી પ્રભાવિત હતા એને ૧૮૪૨ની 'હિન્દ છોડો' ચણવળ પછી તરત ૨૬ જન્યુઆરીએ ચોપાટી પર સ્વતંત્રતાની પત્રિજ્ઞા જીહેરમાં વાંચતી વખતે મિત્ર ભાસ્કર લાખાજી સાથે એ ગિરફ્તાર થયા હતા એને એમણે પછી જેલવાસ પણ વેઢ્યો હતો. હિમતભાઈ લખે છે, 'મારા એ પગલાને એ જમાનાની મારી બાબે (ધારીબાઈએ) નકાર્ય નહોંનું, એનું કારણ ગાંધીજીએ જમાવેલું આજાદીનું વાતાવરણ.'

આ જ કેફિયતમાં, છેલ્વે, હિમત જીવેરી પોતાના અંગત જીવનની વાત કરે છે. એ બેઠી લઈએ :

'મારું લગ્ન, ૧૮૫૮માં મંજુ દેસાઈ સાથે થયેલું. મંજુ એલ્ફિસ્ટન કોલેજમાંથી બી.એ. થયેલી. ૧૮૪૨ની લજતમાં એ પણ ગિરફ્તાર થયેલી. ૨૬ જન્યુઆરી, ૧૮૪૩ને દિવસે જ, વિલ વાર્લેમાં, એમનું આખું કુટુંબ લજત સાથે સંકળાયેલું હતું. પિતા વિક્લિવાસ પુ. દેસાઈએ ૧૮૭૨ની લજતમાં લાંબો જેલવાસ ભોગરેલો. પાલ્વ'

કોણેસમાં એ પ્રમુખ હતા. મંજુ લજત દરમિયાન માર્ક્સવાદ-ટ્રોટ્સીવાદની વિચારધારાથી પ્રભાવિત થયેલી. બોલ્શોવિક-લેનિનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (બીએલપીઆઈ) સાથે સર્કિય રીતે જોડાયેલી, જે પાર્ટી ૧૮૫૦માં સોશ્યાલિસ્ટ પાર્ટીમાં ભજી ગયેલી. ૧૮૫૨ પછી રાજકારણમાં સર્કિય રહી નહોંતી. માર્ક્સવાદમાંથી એનો રસ ધીરે ધીરે ઘટતો જતો હતો, સમાજપદ્ધિયાને સમજવા માટે, એની સમજશા પ્રમાણે, એ પૂર્વપૂરો સમર્થ નહોંતો. જો કે એ વિચારધારા જ્ઞાનવી - સમજવી એને જરૂરી લાગે છે. એ વિશે એણે પોતે જ લખ્યું છે.

'લગ્ન પછી એ ક્રાંતિસ ગુજરાતી સભા સાથે કર્મચારી (મદદનીશ સેકેટરી) તરીકે જોડાયેલી - અને છેલ્લે સભાના "ત્રેમાસિક"ના સંપાદક તરીકે એણે વર્ષો સુધી કામ કર્યું હતું. જ્યાંથી એ હમણાં જ ૨૦૦૮માં મે મહિનામાં નિવૃત્ત થઈ છે. અમારે બે સંતાનો, પુત્ર અમિત અને પુત્રી સોનલ. સોનલ ૧૮૮૮માં અકસ્માતમાં ગૂજરાત ગઈ. અમિતે ૧૮૮૮માં સ્વના શાહ સાથે લગ્ન કર્યું. એમને બે દીકરીઓ ગીઝા અને આશના છે.'

મંજુબહેનના દાદા પુરુષોત્તમ દેસાઈ એક દા દક્ષિણ આફિક્સ હતા અને મોહનદાસ ગાંધીજીના કારોબારમાં સર્કિય હતા.

મંજુએ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, ૧૪ સપેન્બર ૧૮૮૮ના રેજન્મેલા હિમત જીવેરી આરંભે લુબિક્ટિંગ ઓર્ફિલ અને ગ્રીજના વ્યાપારમાં સંકળાયા હતા. એમના મોટા બનેવીના એક નાના ભાઈ, મધુભાઈ પારેખ અને પોતાના ભત્રીજી અરવિંદ જીવેરી એમના સાથે હતા, એમ સંબંધે છે. હળવે હળવે એમણે એ ધંધો ધાજ્યો અને પછી વધુ ને વધુ કલમને ખોળે એ રદ્દા હોય, એમ અનુમાન છે. એમની કને ઓળખાણની જાણ હતી. પરિચિતો, સેન્હીએ અને સંબંધીઓને એ ઓળખાણનો લાભ એમણે આપ્યો છે. અને લેવા ય દીધો છે. ખુદ, એ કંચાં ય ખરદાયા નહીં. ન એમણે ખુદ કોઈ લાભ લીધો અને પરિવારને પણ તેનાથી પર રાખ્યું. એ નાખશિખ પવિત્ર, આદર્શ મનેજ તરીકે જ ખુમારીથી જીવ્યા છે.

પોતાના પરમ મધુ દર્દવતે વિશે એમણે લખ્યું છે : 'દાહ્વતેમાં આપણે જોયું કે વૈક્ષાનિકતા, માનવતા, સમાનતાનો ત્રિવેણીસંગમ છે, એમ સાહિત્ય - સંગીત - કલા તેમ જ રાજકારણમાં રમ્યું સ્વભાવનો પણ ત્રિવેણી સંગમ છે. એનું વૈયક્તિક તેમ જ સાર્વજનિક જીવન આ બે ત્રિવેણી સંગમો પર ઊભું છે.'

સમતામૂલક હિમત જીવેરીને પણ આ તારણ મહદદઅશે લાગુ પડે છે. એમનામાં આ સંઘણ પ્રવાહી સમથળ વદ્ધા છે અને તેના કન્દમાંતક અને બુધ્ય સતત જવતા અનુભવ્યા છે.

-તમે આવી ચહુંજો!

લીમજાના ટેકે ગોઠવાયેલી હૃથેળી થઈનો જ એક ભાગ હોય એતો ને લંબાયેલો હાથ ડળ બનીને ટેકવે છે આપો એ આધાર ! એક ઢણી સાંજે ગુજરાતી સાહિત્ય પરિષદ ભવનના પ્રાંગણમાં એક સાવ સુકલકડી ટેલે જોઉં છું. જોથું ન જોથું કરીને જરૂરી પગચિયાં ચડીને પરિષદ કચેરીમાં પહોંચું છું ત્યારે પરિચિત દીવાલોનો ધોળો ધફ રંગ એ દશ આંખમાંથી આટોપી લે છે.

'પાકિસ્ટાન' નિમિત્તે મળવાનું થાય છે ત્યારે એ આખેઆખું દશ સ્પામે આવી જાય છે. પેલી હૃથેળી લંબાય છે. રમેશ ર. દવેનો અવાજ પહુંચ છે ને આખું એ અસ્તિત્વ ઓળખાય છે : મનેશચંદ કસારા.

એ વખતે લંન આવીશ એવું સ્વાનામાં પણ નહીં. એટલે પરદેશીઓને જોઈ જે અહોભાવ, ઈછ્યાં અને પરાણો ઊભી કરેલી નેપરવાઈ મનને પંપણી લે. એ બધું જો મનેશચંદને બરાબર હોય તો એ બરાબર કરીને લખી આપે. કરીને એટલે વિગતથી, જીજાવટપૂર્વક ! એમની વાર્તા 'પાકિસ્ટાન'માં વંચાઈ ત્યારે એ લંનગરા (લંનસર ?) ની ગુજરાતી ભાષા પરની પકડ અને કાઢું સંભળી માન થયેલું. પછી તો નીજી મિત્રો વચ્ચે લંનની વાતો ને સાહિત્યની વાતોમાં એ એવા પરોવાઈ ગયેલા કે મને એમની સાથે જરી વાત કરવાનો મોકો નહીં મળેલો. પણ વાર્તા એટલી સરસ કે થાય : વાહ, કસારાજી ! ને આ 'વાહ'ના વાતાકારનો સંગ્રહ પરિષદ કરવા ધારે છે એવું રમેશ ર. દવેને કહ્યું ત્યારે એમનું જુનું કરી વાંચેલું નહીં. પણ જે સંભળ્યું એનો પ્રભાવ મનમાં અકબંધ એટલે છાને ખૂબી ચિંતા પેઠેલી. 'આહ !' અમારા બન્નોના વાતાસંગ્રહ સાથે મૂકાશે ને મારો વાતાસંગ્રહ નહીં છાપાય તો પકાશક ખોળવા હું કર્યા જઈશ ? પણ બહુ થોડા વતમાં એ આહને હારી દીધી રઘુવીર ચૌથારીએ. 'બન્નોની પ્રતો માન્ય થઈ ગઈ છે.' સાંભળી મેં જે હાશકારો અને આનંદ અનુભવેલા એની વાત લંનમાં આવી મનેશચંદને કહી ત્યારે એમના બોખા મોંઝે પગટેલું ખુલ્લું હાસ્ય બરાબર યાદ છે.

હેલે મજાયા ત્યારે દીપાવલીનો અવસર ગયા પક્ષીની 'વાતાવર્તન'ની બેઠકનો હતો. હું સહેજ મોંઝે પહોંચેલો. એમણે સહજ નજર કરી, આંખમથી જ બાજુની ખુરશી ચીધી આપી. ને હું ઓપિનિયન / Opinion

બેસું એ પહેલાં જ મીઠાઈના ટુકડા મારી તરફ સરકારી, કાગળો સરખા ગોઠયા. મેં તો વલ્લભ નાંદ્ઘાના આસ્ત્રવાદની સાથોસાથ મીઠાઈનો રસાસ્વાદ પણ જતને પોરસ્યો. જરા ય બચબચાટ ના થાય ને કોઈનું ય થાન આપણી પર દોરાય નહીં એવી રીતે સીકેતથી મીઠાઈ ખાવાની મજા પડેલી. પણ વલ્લભભાઈનું વકતબ્ય પૂરું થયું ને મનેશચંદ એક ફેરીટી. મીઠાઈને બદવે તીથમાં ખાવી ફરજરતું ટીસ્યુ એમની આંખમાં બરાબર જીવાયું હશે, તે બોલ્યા : 'અરે ! મારી મીઠાઈ તમે ખાઈ ગયા ?'

ગુજરાતી ડાયસ્કોર્પિક સાહિત્યજગતના એક અગ્રગણ્ય વાતાકાર મનેશચંદ નાગરદાસ

કુંસારા હવે હ્યાત નથી એમ કહેવું, અનુભવવું આકરું લાગે છે. ૧ જાન્યુઆરી ૨૦૦૭ના એમણે વિદ્યા લીધી. એમને આપણી સ્મૃતિવંદના હાંજે. અનિલ વ્યાસના આ ચિત્રિકેખ વાટે આપણે સહ આપણી અંજલિ સહફદ્ય સમર્પિત કરીએ છીએ.

'ક્યાંય નહિ, કદી નહિ...' જેવો સરસ વાતાસંગ્રહ એમણે આપ્યો છે. એટલી જ બીજી, કદાચ, વાતાઓ અગ્રગટ પરી હશે. ક્રાએક એવનું ય સ્વાગત હાજે : તંત્રી

હું તો સાવ, ભીતે સુકાઈ ગયેલી વેલ જોવો ! એ સહેજ હસીને કહે, 'વાંધો નહીં. પણ મેં તમને નહીંતી આપી.' પછી વળતી મીઠાઈ લાવી આપી ઢાકો-ઢાંબો કરી લીધો ને એ ય મારી અવળચંચાઈ વીસરી ગયેલા. એ દિવસે નાં એ પક્ષીની નેટકમાં, બરાબર શાસ ચાલેલો. તિપુલ કલ્યાણીએ મને એમની સોપણી કરેલી. કાર સુધી તો આવ્યા, પણ પ્રાઈવ કરી શકે એવી હાલત નહીં. આખું એ ઉપરનું પાંજરણ ધમકણી જેમ ચાલે. બહાર સાંચ્ય સાંચ્ય પવન વીળાય. બાકી કમી પૂરી કરવા વરસાદ ને સીટમાં સીયરીઝ પર માણ્ય મૂકી હંક્ષાતા એ. એમની ઊંચી - નીચી થાતી પીઠ જોઈ થાય કે તાત્કાલિક ઇન્જેક્શન આપનું જોઈએ. કાં તો એમ્બ્યુલન્સ ... મેં પૂછ્યું પણ ખુલ્લા મોંઝે, કશેલા હેઠે એમણે ના જ પારી. મિનિટો વીતતી રહી. ન્રોક વાર પમ્પથી દવા લીધી ને સહેજ ઠરવા જેતું લાગ્યું. વાવાળોઝિમાં અમણાનું વૃક્ષ વાયરો

ધીમો પડતાં ફરજરે એમ ! પછી તો કાર પ્રાઈવ કરી, ને મને મારા થેર મૂકી જવા મમતે જરૂરી. સમજાયા. પણ મને બસ ન મળી ત્યાં સુધી બસસરોપ પરથી ન ખસ્યા. કે ન મને કારમાંથી બધાર કીમાં ઊભો રહેવા દીધો !

અહીં તો કોઈ નથી. હું સાવ એકલો. પેસા કમાવાની લાયે લંનમાં આવી પૂર્યો પણ જાને હાથ મૂકીને પૂછે કે 'કેમ છે ?' અરે, ખાલી આંખ મેળવી આપણાપણું ભજાવે એવું ય કોઈ ક્યાં છે ? ચામડી તત્ત્વજ્ઞતા તાપમાં કોઈ પોરો ખાવાનું સ્થાનક મળે. એવી એમની સારપ ને ધરપત, આ કાંશો આંખ બીની કરી મૂકે છે.

સરકોર લખવાં બેઠો છું એવું ક્યાં છે ? બધું યાદ કરું છું. કશું કમવાર નથી. વાતો એમ જ આવતી જાય છે કોઈ ફિનના દશ્યોની જેમ !

એ હાંકે છે. અવાજ જતો રહે એવું લાગે છે. શબ્દો સ્વરપેટીમં જ અમણાય છે પણ બોલવું છે.

વાતામાં શું જોઈએ ? વાતાના તાત્વો - શબ્દ - વાજન - કથાનક - મૂળ કથાનક ને એમાં આવતું પેટા કથાનક - પાત્રો - પાત્રોની માંહઙી - એમનું વર્તન અને કથાપ્રવાહ પરની અસરકારકતા - વાતામાં ઘટનાનું કલામાં ઝુપાતર કે સમગ્ર ઘટનાનું પ્રતીક બનીને મનુષ્યને જંકૃત કરવું - સ્તરદ કરી મૂકવું. ને ચયકૃત કે સાવ સાદો અંત ... બસ, એ હાંકાંતા શરીરમાંથી એરોક્સ મશીન થરથરતું જાય ને પ્રીન્ટાઉન્ટો બહાર આવતી રહે એમ સર્જસાર બધું નીકળતું જાય છે. ને છેલ્લે કહે છે : મારાથી કદાચ તનિયતના કાર્યો રોમિનારમાં ન અવાય તો આ છે મારી વાત !

પણ એ આવ્યા. એવનું જ નહીં સુપેરે સત્ર સંભાળ્યું. લેખકોને વાતા લખવા મિશે એમનું બાતું કટેલું બાબું એ તો એ સૌ જીશો પણ એમની પારોથી હું શીખ્યો છું લાઘવની કળા. ને પાત્રો એટલાં જ જોઈએ જે કથાનકને ઉપકારક હોય. એ ને મૂળ સિદ્ધાન્ત.

એમણે સમાંજ્ઞન કર્યું છે મારામાં બઠેલા વાતાકારનું અને વિદેશમાં રહી સાહિત્ય સર્જતા સૌ સર્જકોનું. એ થોડા ચીકણા લાગે. વાતાની નાનામાં નાની વિગતમાં ઊતરે. વાસ્તવ અને વાતાનું વાતસવ તપાસે. 'વાતાવર્તન'માં લેખકે પીધેલી ચા કે મીઠાઈ એને વાજ જેવી લાગે એવી

સૂક્ષ્મતાથી ચર્ચે પણ સંઘર્ષ કહેવાનો મર્મ એક જ કે આપણી સમજ ઉત્તરે ને બીજા દિવસથી ઈન્દ્રધનુના બીજેસમાં જગ્યા કરી આપેલી. વિકસે.

મનેશચંદ મૂળે સંગીતકાર. વર્ષો સુધી બિટનમાં સંગીતના પ્રાચ્યાપક

રહ્યા. એ પહેલાં આફિકામાં પણ એ મંજૂષ તો મોટી જ હતી. ભદ્રાબહેન

વજાપ્રમાન એ બધી વિગતોની વધારે ખબર છે. એટે એ લખશો ત્યારે

મનેશચંદના સપ્તકના એકેએક તાનપવટા ઓળખી બતાવશે, પણ મેં

એમને જોયા છે વાતાકાર તરીકે. એક સહદ્ય તરીકે. પણ સમજથ્ય છે -

સિતારના તાર પર એમને આંગળીઓ ફરતી હશે ને જે રવ ગુજરો હશે

એ રોંયલ આલબર્ટ હોલની દીવાલોએ સંઘર્ષો છે. એ જ લયબધ્યતાથી

સિતારના તાર કસતા હશે - મીઠા સારવતા હશે ને ટેરવાં જેવી રીતે સ્પર્શ

ને ભારનો સુયોગ સાચવી સંગીત રેલાવતાં હશે એવી જ તન્મપતાથી એ

વાર્તા લખતા.

દૂરી વાર્તા એમણે બહુ મોડી લખવી શરૂ કરી એટલે વિપુલભાઈને રંજ

રહે છે કે મનેશચંદ કંસારાને ઓછો કંસાર પીરસી એમને અરથે ભાસો

રાજ્યા. કદાચ એમને મન સાહિત્યજગત - સમગ્ર મનુષ્ય યુગ પણ. ભાઈ,

ઓછું જે છે, એ છે તો સોજણું? સંગીતકાર તરીકે આ દેશમાં એમણે જે કદું

છે એનો હિસાબ આપવાનું કામ એમના દીકરા ઈન્દ્રધનુને કહીએ. એમણે

'બાપુજી'ને જોયા છે. માઝ્યા છે, સંગત કરી છે ને તબલાની થાપ આપી

બાપને બીરદાવ્યા કે કસોટીએ ચંગવ્યા છે. જુગલબંધીની વાતો એ વધુ

સારી રીતે કરી શકશે. માત્ર બાપ - દીકરાની નહીં, સંગીતની, સરગમની

ને સરગમ પર થરકતા હૈયાઓની। એમના બીજા દીકરા પણ સંગીતનો

વારસો સાચવે છે. એ સંઘર્ષી વાતો પણ જો મળે તો માણસી ગમે એવી જ

હશે.

એમણે તો મારો દીકરાની ય ચિંતા કરેલી. મેં અછાતી જ વાત કરેલી કે

'મનેશભાઈ, મારો દીકરો ૧૫ દિવસ માટે આવે આવે છે ને હું જ્યા રહું છું એ

વાતાવરણમાં મારી ગેરહાજરીમાં મારે એને રાખવો નથી. એને કંઈક

પ્રવૃત્તિ મળે એતું થાય તો વધું સારું.' ને મનેશચંદએ મારો દીકરો લંજનમાં

એમની આ ઉદારતા ઉપકારરૂપે નહીં એમના વ્યક્તિત્વનો પરિચય

પામયા રૂપે નોંધું છું.

એ સમભાવ - સહભાગિતા - કાળજી - હુંફ ને પ્રેમ જે અનુભવાયાં છે, એટલે લખ્યા વગર રહેવાતું નથી.

મને એમના ગુણોનું વર્ણિંદ્રિય કરતાં ક્યાં આવતે છે?

મેં એમને જોયા છે વાતાવરીની ચર્ચામાં સાવ અંગત મિત્રને બિનંગત થઈને અટકતા. છીરિયાં ઉત્તારીને લખાજાણને તપાસતા. વાતાવરી - સાહિત્યની રિંતા કરતા. વિગતાદોષથી ઉકળી પડતા. મેં એમને જોયા છે શબ્દ સાથે કામ પાડતા. કસબથી છે। એ કસબ એટલે પૂરેપૂરી સભાનતાથી શબ્દને વાપરવાનો, તાવવાનો અને ગોઠવવાનો. આ આવતે તો વાર્તા બને જ.

રિપોર્ટ અને વાર્તા વચ્ચેનો ફક્ર સમજાવતા એ ધ્યાનધંજી ઉઠતા. ઘટના અને ઘટનાનું કલામાં રૂપાંતર એમને મનભાવન ને પેણ્ય હતા.

એ કસબી - વાતાવરી મરમી આપણી વચ્ચે નથી!

સાવ અચાનક એ નીકળી ગયા. પણ આપણાં વ્યક્તિત્વમાં કેટલાંક મૂળિયાં એટલા ઊંડા હોય છે કે ઉખજાં ઉખડતાં નથી.

હા, પ્રબોધ જોશીનું એક કાલ્ય એમના માટે -

અમે મોર હોઈએ તો -

અમારા ખરેલાં આંસુ વીણાજો.

વાદળ સમા તરતા પ્રસંગોને

અમે બોલાવીશું.

તમે વરસાએ.

આવતા ભરે

આ અધૂરી મકેલી કવિતાની

છેલ્લી પંક્તિ થઈ

તમે આવી ચઢાએ.

[94 Ealing Road, WEMBLEY, Middlesex HA0 4TH, U.K.]



મહ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું

‘યુગાનાના પાટનગર કર્મપાલામાં અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને આવરી લેતી એક માત્ર સંસ્થા ‘યુવક સંઘ’ (ધી યુથ લીગ)ની એક આગવી અને એ જમાનામાં અનોખી ગણી શકાય એવી પ્રવૃત્તિ એટલે રાસગરબા હરીકાઈ,’ એમ ડેરોસિથત આપણા જીજીતા શહેરી અને લેખક પ્રભુદાસ કુગનાથ માણેક લખે છે.

આ યુવક સંઘ દ્વારા આયોજિત રાસગરબા હરીકાઈનો પ્રારંભ ઈ.સ. ૧૮૮૫માં થયો હતો. આ સમયે કેન્યાના કિસુમુ શહેર ખાતે યોજાયેલી રાસગરબા હરીકાઈમાં તેણે ભાગ લીધો હતો અને પહેલા તથા બીજા નંબરના ઈનામો મેળવ્યાં હતાં.

પ્રભુદાસ માણેકના લખાણ મુજબ, આ રાસગરબા હરીકાઈ બાદ, કર્મપાલાના લુગોગો ઈન્જોર સ્ટેડિયમાં વિશ્વાણ પાયા ઉપર દર વરસે આવી હરીકાઈઓ યોજાવી શકુથયેલી. લોકો આત્મરત્નપૂર્વક આ અવસરની રાહ પણ જોતા. આ હરીકાઈઓ જોતી અને માણાવી એક લ્હાતો લેખાતો. દરેક માટે આ હરીકાઈ યાદગાર અવસર બની જતો પણ અનુભવાયો છે.


“ઓપિનિયન” ના જૂન ૧૮૮૮ના અંકમાં આ હરીકાઈઓનો સવિસાર ડેવાલ પ્રકાશિત થયો હતો, તે વાચ્યોને યાદ હશે.

એકાત્મન વર્ષ પહેલાં, રિસેન્ભર ૧૮૮૫ દરમિયાન, કિસુમુંમાં યોજાયેલી હરીકાઈમાં ‘યુવક સંઘ’ની બજિની મંડળની આ જીથ છબિઓ એ પ્રસંગની સુપેરે ચારી ખાય છે. અભીષ્ઠાલ દક્ષિણ લંઘનાના ટૂટીંગ બ્લૌડવેમાં વસતાં ઈન્દ્રબહેન લખાણી (માણેક) પારોથી આ છબિઓ સાભાર મેળવી શકાઈ છે.



‘મારવાડ’ ગરબા માટે બીજું ઈનામ મેળવનાર જીથની આ છબિમાં સૌથી પાછળ ઊભેલાં લક્ષ્મીદાસ સાકરિયા અને નવલબહેન સાકરિયા પછીની હરોળમાં (અબેથી) લીલાબહેન ઠક્કર, સરોજબહેન ગઢ્યા, હંસાબહેન ગઢ્યા, રંજનબહેન ભણ તથા રમાબહેન સાકરિયા જોવાં મળે છે. વચ્ચે ખુરશીમાં (અબેથી) બઠેલાં મંજુલાબહેન મોટી, કુદનબહેન વસાણી, સરોજબહેન ઠક્કર, સુરુબહેન શેઠ, ભાનુબહેન દવે, ઈન્દ્રબહેન માણેક અને કાન્તાબહેન દવે છે. પહેલી હરોળમાં (અબેથી) કલાકાર તરીકે સેવાઓ આપનાર શાન્તિલાલ દેવાણી, પુરુષોત્તમદાસ પટેલ, જિરિજશંકર વ્યાસ અને પ્રલાશંકર દવે જોવા મળે છે.

‘ગોવાળજા’ ગરબા માટે પહેલું ઈનામ લાવનાર જીથની, સામે પાને (પાનાં કર્માંક્ષે પરે) આપી છબિમાં, સૌથી પાછળ ઊભેલાં, સાથ આપનાર કલાકાર તરીકે પી. સી. દવે, શાન્તિલાલ દેવાણી, લક્ષ્મીદાસ સાકરિયા, પુરુષોત્તમદાસ પટેલ અને જિરિજશંકર વ્યાસ છે. જ્યારે તેમની આગળની હરોળમાં (અબેથી) કુદનબહેન વસાણી રમાબહેન સાકરિયા, નવલબહેન સાકરિયા, નિર્મલાબહેન બદ્ધિયાણી અને ઈન્દ્રબહેન માણેક દક્ષિણાન થાય છે. ખુરશી પર બઠેલી બહેનોમાં (અબેથી) મંજુલાબહેન મોટી, સરોજબહેન ગઢ્યા, સરોજબહેન ઠક્કર, હંસાબહેન ગઢ્યા, સુરુબહેન શેઠ, ભાનુબહેન દવે તથા કાન્તાબહેન દવે જોવાં મળે છે. આગલી હરોળમાં, અબેથી, મીનાબહેન પંજ્યા, લીલાબહેન ઠક્કર, રંજનબહેન ભણ અને દેવીબહેન ભણને જોઈ શકાય છે.



બેન ઉજ્જ્વળ ભરી બરીને તમો ગાડીમાં મુક્કા કરો છો
એનો અમને જરા પણ વાંદો નથી... પણ પહેલાં
મહેનાનીને જમ્મી તો લેવા દો?

mahendra

મહેન શાહનો આ કાર્ટૂન - પ્રવાસ, આ માસ દરમિયાન, ચોથા વર્ષમાં પવેશો છે. આપણે દટેક એમને બિરદારીએ અને સહદય અલિનાનની નવાજેશ કરીએ છીએ. અલબાત, "ઓપિનિયન" એ અવસરે મહેન શાહનો પોઝે છે અને એકમેકથી ચાલિયાત્માં હાલાચિત્રોની હારમાળા એ સતત પીરસ્યા કરે, એમ અંતરમનની વાંચના પણ કરે છે.

એમનો સંપર્ક : 201, Spencer Court, MOON TOWNSHIP, PA 15108, U.S.A.

e.mail : mahendraaruna@msn.com



'ગાન્ધી ઝરટી નો કાવ્યાસ્વાહ'

૦ નિર્મિશ ઠાકર

ગાળો બોલવાનું મન થાય...

ગાળો બોલવાનું મન થાય એવા મીત્રો કયાં છે?
પાગલની જેમ અસંબદ્ધ વાતો કરવાનું મનથાય
એવા મીત્રો કયાં છે?

હવે તો છે અંદેચી સાથે ફરતા
ધંધાની વાતો કરતા
જમાનાના આધીલ-મીઠીલ
હૃદ્યાધનના દીધીલ-મીત્રો
નીરાતે ન્યાય તોળનારા મીત્રો
જોખીજીખીને બોલનારા મીત્રો
બોલીને કરી જનારા મીત્રો
તાળી-મીત્રો, ચાળી-મીત્રો
સામાને શું લાગશે એવા વીચાર વીના
હલેસાં વીના હોડી હંકરવાનું મન થાય
એવા મીત્રો કયાં છે?
આપણે બારાત કાઢીએ
ત્યારે સામેથી મૈયત લાવે
એવા વીનંસંતોષી મીત્રો!
મીત્રો શોચા શોધાતા નથી
મૈની એક ઘટના છે.
ભીતરની એક રટના છે.
પણ હવે તો મીત્રો પહુંચા અને દુંગટના છે.
મુખમાં સાથે સુઅં
અને દુખમાં સાક્ષીભાવે જેયાન કરે
પણ મનોમન રુઅં
આપણી પંચપણ જીવે
એવા મીત્રો કયાં છે?
હવે તો દંતકથા અને કહેવતોના
છીએ ચાપ્યું અને કરવતના મીત્રો...
સત્તા અને મહત્તમાના
ખુશામત, ખટપટ અને ખતાના
શતરંજના પ્યાદાના અને પતાના
બગલ-બાજ અને દગલ-બાજ મીત્રો
-છેવટના મીત્રો કયાં છે?

- સુરેશ દલાલ

રસીસ્વાહ ...

ગારો બોલવાનું તો મન હો બૌ મન ધાય, હાં કે ! કોઈ ની મલે તો છેવટે
અરીસા હામે જઈને બી બે-ચાર ની ચોગનું ટાં હુઠી મને ચેન ની મલે !
અમદવાદીઓ તો છેનેમાને મનમાં બોલે, પણ ઝરટમાં લોકો ઓપનમાં
એવી મન મનની જોખે કે હાંભરનારો અભુંઓ છઈ જાય, તો બી એનો
છુટકો ની ધાય. ગારો બોલવાનું મન ધાય એવા મીઠો બી અમારે ટાં
ગળીએ ગળીએ મલે, સાલા સુદરે બી ની. હયું જોવો તો ગાર જ યાડ
આવે ! ગારોની બાબતમાં અમારા ઝરટીઓ ગોંડ-ગીફ્ટેડ, હાં કે !
સુરેસભેને એ ફેસીલિટી બોલેમાં તો કાંઈ મલે ? એટલે ઉત્તો એમને
કંટો છું કે ટેમે અમારા ઝરટમાં સોટલ ઠેરી જાય, પછી આ બાબટની કોઈ
કરીયાડ ની રેહે. અમારે ટાં એક વાર એંતું બી ડેયલું કે મારા એક ફેનુંને
ઓપિનિયન/Opinion

બોહરખ ચર્ચિંડો, એટલે મને હાવ ઉદ્યાદી ગાર બોઈલો, પછી... જવા જો
ની વાત ! નીમેશભેને કેયલું છ કે આચ્ચાડમાં મુર કાચ્યને વરગી
રેઝે, એટલે પણો મુર વાત ઉપર આવટો છું...

નીમેશભેને કેય કે આ કાચ્ય, કાંયં બી અસલી મીઠું છે નઠી-
અની મીઠી રહ્યસ્પર્સી ફરીયાડ લેઈને આવટું છે ! મને ટો ગોટારો એ
વાતનો કે અસલી મીઠને બી ગાર દેવાની ? ટો પછી... નકલી મીઠને હું
દેલું ?? સુરેસભેને ઉ ટો એ બી પુછ્યા માગણો છું કે ગારો બોલવાનું મન
ધાય એવા મીઠો ના બી મલે; પણ ટમે કઈ ગારો દેવા માગો છ કે ? આ
કવીટામાં બે-ચાર સેમ્પલ મેરીલા હોય ટો અમે એને લાયક મીઠો
હોલ્ડવામાં મહડ બી કરીએ ! નીમેશભેને કેય કે કાવ્યાસ્વાહમાં ટેમે
અસંબોદ્ધ વાતો ની કરટા; પણ સુરેસભેને એવી વાતો કરવા જ મીઠો જોઈયા
છે, એનું કંઈ ની ? સુરેસભેને કેય ટે લીલાં; ને ઉ કરું તે ગોટારા ?

અમારા ઝરટમાં બી અંદેચી ને ટાઈ-સુટવારા, સેલ્સમેન જેવા મીઠો
બૌ મલે. ડેસ્ટી કરો ટો માલ બજાડી ડેય, ને પછી હોઢ્યા ની જેડે !
કાગળ તો બધી કારા; એટલે બોલેમાં બી હૃદ્યાનું જેવા મીઠો અવેલેલા
ખરા. જોખી જોખીને બોલનારા મીઠો અમારે ટાં વદ્ધરો જોખે ટારે તો
ઉદ્ઘાદી જ જોખે ને બોયલા પછી ફરી બી જાય ! ચલો, ટાં હુઠી તો
હમજુંદું; પણ પછીની લીટીઓમાં ઉ ગોટારે ચર્ચિંડો !

હામાવારાને હું લાગછે, એ ટો વીચારનું જ પડે ની ! મીઠ્યા એટલે કે
ફેન્ઝરીપમાં હલેસાં વગતની હોઠી કાંઈ ચાલે ? હલેસાં વગર ટો હોઠી
કંદ્રોલમાં બી ની રેય; ને હામે વગર આવે તો હું કરો ? ઉ જો સ્ટીલરીંગ
વીનાની કાર સુરેસભેને આંદું, ટો એમાં એ મીઠ્યા ખાતર બેહે ખરા ?

જો કે એ પછીની પંક્તીઓમાં 'બારાટ' અને 'મૈયત'નો ચોંકાલી
મેલે એવો વીનીયોગ ડેયલો છ. (આ 'વીનીયોગ' એટલે હું ? એ પાણું
મારે નીમેશભેને પુછ્યું પહેલો) કવીટામાં છેલ્લે સુરેશભેને છીઠી, ચાપ્યું
કરવટ, ખુશામત, ખટપટ વગરેને મેલી અભીવ્યક્તીની ટીઝીક સભાનાટા
અને સર્જન પ્રથેની સીલ્યાગ સુજ વડે અનીર્વચનીય કાચ્યપદાર્થને
વચનબી કરતું ભાસા-સામ્ઝદ્ય લાખવી, એમના આંટ-જગટમાં રચાટા
સુક્રમ સંવેદનોના આવેલ રચીને વીલકસન કલ્પનપ્રયુક્તિઓ રૂવારા
સુરેખ વીચાર-પીંડ બાંધી આવી, વંજનાગર્ભ કલ્પનોની ભારીગર
મુશ્કો પ્રગટાવી, લયમહૃર્મય સર્ગસક્રી વડે એમની સબજાકૃત
લયલીનટાનું આંટ-સૌંદર્ય પ્રસરાવી, અપુર્વભાવછટાઓના બજુવીઢ
પરીમાન રચી આચલાં છ ! (આ છેલ્લું લામબુલચ્યક પણ કલાદ્રમક
વાક્ય નીમેશભેને મને કેયલું; એટલે એનો અઠ મને ખબર નઠી, સૌરી
હોં !)

સુરેસભેને હાવ નીરાસ છઈ જાય, એ પેલાં ઉ એમને કેવા માગું છ કે
છેવટનો એક મીઠો તો જોખે હોય જ, તે આપણે પોટે જ, હાં કે !

(સફબાવ : 'સન્દેશ-મહેશીલ' : વર્ષ : જે : અંક : ૮૦ : ડિસેમ્બર ૧૭,
૨૦૦૬ : 'સન્દેશ-મહેશીલ' માટે 'ઉંગાજોડણી' અને 'વીજા' ફોન-માં :
અક્ષરાંકન : uttamgajjar@hotmail.com)

મોનાલિસાનું સિમત

૦ હરનિશ જની

મોનાલિસાનું ચિત્રાયાદ છે ત્યાં સુધી. નવ વરસનો ચોથા ધોરણમાં હતો ત્યારે પહેલી વાર જોયું હતું. ત્યારે પંડ્યાસાહેબે મોનાલિસાના સિમતની વાત સમજાવી હતી. તે ઉમરે મને મોનાલિસા મરદ લાગતી હતી. અને સિમતની તો વાત જ નહોતી. વરસો પછી ખબર પરી કે આ જીટો તો કલરમાં છે. અમારી ગુજરાતી ટેક્સિબુકમાં તે જ્વેક એન્ડ હ્યાઇટમાં હતો. અને મોનાલિસા સિમત કરે છે તે તો આ ઉમરે ધારી ધારીને જોઉં તો પણ દેખાતું નથી. કદાચ મારી સિમતની વ્યાખ્યા જુદી હોય. સિમત કરીએ અને સામાને ખબર ન પડે એ સિમત શા ક્રમનું? સિમત તો એવું હોવું જોઈએ કે સામી વ્યક્તિને પણ સમજાય કે આ આપણા તરફ મલકાય છે.

૨૦૦૭ના ઉનાળામાં, હું અને મારી પત્ની, લુબના મ્યુઝિયમ સામે ઊભા હતા. અમારા દુર ગાઈડ કંબું હતું કે “તમારી પાસે બે કલાક છે. તમારે જો શોપિંગ કરતું હોય તો શોપિંગ કરો અને મ્યુઝિયમ જોતું હોય તો તેમ કરો. પરંતુ બે કલાક પછી આ શોપની સામે આવી જાઓ.” અમારી હિકરી એ કંબું હતું કે “તમારે લું જોતું હોય તો ઓછામાં ઓછ બે દિવસ જોઈશે.” અમારી સામેનું બિલ્ડીંગ જોતા લાગતું કે ખાલી બિલ્ડીંગમાં ફરતાં જ બે મહિના લાગે.

હવે અમારી સામે મોટી મુંગુષ્ઠા હતી અને ખડું પૂછ્યો તો મોટો પડકાર હતો. કે બે કલાકમાં શું કર્યું. મારી ઈચ્છા, બીજું કંઈ નહિ તો પણ વિનસ-૬-મેલનું સેટેચ્યું જોવાની હતી. અને સાથે સાથે મોનાલિસાનું પેઈટિંગ પણ જોતું હતું પત્નીની ઈચ્છા શોપિંગની હતી પરંતુ સમજાયું કે શોપિંગ ન્યૂયોર્કમાં કરતું સારું કારણે બાર્ગેરનની જે તક અમેરિકમાં છે તે પેરીસમાં નથી. બીજું એ કે પેરીસ રોજ રોજ અવાતું નથી. અને આવો અમૃત્ય સમય શોપિંગમાં ન વેજકાય. પત્નીને મનાવવામાં બલું વાર ન લાગી. તેનું કારણ મને પાછળાથી સમજાયું. કે તેણે મોનાલિસાનું ચિત્ર જોવાનું એક વરસ અગ્યાથી નક્કી કર્યું હતું. તેમાં તેણે ચિત્રકલા પ્રચેનો પ્રેમ નહોતો. પરંતુ તે તેની મિત્ર ચિત્રાની વાતો સાંભળીને કટાળી હતી. ચિત્રાબ્દને, છેલ્લા એક વરસથી મારી પત્નીનું જીવન તુચ્છ બનાવી દી ધૂં હતું. જીવનમાં તમે મોનાલિસાનું ચિત્ર ન જોયું હોય તો કંઈ જ જોયું નથી. અને હવે પેરીસમાં છીએ અને મોનાલિસા જીયા વિના જોઈએ તો ચિત્રાબ્દન મારી પત્નીનું જીવન બદટર બનાવી દે. ચાર સહીઓથી કલા રસીકીએ વખાશયું છે એટેલ નહિ પરંતુ ચિત્રાબ્દને બોલતા બંધ કરવા પત્નીએ શોપિંગની જર્યાએ મોનાલિસને જોવાનું નક્કી કર્યું હતું. અમે મ્યુઝિયમની ટિક્ટ લીધી ત્યારે મ્યુઝિયમના ગાઈજે મે વિનસ અને મોનાલિસાની પ્લ્યુપરટ કરી અને અમારી ઈચ્છા બાતાની. તેણે હસતાં હસતાં સમજાયું કે બન્ને દેવીઓ એકમેક થી વિરુદ્ધ દિશામાં બિરાજમાન છે.

લું માટે કહેવાય છે કે તેમાં મુલાકાતીઓ બે સવાલ ખાસ પૂછે છે કે બાધુરૂમ કયાં છે? અને મોનાલિસા કયાં છે? તો અમે બીજા નંબરનો પણ ક્રેટ ટેર ટેર ઉભેલા ગાઈજે ને પૂછ્યા મંદ્યાઓ. મોનાલિસા કયાં છે? કેચ લોકો ઈંગ્લીશ બોલવામાં નાનમ સમજે છે. છતાં મોનાલિસાનું નામ સાંભળતાં હાથથી સમજાવી દેતો કે આગળ જાવ. હવે મને પાછી ચંદ્યું કે આપણા હાથમાં મ૱પ છે, અને લોકોને પુછીએ તે કેમ ચાલે? મ૱પમાં ન જોઈએ? તે જ મારી મોટી ભૂલ હતી. મ૱પ પ્રમાણે અમે ચાલવા મંદ્યાં અને કેટકેટલા ય હાલ્માં થી પ્રસાર થવા લાગ્યા. દેરેક હાંલ અસર્ય ચિત્રાથી ભરેવા હતા. મોનાલિસા તી કેવી હોણો તે હરિ જાણે. પરંતુ લુબના બીજા ચિત્રો કંઈ ઓછા મુલ્યવાન નહોતાં સુંદરતા અને કલાથી ભરપુર જાણાયા અજાણાયા ચિત્રકારોના ચિત્રો પદશીત કરવામાં આવ્યા છે. અને આવા હજારો ચિત્રો છે. વચ્ચે વચ્ચે એ

ઊભા રહીને આ પેઈન્ટિંગ્ઝનો પણ વાબ લેતા હતા. અમે કેમેરા થી તેના શીટા પણ પાંજાતાં તે પેઈન્ટિંગ આગળ કોઈ નહીંતું જાણો કે અમારા આવવાની રાહ જોઈને ઊભા હતા. લાગ્યું કે માનવ મહેરામણ મોનાલિસને જોવા ગયો છે. પછી મ્યુઝિયમના એક સ્વયંસેવકને મોનાલિસન વિશે પુછ્યા, તેણે જ્ઞાયાયું કે અમે ખોટી દિશામાં જઈ રવ્યા છિએ. મ્યુઝિયમનો નક્કો હાથમાં હોવા છતાં જોટી દિશા? પરંતુ અમે બનનું કંઈ અધ્યાત્મિનથી. કારણકે અમે જર્યાથી પ્રવેશયા એ દરવાજાની જર્યા એ બીજા દરવાજા પર મે ચિન્હ કર્ય હતું. એક તો સમય ઓછી અને એમાં મારી ભૂલ. પછી જોઈએ છે જ શું? હું આજુબાજુ ચિત્રો જોવાના ફંક્ષન મારવા લાગ્યો અને પત્નીએ હું કેટલો હેલો હું એ યાદ કરાયું.

તેવામાં મારી સમક્ષ “મોનાલિસા” નું અંશો વાળું સાઈન નજરે ચંદ્યું. અને અમે સાથે નક્કી કર્યું કે એ સાઈને શીલો કરો. હવે મારી શારીરીક મુશ્કેલી એ હતી કે મે થોડ વખત પહેલાં જ બાય પાસ સર્જરી કરાવી હતી. એટેલ જરૂરથી ચાલવાનો તો સવાલ જ નહોતો. મારી પોતાની એવી ઈચ્છા હરી કે આપણને આ મ્યુઝિયમમાં હાઈ એટેક ન આવે તો સારું. અને હાઈ એટેકને જો આવવું જ હોય તો મોનાલિસના પેઈન્ટિંગની સામે આવે તો આપણને ઈંગ્રેઝેનલ પ્રેસમાં ચમકવાનો ચાન્સ મળે ન હાઈ એટેકને જો આવવું જ હોય તો મોનાલિસના પેઈન્ટિંગની સામે આવે તો આપણને ઈંગ્રેઝેનલ પ્રેસમાં ચમકવાનો ચાન્સ મળે.” ઈંગ્લેની દ્રાવેલ ટુરમાં ગૈલે ભારતિય અમેરિકન સિટીઝનને ઈટાલિયન આર્ટિસ્ટના પેઈન્ટિંગ સમક્ષ ફંસમાં આવેલો હાઈ એટેક. “વિશ્વ વિષ્યાત નાયગરાના ધોધ પર લોકોને મરતાં સાંભાય્યા છે પણ મોનાલિસાવાળા એંશોને શીલો કરતાં કરતાં એક લાંબી લાઈન પર આવી ગયા. મોનાલિસાની લાઈન હોય સમજુને ઊભા રહી ગયા. પછી બાતી થઈ કે માણું મોનાલિસને જોવામાં સ્વી પુરુષની લાઈન જુદી કેમ? પછી સમજાયું કે અમે મોનાલિસન કરતાં પણ વધુ અગત્યની લાઈનમાં ઊભા હતા. બાધુરૂમની. હવે ઊભા જ રવ્યા છિએ તો એ પણ પતાવીએ. અમે સમજુને ઊભા રહ્યા. ત્યાંથી નિકાનીને અમે એક જબરદસ્ત મોટી સ્ટેર્કેસ પાસે આવી પહોંચ્યા. બનગભ પચાસ એક પગથિયાં હતા. હવે ઉપર ચંદ્યું કે ન ચંદ્યું એ દ્વિધાયા પહ્યા. એકિવેટર શોધવાનો સમય નહોતી અને પગથિયા ચઢવાની તાકાત નહોતી. તેમ છતાં ધીમે ધીમે ઉપર ચઢવાનું નક્કી કર્યું. જાન જો તો મોનાલિસને જાતો. ઉપરના મારી પહોંચીને પાણી અરો શોધી ના હ્યો. આ રૂમને, તે રૂમ વટાવતા વટાવતા, છેવટે મોનાલિસાના રૂમમાં આવી પહોંચ્યા.

જાણે કોઈ ડિલ્બ સ્ટારને જોવા માટે માનવ મહેરામણ ઊભરાય એમ લોકો અહી ઊભરાય હતા. અમે છતાં કોઈ બોલીનુંઝી એકદ્રેસ ને માટેના ટોણાં કરતાં લોકો ઓછ હતા. એ તો સારું હતું કે મોનાલિસને હિવાલ પર અઠ દશ ફૂટ ઊચા એક યોધે ટેપરેચરવાળા કલોઝેટાં મુશ્કુલા હતા. હવે આં ધીમે ધીમે ઉપર ચઢવાનું નક્કી કર્યું. જાન જો તો મોનાલિસને જાતો. ઉપરના મારી પહોંચીને પાણી અરો શોધી ના હ્યો. અને કેવેલે જોવામાં હાથથી કોઈ કેમેરા હતા. પલ્લીએ લગભગ એક જાન વખતે પોતાનો શીટો, લેવાનું યાદ કરાયું હતું. ચિત્રાબ્દને બતાવવા નો ખાસ શીટો પાડવાનો હતો. દેરેકના હાથમાં શીટો કેમેરા અને ચિત્રાથી કેવી હોણો હતા. લગભગ દરેક જણ નજીકથી શીટા પડવાના ધર્શી રવ્યા હતા. જગતાના બધાં જ દેશોના લોકો હતા. આજ એવી જર્યા હતી ત્યાં આરબો અને જ્યુરીઝ લોકો ખને જાણા આવ્યા. મારી પત્ની મારાથી આગળ જતી રહી અને શીટો પણવા પોઝ આપ્યો. જેથી તે મારી સામે જુએ અને મોનાલિસાનું ચિત્ર પીઠ પાછળ આવે. ત્યાં તો મારી પાછળાથી ધક્કો આવ્યો. એક તંહુસ્ત ઈટાલિયન મહિલા મારી આગળ જવા મથતા હતા. પરિણામે હું પત્નીથી હુરુ હજુસેલાય ગયો. અને ફરીનિયન રૂપાળી છોકરીએ વચ્ચે આવી ગઈ. અને મારી ગરવી ગુજરાતાની તેમની પાછળ દ્વારાઈ ગઈ. વળી પાછળો શીટો લેવાનું નક્કી કર્યું. આ વખતે બે યુકેનિયન રૂપાળી છોકરીએ વચ્ચે આવી ગઈ. અને મારી ગરવી કર્યા જાણારી અજાણારી ચિત્રોનો પદશીત કરેલો હોણો. હવે મે ઘડિયાળમાં ટાઈમ જોયો બસ.

ઉપરવાને વીસ મિનિટ બાકી હતી. એટલે અમે ત્યાંથી નિકળવાનું નકકી કર્યું. અમે ભાગ્યા. બસના સ્થાને સમયસર પહોંચી ગયા. બસમાં જેઠા અને પટીએ કદ્યું “તે મોનાલિસાનું સ્માર્ટ તો બતાવ્યું નથી?” હવે એને ડેમ કરીન સુમજાનું કે ફેટા અને બસની છોકાણમાં હું જ મોનાલિસાનું રિપેટ જોવાનું વિસરી ગયો. અને એ ઓછું હોય એમ જ્યારે અમારી ટુરના ક્રીટા ધોવાવાને આવ્યા ત્યારે મોનાલિસાનો ફેટો જોવા કાઢ્યો. તે જોઈને મે પત્નીએ પહેલો સવાલ એ પૂછ્યો “ફેટામાં હું કયાં છું?” મે તેને ધીમે થી આ ચાસન આખ્યું કે “ફેટામાં આ બે રૂપાળી છીકરીઓ દેખાય છે ને તે બન્નોના ખબા વચ્ચે જે દેખાય છે તે તારુ માથું છે અને પાછળ મોનાલિસા નું ચિત્ર દેખાય છે.” મે ધ્યાનથી જીસુ તો મોનાલિસા હસ્તી હતી. હવે મારી શી દશા થશે એના ઘ્યારે.

‘ગાંધીજી, ચેપિલન અને હું –’ : પુસ્તક સમીક્ષા

૦ હરનિશ જાની

ગાંધીજી, ચેપિલન અને હું: જ્યંતિ

પટેલ : પ્રકાશક - નીલેશ પટેલ, 6, Sashidhar, Dr. Rajabali Patel Road, MUMBAI - 400 026 : પ્રથમ આવૃત્તિ : ૨૦૦૫ : પૃષ્ઠ - ૨૩૨ + ૨૪ : કિંમત - રૂ. ૧૨૫ : વિતરક - ગૂર્જર એજન્સી, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧

જ્યંતિ પટેલ, ‘રંગલો’ નામે આ લેખક યાને કે સ્વામી અભિનયાનંદનો સંપર્ક : 27979, Alta Vista Avenue, VALENCIA, CA 91355 [U.S.A.]

e.mail : ranglo@ranglo.com

થોડા વખત ઉપર હું મોરી રાતે ચાલી ચેપિલનની “લાઈટ લાઈટ” ફિલ્મ જોતો હતો. હાસ્ય કરતાં એમાં કરુણતા ઘડી છે. ચાલી ચેપિલનની એકટિગ કરતી વખતે આંખો મોરી નાની થતી હતી અને અંગળાં ઊચા નીચા થતાં હતાં. આ જો તાં લાગ્યું કે આતી એકટિગ મે કયાંક જોઈ છે. પછી ધ્યાનથી વિચારતાં, લાગ્યું કે જ્યંતિ પટેલ-રંગલો, જ્યારે વાતો કરે છે તો તેમના ચાલી ચેપિલન જેવા હાવભાવ થાય છે. આપણને લાગે કે ચાલી ચેપિલન તો એમની રોગમાં વહે છે. એમણે ચાલી ચેપલીનને એટલો પચાબ્યો છે કે એ અભાન પણ ખૂદ ચાલી ચેપિલન બની ગયા છે. ચાલી ચેપિલન મારા પણ પ્રિય રહ્યા છે. મરે એમની બધી ફિલ્મો જોવાનો ચસ્કો છે. અને પછી જો તમારે ફિલ્મનો ખરો આનંદ માણસો હોય તો ફિલ્મ જોયા પછી જ્યંતિ પટેલ સાથે વાત કરો. એ એટલા રસપૂર્ક ચેપિલનની વાતો કરશે કે આપણને થાય કે ફિલ્મમાં આમાંનું તો આપણે કાંઈ જોયું જ નહીં. એ સમજવા આપણે માછી ફિલ્મ જોવી પડે. એમ કહી શકાય કે જ્યંતિભાઈ, ચેપિલનને બરાબર સમજે છે. અને ગાંધીજીની ભારતની આજાદીની લહતમાં નાનપણથી સંકલપયાલા હતા. સત્યાગ્રહ ચણવળમાં તેમણે પગ ગુમાબ્યો છે. એટલે કહેવાય કે ગાંધીજી પણ તેમના લોહીમાં છે. જ્યંતિ પટેલ પોતાને તો ઓળણે જ છે. અંદર સ્વયં એમણે “લદ્દુ” ના નામે સામાન્યજનની વાતો કરી છે. આ

સામાન્યજન તે હું અને તમે. એટલે આ ત્રણનો સમન્વયનો નીચોડ એટલે આ પુસ્તક “ગાંધીજી, ચાલી ચેપિલન અને હું”.

આ અગ્રાઉ મે એમનો, આ જ વિષય પર સ્વાઈઠ થો. ચુનિયન ક્રોલેજ, ન્યુજર્સીમાં જીયો છે. માનું ચાલે તો એ સ્વાઈઠ શોની ચિત્રોથી ભરપુર એક પુસ્તકા એમની પારો માંગું. એમાં સ્કીન પર આવતાં ચિત્રો હોય અને એમની ક્રોમેટરી એક એક ચિત્ર સાથે છપાયેલી હોય. આવું જ કાંઈક તેમણે આ પુસ્તકમાં, જરા વધુ વિગતે રજુ કર્યું છે. લેખકે બીજ ગાંધીતનું એક સમીકરણ લીધું છે અને આ પુસ્તક દ્વારા એ સમીકરણ સાબિત કરી બતાવ્યું છે. આ સમીકરણ એટલે ગાંધીજીની ફીલોસોફી બરાબર ચેપિલનની ફીલોસોફી. અને તેમાં આપણું સામાન્યજન નું સ્થાન.



સ્વિટલેન્ડનમાં ચાલી ચેપિલનના નિવાસસ્થાનમાં
એમના પુત્ર માઈકલ ચેપિલન (પણે) સાથે જરૂરિ પેટેલ

સાત સામાજિક દોષો બાપુની પોથીમાં હતા. અને લેખકની દર્શિમાં આ સાત દોષો અજાણે ચેપિલનની ફિલ્મોમાં વણાયાલ નજરે પડ્યા. જે તદ્દન જુદી છંદગીઓ જુદી જુદી પટરીઓ પર દોડતી હતી. પટરી જુદી હતી. સ્વરૂપ જુદું હું પરંતુ માલ સરખો હતો. પહેલો દોષ સિધ્યાંતવિહીન રાજકારણ માટે ચેપિલનની ફિલ્મ, “ધ ગેટ રિકટેર” અને બીજા દોષ પરિશ્રમવિહીન ધનોપાર્જન માટે “ગોલ રશ” ગાડી શકાય. નીજા દોષ વિવકિષિન સુખ માટે “ડિંગ અંડ ન્યુઝોક” ગાડી શકાય. સંદર્ભાચાર વિહીન વાપારની વાત ચેપિલને ફિલ્મ “મોશેય વર્દ્દ”માં કરી છે. ચારિત્રવિહીન શિક્ષણની વાત તેમણે “ધ પિલિચિમ” અને “શોહર આમ્ર્સ”માં કરી છે. સંવેદનવિહીન વિશ્લાનની વાત “મોર્જન ટાઇમ્સ”માં કરી છે. અને છેલે લેખકને વૈરાગ્યવિહીન ઉપાસનાની ગાંધીજીની વાત ચેપિલનની ફિલ્મ “સીટી લાઈટસ”માં દેખાય છે.

આ બધી વાતોમાં જ્યંતિ પટેલના કટાક્ષ અને ફીલોસોફી ઉપરોક્ય છે. સિનેટિક આનંદ, હાસ્યાગ્રહ, લલ્લુ સમાજ વિગેરે શાબ્દ પ્રેગો તમને કક્ત જ્યંતિ પટેલ પાસેથી જ મળણે. એમ કહેવાય કે જ્યંતિ પટેલ સ્વાઈઠ ભાષામાં પુસ્તક લાગ્યું છે. સરદારજનો જોક સંભળીને હસીએ એવો વિનોદ નથી પરંતુ ઠેરે ઠેર સામાજિક કટાક્ષના સ્વરૂપે વિનોદ ફેલાવયા છે. શ્રી નિર્ણન ભગતની નોંધવાળું આ પુસ્તક આપકાં ઘરની લાયબ્રેરીનું ઘરેણું બની રહે.

[4 Pleasant Drive, YARDVILLE, NJ 08620,
U.S.A.]

સાહિત્યકારો અને સિવટ્રાલેન્ડ

વિશ્વના જીજીતા સર્જકોએ દેશવટો ભોગવવો પણ્યો ત્યારે તેમજે તેમના નવા સ્થળ માટે સિવટ્રાલેન્ડની પસંદગી કરેલી. આવા સર્જકોમાં બિટનના ગેહામ ગીન, આયરલેન્ડના જેમ્સ જોઈસ અને 'લોલિયા'ના જીજીતા સાહિત્યકાર રણિયાના નાબાકોવનો સમાવેશ થાય છે.

(૧) સિવટ્રાલેન્ડના પાટનગર બર્ન ખાતે એક પેલેસ હોટેલ છે જ્યાં બેસી નાબાકોવે અની અમરકૃતિ 'લોલિયા'નું સર્જન કર્યું હતું. નાબાકોવના અવસાન બાદ એનું પૂતળું પેલેસ હોટેલના પ્રાંગણમાં આજે ય ઊભું છે. સ્વીસ પ્રજાએ એ રીતે પૂતળું ઊભું કરી એની ચિરસમૃતિ જીળવી રાખી છે.

(૨) એ જ રીતે આયરલેન્ડના સર્જક જેમ્સ જોઈસે એના દેશવટા દરમિયાન સિવટ્રાલેન્ડમાં રહેવાનું પસંદ કર્યું હતું. અહીં જ એણે જ્યુરિક ખાતેના વસવાત દરમિયાન 'યુલિસિસ' ફ્રિન્નું સર્જન કર્યું હતું. અવસાન થયા બાદ એની ચિરસમૃતિ જીળવવા જલ્દીનમાં જે હોટેલ પબનો ઉપયોગ કરતો તે હોટેલના બારના અંદરની બેઠકવાળા ઓરડના પાટિયાં લાની જ્યુરિક ખાતેની હોટેલ, જ્યાં તે પગમાં જતો તેને શક્ષાગરવામાં આવી છે. ૧૯૭૭થી એ હોટેલનું નામ પણ રાજ્યું છે : 'જેમ્સ જોઈસ પબ'.

(૩) બિટનના ગેહામ ક્રિનેપણ એની પાછલી જિંદગી સિવટ્રાલેન્ડમાં ગાળી હતી. અહીં જ ૧૯૭૧માં એનું અવસાન થયું હતું. લેક લાનિવાની ઊંચી ટેક્સીઓમાં કોનિફરસ - શંકુદુમ ગાડી વર્ષે સ્વર્ગસમા આ સૌદર્યાધમ સ્થળે માનવજીવન સાથે સંકળાયેલ સદ - અસદ, સ્વર્ગ - નરક પાપ - પુષ્યની ઘામિક માન્યતા સંબંધી જેણે આજીવન દ્વારા અનુભવ્યું હતું તેવા ગેહામના આત્માનો અંતિમ વિધિ થયો હતો. આ વિધિ વખતે કુંભુલીજીનોની હાજરીમાં પટી વિવિયન અને પિયા યેવોની બાજુબાજુમાં હાજરી સૂર્યક હતી. અંતિમ વિધિ કરવાર પાદરી સાથે તેણે એનનો પ્રવાસ ખેજ્યો હતો. તે વખતે એમની વર્ષે થયેલ ઘર્મચર્ચાનો પહ્યો પાછળથી એની એક નવલક્ષામાં પહ્યો દેખાય છે. અંતિમ સમેયે ગેહામે એ જ પાદરીને બોલાવ્યો હતો. તેની હાજરીમાં શાંતિથી જીવ છોડી, ચિરનિદ્રામાં પોડી જઈ, પ્રભુપિતાના સાનિધ્યમાં તે ઉપરી ગયો હતો, તે પણ એટલું જ સૂર્યક હતું.

(૪) જૂન જમાનામાં લેખકો - કવિઓ અને અન્ય કલાકારોને રાજ્યનો આશ્રય મળતો. રાજીવિઓના દરબારમાં આવા સારસ્વતોની હાજરી સૂર્યક લેખાતી. ઝાસમાં ૧૭૫૦માં ફેરિક ધ ગેટનો આગ્રહ હતો કે વોલ્ટેર જેવો તે સમયનો મહાન વિચારક અને અને કવિ, નાટ્યકાર અને ઈતિહાસવિદ મનીજિને રાજ્યાંત્રિત રહેકાશમાં રહેવા કર્યું હતું. આવો વસવાત એટલે રાષ્ટ્રકવિ અને શાપરનું બહુમાન ખરું, પણ તે સાથે ફેરિકની રચેલી કાબ્યકૃતિઓમાં યોગ્ય સુધ્યારાવધારા કરી નવેસરથી એ કાલ્યોનું 'સર્જન' કરવાનું હતું. વોલ્ટેર જેવા મહાન કવિ માટે એનું કરવાનું શક્ય ન હતું. પરિણામે તેણે એવી કામગીરી બજ્જાવવાનો ઈન્કાર કરતાં તેને બરતરફ કરવામાં આલ્યો હતો. તે પેરિસ ખાતે પાછો ફરતો હતો પણ સત્તાવાળાઓની જલગારી, સત્તામક્કી થતી રહેલી. અઢરમી સદીમાં એક સત્તાધારી રાજીવી, કવિલેખકોને કેવી કેવી રીતે પોતાની સત્તાનો પરચો બતાવતા તે આથી સ્પષ્ટ થતું હતું.

વોલ્ટેર આવી કપરી રિથ્યિતિમાં પણ અણનમ રહ્યો હતો. પોતાનાં સર્જનની આવક કરતાં તેણે કરેલ મૂરી રોકાણથી થતી આવક પર તે પોતાનો જીવનનિર્હિત કરતો અને લાનિવાની નજીક ફરી ખાતે રહેલો.

એક રીતે કહીએ તો તેણે સ્વેચ્છાએ દેશવટો સ્વીકાર્યો હતો.

(૫) જમનીના પત્રિકિત નવલક્ષાકાર હરમન હેસને ૧૯૪૮નું નોબેલ પારિતોષિક અનાયત થયું હતું. થોડા સમય પર જ એની ૧૨૫૮મી જમન્જયંતી ભારે ઉત્સાહથી ઉજવાઈ હતી. તે તેની નવલક્ષાઓ માટે અને અનાં ખાલાની નિર્મન નિર્મણનો માટે જીજીતો હતો. એની ખૂબ જ જીજીતી નવલક્ષાઓમાં 'ટ્રીપ ટુ ઓરિયન્-ટ' (૧૮૮૨), 'અંસ્ટ્રો ઓફ યુથ' (૧૯૯૮) ઉપરાત 'સિધ્યાર્થ'નો સમાવેશ થાય છે. આ પ્રસિદ્ધ નવલક્ષામાં એનો નાયક ભારતીય નાવિક છે.

પિંજસાહિત્યના ઓવારા પરથી

૦ બળવંત નાયકો

હરમન હેસ મૂળે ભારતીય વંશનો છે. જન્મ કેરળમાં, એનાં માબાપ મલ્યાલમભાષી હતાં. એટેલે જ એનાં સાહિત્યમાં હિન્દુ અને બૌધ્ધ સંસ્કૃતનો સુમેળ સધાતો દેખાય છે. ભારતીય લેખકો અંગેજમાં નથી લખતા તે સંબંધી એનું એનું મંત્ર્ય હતું કે તેઓ (ભારતીય લેખકો) પોતાના જ પ્રશ્નોમાં એવા અટવાયેલા છે કે તેમાંથી તેઓ બહાર આવી શક્યા નથી. મોટા ભાગના લેખકો લેખનને એક પ્રકારનો વિધિ જ સમજે છે. હરમન હેસ એનાં પત્રિકાવંત સર્જનો માટે અમેરિકાની યુવા પેઢીમાં ખૂબ જ પ્રિય લેખક બન્યા હતા.

હરમન હેસે ૧૯૮૧થી જીવસ નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હતું. અને તેની વૃધ્યાવસ્થા સુધી તે ત્યાં જ વસ્યો હતો. વૃધ્યાવસ્થામાં પલોંડ વાળીને બેસી રહેવામાં તે માનતો ન હતો. વૃધ્યાવસ્થા એને મન માનવજીવનનું બીજું બાળપણ. એનું એને સૌથી વિશેષ ગૌરવ. અને તેને લીધી જ એ ભારે ખુમારીથી જીવન જીવી ગયો હતો. એના સિવટ્રાલેન્ડના ઘરના દરવાજા પર મોટા અભરે વૃધ્યત્વની ખુમારીની ક્રિતિ લાખી છે. એ કાલ્યનો ભાવાર્થ : માઝના જ્યારે એની પાછલી અવસ્થામાં જીવતો હોય ત્યારે તેણે તેણાં નિયત કાર્યો પૂર્ણ કર્યું હોય છે. આવા સંપૂર્ણ દીઘયુમાં જીવતા વૃધ્યાને શાંત રીતે મરવા દેવો જોઈએ.

[48 Shackleton Road, SOUTHALL, Middlesex, UB1 2JB, U.K.]

ગાંધીની કુંપળો

★ દૃષ્ટાંત પંડ્યા

"ઓપિનિયન"માં, એક દા સિલસિલાબંધ, પ્રકૃત્લ બા. દવની જે લખાશ્રી પ્રકાશિત થયેલી તે પુસ્તકા, ગાંધીની કુંપળો : ડૉ. પ્રકૃત્લ દવ : વિચારવલોણું પરિવાર વતી દીપક સોમપુરા, ૧૦૩, સુયોજન કોમ્પ્લેક્સ, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૮ : પ્રથમ આવૃત્તિ : અંગ્રેસ્ટ, ૨૦૦૫ : પૃષ્ઠ - ૭૨ : કિનત જીજીવી નથી

'ઈન ધ કુટસ્ટેપ્સ ઔંગ ગાંધી' નામના કથેરાઈન ઈન્ચ્રામના પુસ્તકમાંથી તારવેલું 'પુસ્તક' તે આ પ્રકૃત્લ દવ કે કૃત 'ગાંધીની કુંપળો'. આ નાના પુસ્તકની બે વિશેષતાઓ ધ્યાન ખેંચો છે.

(૧) મૂળ પુસ્તક કોઈ ભારતીય લેખકની કૃતિ નથી, પણ એક વિદેશી મહિલાની કૃતિ છે. (૨) એ પુસ્તકમાં અપાયેલી બારેય કથાઓનાં નાયકનાયિકાઓ પણ જગતના બિન્ન બિન્ન દેશનાં છે - એમની અસર કેવી તો દેશકાળથી પર છે, તેનું સ્પષ્ટ નિર્દેશન છે.

આ બંને વિશેષતાઓ ખરેખરી રીતે તો ગાંધીની જ વિશેષતાઓ છે - એમની અસર કેવી તો દેશકાળથી પર છે, તેનું સ્પષ્ટ નિર્દેશન છે.

ગઈ, ૨૦૦૫ની ગાંધી જયંતી પ્રસંગે "ગાંધી અંદું હિન્દુયા" એ સુરતની ઉચ્ચ શિક્ષણની એકાડમે સંસ્થાઓના વિદ્યાર્થીઓના - કદાચ સાવ ઉપરથિલાં - સર્વેક્ષણને આધારે તારણ કાઢ્યું હતું કે, 'ગુજરાત ગાંધીને વીસરી ગયું છે.' મારા નમ મતે એ દોષ એ વિદ્યાર્થીઓનો છે તેના કરતાં જ્યાં ય વધારે, એ વિદ્યાર્થીઓના વીલોનો, એ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી શિક્ષણસંસ્થાઓનો ને શિક્ષણસંસ્થાઓના અભ્યાસક્રમો નક્કી કરનાર સરકારી શિક્ષણ ખાતાઓનો છે અને યુનિવર્સિટીઓનો છે. ગાંધી વિશે બીજુ કે ત્રીજુ ચોપડીમાં એક પાઠ હોય કે આધીનવમીના ઈતિહાસમાં બે કડિકા ખીથે તે પૂર્ણ નથી જ.

દાંડીયાત્રાને પોકોસો વર્ષ પૂર્ણ થયાં તે પ્રસંગની ઉજવકીમાં ઉમંગભેર ભાગ લેવા વિવિધ દેશોના વાસીઓને આવવાની પ્રેરણ આપનાર તત્ત્વ કર્યું હતું? ગાંધીવિરોધના દોર પર લટકતી ગુજરાત સરકાર એ પ્રસંગે કશ્યું જ ભાવતમક કહે એ આશા જ વર્થું પણ, ગાંધીના નામ સાથે સંકળાયેલી સંસ્થાઓ, બીજુ જાહેર વ્યક્તિઓ પણ મૂક્યે પ્રેક્ષકો જ બની રહી. અમદાવાદ જોવા દોડી આવતા પર્યક્તિને હાર્ટવ-ઈન-સિનેમાનું આકર્ષણ છે, સત્યાગ્રહ આશ્રમનું નથી. દશ્કણ આંકિકાના મોરિટ્સબર્ગને સેશને હહદૂત કરીને ગાંધીમાંથી ઉત્તરેવા ગાંધીની પ્રતિમા છે. સાબરમતીને કે અમદાવાદના સેશને?

ગુજરાતની ગાંધીઉપેક્ષાની આ મનોદશ કરણતા ઉપજાવે તેવી છે. આ સંજોગોમાં પ્રકુલ્પ દેવનું આ નાનકંહું પુસ્તક આપણા ઉદ્દેગને શમાવવાનું કાર્ય કરે છે. કેટલા બધા વિવિધ દેશોમાં ગાંધીની કૂપુણો ફૂટી નીકળી છે। એ લેખકોમાંથી કોઈના ચક્ષુઓને ગાંધી દર્શનનો લખાવો મળ્યો નથી. પણ એ સૌ ગાંધીના શંદથી અને ગાંધીના જીવનથી પ્રભાવિત થયાં છે. 'મારું જીવન એ જ મારી વાણી' એમ પોતાની વિદાયની પૂર્વસંધ્યાએ લખનાર ગાંધીજીના બળુકા શબ્દ પાછળનું બળ એમનું પુષ્પશ્લોક જીવન છે. રોજના કરોડો શબ્દો દુનિયાભરનાં અખભારોમાં અને સામન્દ્રેશીમાં છાપાય છે, વિવિધ સભાસમિતીઓમાં ઉચ્ચારાય છે ને વિશ્વભરના સંતો, પાદરીઓ, મૌલિકીઓ આચયે છે. એમાંના કેટલાક શબ્દો બીજીઓની લોચ ઢાળવા અને બીજીઓની દેવસ્થાનો તોડવા ઉશ્કેરવાનું જ કામ કરે છે. આ ગાંધીવિરોધી ધૂવનિંહું છે. આ રીતે લોહી લેવા અને મારી નાખવા આવનારની સામે પ્રેમપૂર્વક ઊભા રહેવાનું ડિમતપૂર્વક ખર રહેવાનું અને હહાલ થઈ જવાનું કોઈ ઈસુ કે કોઈ ગાંધી જ કરી શકે, અને પોતાના એ બલિદાન દ્વારા વિશ્વને પ્રેરી શકે.

'આજના જમાનામાં ગાંધી અપ્રસ્તુત છે', એમ કહેનારને માર્ટ્ઝિન લ્યૂથર કિગ અને નેલ્સન મ-ટેલાનાં કાર્યો ઢેલ વગાડીને કહે છે કે ગાંધી કોઈ કાળે અપ્રસ્તુત બની શકે જ નહીં. કેવી મહાસત્તાઓ સામે, રંગદેખના કેવડા મોટા પૂર્વગણ સામે બનેને બાથ ભીતી હતી? આ પુસ્તકમાંનો મુખારક અપવાદ પેલેસ્ટિનિયન આરબ છે. ઈન્ટેક્ષાના અહિસંક અંદોલનનો પ્રારંભ કરનાર મુખારક 'પેલેસ્ટાઈનના ગાંધી' તરીકે ઓળખાય છે. જો કે એ પોતે એ માન સ્વીકારવા તૈયાર નથી.

જ્યેં બાયેઝને કાવેક માતાપિતા તરફથી શાંતિના સંસ્કારો મળેલા. વિયેટનામ યુધ વેળાએ, બોબ હોપની માફક, અમેરિકન સૈનિકોને ખુશ કરવા જવાને બદલે એ - હોયો મીન્હના - ઉત્તર વિયેટનામાં ગઈ અને, અમેરિકા વિરુદ્ધ તેને ટેકો આપ્યો. પરંતુ એ કમ્યુનિસ્ટ સરકારે માનવઅધિકારોનો ભંગ કર્યો ત્યારે તેણે તેણે જીરદાર વિરોધ પણ કર્યો.

અલબત્ત, ડાબેરીઓ માટે આ ગમતી વાત ન હતી. એણે સ્પષ્ટ કહ્યું છે કે 'યુધમાં જવાનો મરે છે તેની ચિંતા આપણો નથી કરતા. પરંતુ અહિસંક સંઘર્ષમાં મરે છે તેના વિશે ખૂબ ઉલ્લાપોહ કરીએ છીએ ... અહિસા માટે વધુ હિતમાં અને બાળદુરી જોઈએ.'

આ નાના પુસ્તકમાં થીક જાહ ધાન વિયેટનામી છે, દલાઈ લામા ટિબિટના છે, સિંગર ચાલે મૂળે મેડિસકન છે, એરિયરને સિંહલ (શ્રીલંકાના) છે, અમેરિકન જોઓના મેરી શ્રીલંકાની સર્વોદય પ્રવૃત્તિમાં ઝંપલાવે છે, જાયેન નેશ અમેરિકન હબર્સી છે, બધાર ડેવિડ સ્ટીલ રાસ્ત ઓસ્ટ્રેલિયાન છે અને ડેસમન્ડ ટુટુ દશ્કણ આંકિકાવારી છે. આમાંથી કોઈએ પોતાનાં ચર્મયશ્યુથી ગાંધીને જેણા નથી જ. એ સૌએ ગાંધીના શબ્દો વાંચ્યા છે અને અસ્તરાની ધાર જેણા એ શબ્દોએ એમનાં હિલ હલાયાં છે. ડિસ્ટાની સાથે, બળવાન પ્રતિસ્પદ્ધાની સાથે જ વિના ખર રહેવાની પ્રેરણ આપી છે અને we shall overcomાએ દંડ શ્રદ્ધા આપી છે. આવી શ્રદ્ધા શૂળીએ ચન્નાર ઈસુ જ આપી શકે. બધા સાથીઓથી તજાયેલા છાતાં સત્યમાં અને અહિસામાં શ્રદ્ધા નહીં ગુમાવનાર ગાંધી જ આપી શકે.

આવું સુંદર - ભલે નાનું - પુસ્તક આપી ગાંધીની જીવલત જ્યોત તરફ આપણું ધ્યાન દોરવાનું પુષ્પકાર્ય કરનાર પ્રકુલ્પભાઈ દેવના લોહીમાં ગાંધી સંસ્કાર ધબકે છે. પિતા બાલુભાઈ પાસેથી તથા દાંડીયાત્રાના એક સૈનિક, કાકા બાલુભાઈ પાસેથી આ અમૂલ્ય વારસો એમને મળ્યો છે. વિમલાતાઈના સંપર્કે એને સદા પલ્લવિત રાખ્યો છે. કથેરાઈન ઈન્ગ્રામનું પુસ્તક આવી વ્યક્તિ પાસે સહજ આવી શકે. અને આનંદની વાત એ છે કે એ પુસ્તકનાં સન્તનાં ઈન્જેક્શનો આપવા ડંકટર દરે આ રીતે નીકળી પડે છે.

એક સૂરન કરાય ? ગાંધી તો બિદ્વમૂલ વરવૃક્ષ હતા. આ બધી એમની 'હહવાઈઓ' નથી ? આ દાઢાતોમાંની શ્રદ્ધાને સુંદર કરે એવી એક બાબતનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. અમારાં નિકટનાં સંબંધી એક અમેરિકન મહિલા રોમન ડેથલિક છે અને એક યદ્દીને પરણ્યાં છે. એમનો વીસબાવીસ વરનો પુત્ર, આ પુસ્તકમાંના ગાંધી માર્ગ ચાલીને ઈજરાયલીઓ અને પેલેસ્ટિનિયનો વર્ચે સુમેળ સથપાય એ માટે લેબનોન, પેલેસ્ટાઈન દોડી ગયો છે.

ગાંધીનો ઉરધ્વભક્ત ચોમેર સંભળાય છે. એના શબ્દનો પ્રેરક પ્રભાવ ચોમેર બળાય છે અને એ શબ્દ ઘરબાર, કરિયર બધું છીઠી, હિયાર વિના પણ સત્યનું અને પ્રેમનું કલચ પહેરીને નીકળી પડતા પારકી છીઠીના જગતલ આજે પણ છે.

પ્રકુલ્પ દેવનું આ નાનકંહું પુસ્તક એની પ્રતીતિ કરાયે છે. ડંકટર સાહેબને અભિનંદન, લોકસ્વાસ્ય સુધારવાનો આ નવો ચીલો પાહ્યાર માર્ગ. જિલ્લાબાય : "મિલ્યુસ", ૧.૨૦.૨૦૦૬

[Sannidhi', 5, Patel Colony, JAMNAGAR - 361 008, India]

સ્વીકારનોંધ :

વિકમ સંવત ૨૦૬૩નાનૂતન વર્ષ, ગાંધીના સ્વખના ભારતને સાકાર કરવા સમર્પિત થઈએ તેવી શુભકામનાઓ પાઠવતી મજેદાર પુરીસ્તિકા : ગાંધી દર્શન : સંપાદકો - ઉષાબહેન જાની અને ગુલાબભાઈ જાની : પ્રકાશક - સિસ્ટર નિવેદિતા પાલિકેશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૭, ભારત : પ્રથમ આવૃત્તિ - ૧૫.૧૦.૨૦૦૭ : ક્રિમટ ૩.૮.

બિટિશ વડા પ્રધાન બ્લેટરની

પોલીસ તરતપાસ :

પુખ્ત લોકશાહીની એક ઝાંખી

● વિપુલ કલ્યાણી

કોઈ પણ વડા પ્રધાનની અધિકૃત પોલીસ જુબાની લેવાઈ હોય, એવા કેટલા દાખલા, આજની તારીખે, ઈતિહાસને પાને, ભલા, જેવા જાણવા મળો? ભારતમાં, આફિસિન્સ - એશિયાના કોઈ પણ મુલકામાં, કે પછી, યુરોપના કોઈ પણ દેશમાં આવી ઘટના ઘટી હોય, તેવા કદાચ, બે'ક જ દાખલા જઈ છે. આ બંને દાખલાઓ બિટનમાં થયાનું નોંધાયું છે. આવી જુબાની પછી ય જે તે બિટિશ વડા પ્રધાનનું શાસન અકબંધ જ રખ્યું છે! ... અન્યત્ર, વાસ્તવમાં, આવું બનતું શક્ય છે ખરું?

હાઉસ ઔંફ લૉર્ડ્સમાં રાજકીય નિમણૂક કરવાની બાબતે આજકાલ મુખ્ય પવાહમાંના ત્રણેય રાજકીય પક્ષો - લેબર પક્ષ, કન્સરવેટિવ પક્ષ તેમ જ લિબરલ ટેમોકેટ પક્ષના મોવરીઓની જુબાની લેવામાં આવી છે. કારણ? હાઉસ ઔંફ લૉર્ડ્સમાં નિમણૂક કરવા બાબત સૂચ્યિત ઉમેદવારો પાસે જે તે પક્ષને દાનની રકમ મેળવી છે, તેવા આસ્ક્રિપ અંગે પોલીસ તપાસ ચાલુ થઈ છે. લેબર પક્ષના નેતા ટોની બ્લેટર છે અને તે લેબર શાસનમાં દસ્કાઠી વડા પ્રધાન છે. આથી, પોલીસે ટોની બ્લેટરની જુબાની હાલમાં લીધી છે.

આજના દાખલામાં, સ્કૅટલન્ડ યાર્ડના ડિટેક્ટર અધિકારીઓ વડા પ્રધાનના અધિકૃત નિવાસસ્થાન, ૧૦ હાਊન્ડિંગ સ્ટ્રીટ ખાતે જુબાની લેવા ગયા હતા. આ પોલીસ અધિકારીઓએ બે'ક કલાક જેટલો સમય વડા પ્રધાનની પૂછુપરછ કરી હતી અને એમની જુબાની નોંધી હતી. ભવિષ્યમાં, બ્લેટર સાહેબની બીજી વખત પણ જુબાની લેવામાં આવે તેવી શક્યતા નકારવામાં આવતી નથી.

એવું કહેવાય છે કે, 'પ્રાયરી' નામની મોટી મસ્સ ધંધાદરી પેઢીના માલિક ચાય પેટેલ અને 'રોયલ હલ્વા' નામની દેશી ખાદ્યાખોરાકી અને મીઠાઈ - ફરસાશ તૈયાર કરતી જળબરદસ્ત પેઢીના માલિક મર ગુલામ નૂં ઉપરાત, મધાનો લેતીમૂકૂટી અને રેચતી પેઢીના માલિક રેવિલ જેરાઈ તેમ જ શેરદલાલીનો ધીકોતો ધંધો કરનાર બેરી ટાલોન્સ્લી પાસે લાખો સ્ટર્વિંગ પાઉન્ડ મેળવીને તે દરેકને હાઉસ લૉર્ડ્સમાં નિમવાનાં વચન અપાયાં હોવાનું બહાર આવ્યું હતું. આ કારણે મેટ્રોપોલિટન પોલીસની આ તરતપાસ ચાલુ થઈ છે.

આઠક દાખલા પહેલાં, તત્કાલીન વડા પ્રધાન લોઈડ જ્યોર્જની પણ પોલીસે જુબાની લીધી હતી. ત્યારે પણ લગભગ આવાં જ કારણો આપણી ધરાવામાં આવ્યાં હતાં. વીસીની એ તરતપાસ પછી, બિટનમાં, 'ઓનર્સ' (પ્રેવન્શન ઔંફ એબ્યુસેસ) એક, ૧૯૮૮પ્ર' અરિંતવમાં આવ્યો હતો.

ભારતમાં કેન્દ્ર સરકારના તાજેતરના કોલસા પ્રધાન શિબૂ શોરેન ૫૨, સાંસદ દિનિધ્ય પરે કે પછી કિલ્બ જગતના સિતારા સંચય દત્ત પર ચલાવાયેલા કામને આની જોડે સરખાતી શક્યત તેમ નથી. આ દરેક જુદા જ પ્રકારના શીજાદારી ગુનાઓ બને છે. જ્યારે બિટનાના આ દાખલાઓ એક પ્રકારે લઈએ તો રાજકીય રૂશતખોરીના દાખલાઓ ઠરે છે.

હમણાં હમણાં, વિરોધ પક્ષ, કોન્સરવેટિવ પક્ષના નેતા ડેવિડ ક્રેમેરનાં પત્નીને બૃહદ લંજના પરિવહન માળખાએ જાગ્યા હતાં. કહે છે કે આ બાનું પાસે વેન્બલી પાક સ્ટેશનની બહારે નિકળતાં પ્રવાસની ટિકિટ નહોતી! યાદ આવે છે હજુ થોડીક જ વરસો પહેલાંની વાત? વડા પ્રધાન ટોની બ્લેટરનાં પતાની શરીર બૂધ (ધાને કે શ્રીમતી બ્લેટર) એક નામવર ન્યાયમૂર્તિ પણ છે. પોતાની આવી એક

જવાબદારી સંભાળવા એમજો એક વાર લંન શહેરથી લુટન ગામે જવાનું થયું. લુટના કાળન કોઈમાં એમને બેસવાનું હતું. કોઈ પણ કારણે રેલવે સ્ટેશન પરે એમની કને પવાસ માટેની ટિકિટ નહોતી. ટિકિટ ચેકરે એમનો જિધજો ય લીધો. હપક સાથે રકમ વૂસલ કર્યા બાદ, ન્યાયમૂર્તિ સહેલાનાને ફરજ પર જવાની રજા મળતી હતી!

એક બીજી દાખલો પણ રસપ્રદ છે. થોડાંક વરસો પહેલાંની વાત છે. સાંપ્રદ બિટિશ વડા પ્રધાનના પાટવી સંતાન યુભેની ઘટના છે. એ સોલોનો થયો હોછે. સાંજે મિત્રમંડળના વચ્ચે લહેરતો હોછે અને તેમાં તેણે દારુનું સેવન કર્યું. તેણે નશો ક્યો હોછે અને તેની અસર હેઠળ રાતવરાત ક્યાંક રસ્તા જ વચ્ચે સૂર્ય ગયો છે. કોઈક વેટેમારગું બાઈને રામ વસ્યાં હોછે. તેણે પોલીસને જીન કરી તેણું કર્યું. પોલીસ આવીને આ નશાવાન યુવાનને બાજુની પોલીસ ચોકીએ લઈ ગઈ. યુવાન ભાનમાં આવ્યો ત્યારે પોલીસે તેની જરૂરી લીધી, જુબાની પણ લીધી. એમાં પોલીસને જાણાયું કે આ શરીર બ્લેટર ને ટોની બ્લેટરના નબીરો છે।

પોલીસ ચોકીમાંથી બ્લેટર દંપતીને જીન ગયો અને નિયમસર, કાયદા અનુસાર, પોલીસ થાજે આવીને એમના ટીકરાનો હવાલો લેવાનો આદેશ થયો. બ્લેટર દંપતી પોતાની જાનગી મોટર કારમાં જે તે પોલીસ થાજે હક્કારી ગયાં. બીજી નાગરિક માતાપિતાની જ જેમ એમની સાથે સલ્વકાઈએ વર્તનિવ્યવહાર થયો. કાયદા અનુસાર બ્લેટર દંપતીની મુલાકાત અંકે કરવામાં આવી અને પછી જ યુભેની હવાલો મળ્યો.

વડા પ્રધાનપદનો કોઈ જ દોર નહીં, કોઈ જ દમામ નહીં. સામે પક્ષે, પોલીસ પણ પોતાની ફરજમાંથી ચૂંટ થઈ નહીં અને ગરિમા જણવતાં જણવતાં વર્તનિવ્યવહાર કર્યો. આવું અન્યત્ર સંભવે ખરું કે? ભૂતપૂર્વ રાજીવીઓને પણ સો ટકા સારા કહેવાજરે તેવા વિધાવિધ વિચિત્ર વર્તનિવ્યવહાર કરતાં રહેતા સંપ્રત ભારતનાં સુધ્યાર્થ સભ્યો, નગરપદિઓ, ધારાસભ્યો, સાંસદો કે પછી પદાનો પાસે આવાં સૌમ્ય નાગરિકી વલણાં, વિવધારની કે પછી સમજશાની અપેક્ષાઓ રાખી શક્ય હરી? ... જેરે! બિટનાની આઠરો નવરસો વર્ધની પાકટ સંસદીય લોકશાહી પ્રાણિબની જ કદાચ આ તાસીરી હોય.

+++++

ઉત્તિષ્ઠત, ભારત !

૦ વિપુલ કલ્યાણી

જગતની સમૂહી વસ્તીનો છો ભાગ ભારતમાં છે. જગતની આર્થિક મહાસત્તાની હારમાળમાં, જ્યાનથી સરસાઈમાં આગળ નીકળી જઈ, નશકમાં, તે જીવું સ્થાન અંકિત કરી લે તેવી દરેક ક્ષમતા દેખાવા માંની છે. જેમ જેમ તેણો જણું જણું થતો મધ્યમ વર્ષ ગાંધકલક્ષી બનતો જાય છે તેમ તેમ સામે યક્ષપદ્ધ પણ જાડો થતો રહ્યો છે : પોતાકા વારસાગત મૂલ્યોનું ધોવાણી તો નથી થતું ને?

આ સવાલની જાહેર ચર્ચા અભીષ્ટ વિટિશ બોડકસ્ટીંગ સર્વિસની 'વર્લડ સર્વિસ' રેઝિયો સેવામાં ચોતરે મંજરી હતી. તે ફિલુઆરીથી ૧૧ ફિલુઆરી ૨૦૦૭ના નવ દિવસો દરમિયાન, અનેક પટિયો ભારતભાની અને જાતજ્ઞતાની ચર્ચા કરતાં અનુભવવા મળ્યા હતાં. સાંપ્રદ ભારતના વિશ્વાની પત્ર પરે રાજકીય, સંસ્કૃતિક, આર્થિક, ધાર્મિક, તકનીકી અને વૈજ્ઞાનિક સૂચિ-દર્શન કરાવવાનો એમાં મહાવરો થતો હાય, તેમ સમજાતું હતું.

ભારતના અર્થત્રમાં જળબરદસ્ત ઉદ્ધળી આવ્યો છે. જગતિક સત્રે આર્થિક મહાસત્તા બનવાનાં પગલાં માંડતાં ભારતની પજાનું અને વિવિધ સ્થળોનું નિરીક્ષણ પ્રતી રેઝિયો કર્યું અને વિશ્વાની જાણકારી બનતી રહ્યી હતી. વાતાવરણ આપત્તાની ગતિ વિશ્વાની રજીબ્યાતમાં સમજાતું રહ્યું. તે બિલાર જેવા પાણીતરા રાજ્યોની પરિસ્થિતિનો ક્રયાસ આપત્તાં હતાં. આવા રાજ્યોમાં વિકાસની ગતિ

પારોઠનાં પગવાં ભરી રહી હોવાની વાત છેદતી અનુભવી. હિંદુમાં વ્યક્તિગત પાયખાનાંની તુલનાએ. લોકો કને ટેવિવિજનાની વિશેષ સગવડ છે, તેવી દ્વારા એ પણી આવી. વળી ઈન્ટરનેટનો ઉપયોગ કર્યા ય વિશેષ પ્રમાણમાં વધી રહ્યો છે તેની ઝાંખી પણ આપવામાં આવી. ભારતની સંસ્કૃતિ અને અસ્મિતાને આ સંઘળી માહિતીઓ તેમ જ આ સરળા મોરેજનાં સાધનોને કારણે કેટકેટલી અસર, ભલા, પહોંચી હો ? આ સંદર્ભમાં ભારતની વિરાટ સંચાર વ્યવસ્થાને તપાસવામાં આવતી હતી. ભારત જેમ જેમ જરૂરી ઔદ્યોગિક રસ્તો ફિટાતું જાય છે તેમ તેમ કેટલીક જગ્યાએ તાજી વત્તાતી હોશે, તો કેટલીક જગ્યાએ કશર પેદા થતી હોશે. ભારતના આગેવાનોએ મહાસત્તા બનવાનું જે સપણું જોણું છે તે આમ રોપણ તો નહીં જાય ને ? - એવો સવાલ અપિતાબ બેહદ છાયાંગ માંહેના વિવિધ દ્વારા આધાર લેતા લેતા પૂરી રૂબા હતા.

છેલ્લે દિવસો, એટલે કે રવિવાર, ૧૧ ફેબ્રુઆરીએ, સરસ મજાની ચર્ચા આ હારમાળમાં ગોઠવાઈ હતી. જગતને માટે ભારત હરસંસારે ફૂદાતું આર્થિક મહાસત્તાનું ઉમેદવાર છે. તે ઘરમિનરપેક્ષ લોકશાહી દેશ છે. એક અબજ આશાવાન જનતાથી ઊભરાતો મુલાક છે. એક રીતે જોઈએ તો એ મહાકાય વિરાટ છે. પરંતુ તેના પરોશો દેશો એમ માને છે બરા ? ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બંગલાદેશ અને નેપાળને સાંકળતાં સાંકળતાં આ અંગે રેઝિયો વાટે જહેર ચચ્ચા માંજવાની બી.બી.રી.ની ધારણા હતી.

આ નવાં આર્થિક વહેશોને લીધે ભારતની લખનવ્યવસ્થા પર કેવી કેવી અસર પહોંચી રહી છે તેની વિગતે વાત અહીં કરવામાં આવી છે. તો વળી, સારહા વાંગની નજરે ચીની પરિપ્રેક્ષમાં ભારતને તપાસવામાં આવ્યું છે. અનુપમ ખેર બૌલિવુડ ફિલ્મ દુનિયાની વાત કરતા હતા તો ઉંના બાટલેટ, સુભમજ્યમું રામદારી, એન્જુ વૅંકર, સીરી સ્ક્રીફર્સ, અહીંમ પ્રેમજી સાથેની મુલાકાતનો પણ અહીં સમાવેશ થયો છે.

'મારા ધર્મને નામે હું શપથ લઈ છું. તેને ખાતર હું મારા પ્રાક્રાંતી પણ પાથરીશ. પરંતુ એ મારો નિષ્ઠા મામલો છે. રાજ્યને તેની સાથે કોઈ લેવાદેવના નથી.' આવું મહાત્મા ગાંધીએ ક્યારેક કંબું છે. તેને ટાંકીને ભારતના એક પેચીદ્ધ સવાલને અહીં છેદવામાં આવ્યો છે. આ એકટીસમી સદ્ગીમાં ધર્મને લોકો કેવા કેવા સંદર્ભમાં હે છે અને કંઈ રીતે જોડે છે તેની રજૂઆત તો થઈ, પણ સાથે સાથે ભારતની ભલાર, મહેશિયા જેવા વિસ્તારમાં, હન્મું ધર્મની કેવી કેવી ઝાંખી છે તેની વાતો પણ અહીં છેદવામાં આવી છે.

વારુ, આ નવ દિવસોમાં નાટક્યેટકની વાત પણ આવી. સત્યાજિત રાયના બંગાળી જ્ઞસૂસી પાત્ર ફેલુદાનું અવતરણ કરવામાં આવ્યું. શેરલોક હોમ્સ, ઈન્જિનિયાના જોંસ અને ટીનટીનનો કંપાંક નિભાળિયો અવતાર જોણું એ ફેલુદામાં થાતો ન હોય. આ નાટકમાં ચહુલ બોજા, અનુપમ ખેર અને લાવમોહન ગાંગ્લો જેવા અરીઝમ નટોને તિતારવામાં આવ્યા હતા.

બીજું પાસ, સન ૨૦૧૦માં નવી દિલ્હી ખાતે રાખ્રસમૂહના દેશોની રમતગમતની સ્પર્ધા થવાની છે. દિલ્હીને અત્યાધુનિક મહાનગરમાં પવલી નાખવાની જે યોજના હાથ ધરવામાં આવી રહી છે તેની વિગતે વાત પણ અહીં છેદવામાં આવી છે. રમતગમતને કોરે ભારત પણ આગળ પડતો દેશ છે તે પુરવાર કરવાનું સોશલ જોવાઈ રહ્યું છે. વિશ્વ સત્રે ભારતની કિકેટની વાત સ્વચ્છાવિક કન્દ્રસ્થ હોય. જ્ઞાતીતા કિકેટ ઈતિહાસકાર રામચંદ્ર ગુહના મતે 'ભારતનો સાચો ધર્મ તો કિકેટ છે' !

દિવસોમાં ૧૮૮૦માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુલાયીમાં કિકેટ મેચ ખેલતી હતી. પાકિસ્તાને બલ્લેબાળી કરી. હનીક મોહમ્મદ દ્વારા લેવો શરૂ કરેલો. રામચંદ્ર ગુહા લખે છે તેમ, વળતે દિવસો લેબોન સેલિયમ પાસે ૪૦ હજાર લોકો જમા થયા હતા. રેઝિયમ પાસેની એક હિરાની રેસ્ટોરન્સાં ય મોટી સાંજ્યામાં લોકો હજાર હતા. સમાજવાદી આગેવાન જી. રામમનોહર લોહિયાએ એક પ્રેસ કોન્ફરન્સ માટે એ

જગ્યા ત્યારે પસંદ કરી હતી. એ દિવસોમાં રામમનોહર લોહિયા જવાહરલાલ નેહરુ, અંગેજભાષા તેમ જ કિકેટની નકરત કરતા હતા.

ક્ષમસ્વ:

૨૬ ડિસેમ્બર ૨૦૦૬થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૦૭નો આપણો આ પવાસ પણ કેવો. વચ્ચે, ૨૬ જાન્યુઆરી ૨૦૦૭ના અંકનો કેવો ખાડો થયો. એ મિથે અતરમનથી દરેક ગ્રાહક - વાચક - દેખક પ્રત્યે અમે દિવગીરી વ્યક્ત કરીએ છીએ. અંગત / બિનઅંગત કારણોવસત્તુ પરદેશ પવાસે હોઈ, આ અંક પગટ થઈ શક્યો નથી. ક્ષમસ્વ:

વાચકરાજાને ઓછા ન આવે તેની આગામી દિવસોમાં અમે કાળજાસંભાળ વર્ષશું, તેવી પણ ખાતરી નંધાવીએ છીએ.

: તું જી

લોહિયાજી પત્રકારોને કહેતા હતા : આ કિકેટની રમત જુઓને; સંસ્થાનવાદની જરૂર મજબૂત કરી રહી છે. ડેરો અને કેમિયજ જેવા શિક્ષાધારોમાં ભાગીણાને આવેલા જવાહરલાલ નેહરુ સરીયા આગેવાન એમાં સહભાગી છે. એ વરા પ્રધાનને હટાવવાની માગણી લોહિયાજી કરી રહ્યા હતા. પણ એમણે ઉમેયું : જો જો ન, તે પછી, આપણે ચો, ખુશી ખુશી આપણી ભારતીય રમત કબ્જાઈ અને કુશી રમતા થઈ જઈશું !

રામચંદ્ર ગુહા આગળ નોંધે છે : પ્રેસ કોન્ફરન્સ બાદ પત્રકારો પોતાની સ્ટોરી ક્ષઈલ કરવાને ગયા. બાજુની સિંગરેની દુકાન પરે લોહિયા ગયા અને પોતાની પસંદગીની કેપ્સટન સિંગરેટ લઈને પીવા લાગ્યા. ત્યારે રેઝિયોની રનીંગ કોમેન્ટ્રી ચાલતી હતી. એ વચ્ચે લોહિયાજીએ દુકાનદરાને પૂર્ણભૂષણ શું હનીક હજી રમી રહ્યા છે ?

જવાબ હતો : હા.

પત્તં ગા

૦ જુગલકિશોર વ્યાસ

પત્તં ગી અણુ કાચ્યો ...

આકાશ - ધાને
કપાયેલા પત્તંગો
સંધાય હૈયાં.

ધાના ઉપર
સંધાય, તૂટચા તાર
ફીરકી શાંત.

આકાશે ચો
હૈયું; દોર કોઈની
ફીરકી સાંધી.

આકાશી ધાનુ
કપાયેલા પત્તંગો
ધાયલ હૈયાં.

jugalkishor vyas
<j_jugalkishor@yahoo.co.in>

ગુફતાળ -

ગડબડ છે, ભાઈ, ગડબડ છે !

૦ અભિજિત વ્યાસ

ભાષા એ આમ તો બે વ્યક્તિ વચ્ચેના સંવાદનું એક મહત્વનું અને આવશ્યક અંગ છે. આપણે આપણી પત્યેક બાળતની અભિવ્યક્તિ ભાષા દ્વારા જ કરીએ છીએ. આપણી અભિવ્યક્તિનું ભાષા એ એક સબજ અને એક માત્ર માધ્યમ હોવા છતાં કેટલી ય વખત અનુથયા કરે છે કે ઘણું ઘણું અભિજિત રહી જાય છે. અલબાત્, આ અભિવ્યક્તિમાં જો ક્ષાં ય ભૂલ રહી જાય તો શું થાય એ પત્યેક વ્યક્તિનો અંગત પણ છે. આપણે ત્યાં એવી એક કહેતી પણ છે કે ભાષાને શું વળજો ભૂરા!

ભાષામાં થતી ભૂલથી ઘણી વખત માર્મિક હાસ્ય સર્જતું હોય છે. આમાં મોટા ભાગે બોલનારનો ઉદ્દેશ ખરાબ નથી હોતો. આપણે ત્યાં ખાસ કરીને નાટકમાં દ્વિઅથી સંવાદો બોલીને હાસ્ય નિપઞ્ચવવામાં આવે છે. ઘણી વખત ઉદ્દેશ ન હોવા છતાં કેટલાક સંવાદોમાં અર્થવટના કરારો હાસ્ય સર્જત્ય છે. આવા સંવાદોને 'પન' (ઉપશિષ્ટ) તરીકે ઓળખવામાં આવે છે. અને અગેજ્ઝમાં આ સંદર્ભમાં એક કહેવત છે કે 'પન ઈજ હોર અંક ઓપનનેસ' [Pun is the door of openness].

આપણે ગુજરાતી લોકો હમજાં છેલ્લા કેટલાક સમયથી અંગેજ્ઝ બોલવાના શોખનિન થયા છે. આ અંગેજ્ઝ બોલવામાં પણ વધુ તો ફક્ત શબ્દોનો ઉપયોગ જ વધારે કરવામાં આવે છે. એટલે વાક્યરચના તો ગુજરાતી જ હોય પણ તેમાંના શબ્દો અંગેજ્ઝ હોય. એટલે એક વાણસંકર ભાષા પ્રયોજ્ય છે. જેને 'ગુજરાતી' તરીકે ઓળખવામાં આવે છે. આપણા નવલકથાકાર મધ્ય રાયે તેમની નવલકથા 'કિન્બલ રેવ-સર્વું' માં આ જાતની ભાષાનો ખૂબ સરસ પરોગ કર્યો છે.

ગુજરાતીમાં અંગેજ્ઝના મિશ્રકથી જે પ્રકારે એક 'ફની લેંગવેજ' પર્યોજ્ય છે તેમ ફક્ત અંગેજ્ઝ બોલવાથી જ પણ આવી 'ફની' કે હાસ્ય સર્જક વાક્યો સર્જતા હોય છે. જેમની માતૃભાષા જ અંગેજ્ઝ છે તેવા બિટનમાં પણ અનેક પ્રકારના છબરાઓ સર્જતાં વાક્યો વાંચવાં - સાંભળવાં મળે છે. આવાં કેટલાંક વાક્યો બિટિશ ઈરિલશનાં જોવાં વાંચવાં જોવાં છે. તેનો થોડો પરિચય કરીએ :

૦ લંડનની એક ઔંડિસના ટોઇલેટ પર લખવામાં આવેલું : 'ટોઇલેટ આઉટ અંક અંડર. પ્લીઝ યુઝ ફ્લોર બીલોવ.' [Tiolet out of order. Please use floor below.]

૦ લંડનના સામુહિક કપડાં ધોવાના એક સ્થળ [Laundromat] પર સૂચના લખી હતી : 'ઓટોમેટિક વોશીંગ મશીન : પ્લીઝ રિમૂટ ઓલ ધોર ક્લોશ્ય વેન ધ લાઈટ ગોઝ આઉટ.' [Automatic washing machines. Please remove all your clothes when the light goes out.]

૦ લંડનના એક ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાં સૂચના લખી હતી : બારોઈન બેઝમેન્ટ અપસેર્વેર્સ.' [Bargain basement upstairs.]

૦ લંડનની એક ઔંડિસમાં લખેલી સૂચના : 'આફટર ટી બેક સ્ટાફ શુરુ અમૃતી ધ ટીપોટ એન્ડ સ્ટેન્ડ અપસાર્ટર ડાઉન ઓન ધ ડ્રેનિંગ બોર્ડ.' [After tea break staff should empty the teapot and stand

upside down on the draining board.]

૦ લંડનની એક સેકન્ડલેન શોપમાં લખેલી સૂચના : 'વી એક્સચેન્જ એનીથિંગ; બાઈસિકલ્સ, વોશીંગ મશીન્સ, એટસેટ્રા. વાઈ નોટ બીજું ધોર વાઈક એલોન્ એન્ડ ગેટ અંદરકુલ બારોઈના?' [We exchange anything; bycycles, washing machines, etc. Why not bring your wife along and get a wonderful bargain ?]

૦ લંડનની એક હેલ્થ ફૂડ શોપ વી-નોમાં નોટિસ હતી : 'ક્લોરા જ્યુ ટુ ઇલનેસ'. [Closed due to illness.]

૦ એક સંજરી પાર્કમાં મૂકેલી સૂચના : 'એલિક-ટ્રસ પ્લીઝ સે ઈન ધોર કર'. [Elephants please stay in your car.]

૦ લંડનની એક કો-ફરસ્માં મૂકેલી સૂચના : 'શેર એનીવન હુ ડેઝ ચીલ્ફન એન્ડ ડ્રાન્ડ નો ઈટ, ધેર ઈજ અં તે કેર ઓન ધ ફસ્ટ ફ્લોર' [For anyone who has children and doesn't know it, there is a day care on the first floor.]

૦ એક લીફલેટ [leaflet] ઉપર સંદેશો હતો : 'ઈં યુ કેન્નોટ રીઝ, ધીસ લીફલેટ વીલ ટેલ યુ હાઉં ટુ ગેટ લેસ-સ'. [If you cannot read, this leaflet will tell you how to get lessons.]

૦ એક રિપેર શોપ હેર પર લખેલું : 'વી કેન રીપેર એનીથિંગ. (પ્લીઝ નોક હાઈ ઓન ધ હેર. ધ બેલ ડ્રાન્ડ વકી)'. [We can repair anything. (Please knock hard on the door. The bell doesn't work.)]

૦ એક પાણીસંગધાલયમાં (ગ્રમમાં) સાઈનપોસ્ટ : 'પ્લીઝ હુ નોટ ફીડ ધ એનિમલ્સ. ઈં યુ હેવ એની સુટેબલ ફૂડ, ગીલ ઈટ ટુ ધ ગાર્ડ ઓન જ્યુરી'. [Please do not feed the animals. If you have any suitable food, give it to the guard on duty.]

૦ ડાક્ટરની ઔંડિસમાં વિશિષ્ટતા સૂચના : 'સ્પેશિયાલિસ્ટ ઈન તુમન એન્ડ અધર ડિસીસ'. [Specialist in women and other diseases.]

૦ એક હોટલમાં લગાવેલી સૂચના : 'ધ મેનેજર ડેઝ પર્સનલી પાર્સ ઓલ ધ વોટર સર્વ્ય હીઅર'. [The Manager has personally passed all the water served here.]

૦ નાઈરોબીની એક રેસ્ટોરાન્સમાં વાંચવા મળતી સૂચના : 'કસ્ટમર્સ હુ ક્ષીંજ અવર વેલ્ડ રેટ્સિસ રૂ શુરુ વેઈટ એન્ડ સી ધ મેનેજર'. [Customers who find our waitresses rude should wait and see the Manager.]

૦ એક રેસ્ટોરાન્સના દરવાજી ઉપર લગાવેલી સૂચના : 'ઓપન સેવન ડેઝ એ વીક, એન્ડ વીકએન્ડસ ટુ'. [Open seven days a week, and weekends too.]

આવાં તો અનેક વાક્યો અને સૂચનાઓ આપણાને અનેક જગ્યાએ વાંચવાં મળે છે. જેમાંથી ઉદ્દેશ ન હોવા છતાં અનથ સર્જતા હોય છે અને આપણાને હસ્તું આવે છે.

આવા નિર્દોષ આનંદની મજા જ કંઈક ઔર છે.

[Gulab Kunj], off Ranjit Memorial, Near Govaalni Masjid,

JAMNAGAR - 361 001, India]

e.mail : abhijitvya@satyam.net.in

એતાનશી -

મારા મનનો આનંદિત્સવ

૦ “ઓપિનિયન”નું બારમું વર્ષ અને ૧૪૦મો અંક, ત્યાં રહે આ પ્રગતિ નાનીસૂની નથી, મારાં હાઇક અભિનંદન સ્વીકારશો. “ઓપિનિયન”માં જે રીતે મારી કૃતિઓ સ્થાન પામે છે, એથે સતત ઊડા આનંદમાં રહુ છે.

આમેય કારણો બદલાય છે, પણ મારા મનમાં કોઈને કોઈ ‘આનંદિત્સવ’ ચાલ્યા જ કરતો હોય છે. આ વર્ષ સુરેશ દલાલ ઉપમાં વર્ષમાં પ્રવેશયા, એ નિમિત્તે મારા હૃદયમાં ‘સુરેશ દલાલ મહોત્સવ’ ઉજવાવો શરૂ થઈ ગયો।

શાળા - કલેજમાં એમની કૃતિઓ ભજીને હું મોટે થયેલો. જૂની થાદો પણ તમારી સાથે share કરું? અમદાવાદમાં પ્રેમ દરવાજી સામે એક વેરહાઉસિંગ એજન્ટ ‘ગોપાલ ગોપલદાસ’ એન્ડ કું. નું ગોપાલન હતું તેલિયા મિલ કર્માંનું. એમાં હું સવા સો - ના માર્સિક પગારે ગાંસડી અને પારસ્લ ફેરવાની મજૂરી કરતો. જિસામાં પૈસા નહીં ને સાહિત્યના શોખ! દરિયાપુરના મારા ઘરેથી એમ. જે. લાયકેરી સુધી ચાલતો જઈ, સુરેશ દલાલના કાલ્યસંગઠનાં કાલ્યો જાયરીમાં ટપકાવતો. એમ પણ બની ગેયો હસ્તાલિભિત કાલ્યસંગઠ હાલ પણ મારી પાસે છે!

‘પ્રતિકાલ્યો’ની ઈમેજ એકદરે કાઈક ઉિતરતી જ મનાય છે, અભ્યાસીઓ દ્વારા. એમાં એમનો (અભ્યાસીઓનો) વાક તો ખરો જ. ઉપરાંત પ્રતિકાલ્યકારોનો પણ ખરો. ખરેખર ‘પ્રતિકાલ્ય’ એ મૂળ સર્જકને ઉિતારી પાડવાનું સાધન નથી જ, પણ મહંડરો એમ બનાતું રહ્યું છે. લય - છંદ પ્રત્યેની લાપરવાહી, બરાછટ શબ્દાળુતા અને સ્થૂળ હાસ્યના નમૂના પેશ થતા જીએ મારો જીવ હંમેશાં બને છે.

એમ તો કવિપદ સહેલાઈથી પામવા ‘ગઝલ’ જ હાથવગી બને છે, પણ અસલ મિજાજ સાથેની ગઝલ લખવી સહેલી નથી જ.

‘પ્રતિકાલ્ય’ પણ ઉિતરતો પ્રકાર નથી, મુની ઉચેરો પ્રકાર છે. મૂળ કાલ્યનાં સ્વરૂપ અને શૈલીને વશદાર રહી મૂળ સર્જક પણ ‘વાહ’! બોલી ઉઠે એવું રેશમી પોત ધરાવતાં પ્રતિકાલ્ય શક્ય છે જ અને એનાં અનેક ઉદાહરણો આ લાખનારે પેશ કર્યા છે. હું એમ સ્પષ્ટપણે માનું છું કે જે તમે સોનેટ - કાલ્યસ્વરૂપને આત્મસાત કરી શકો, તો અને તો જ તમે કોઈ ‘સોનેટ’નું પ્રતિકાલ્ય સર્જ શકો, આ બે આંગણ ઊચા જવાની વાત છે. છંદ સમજ્યા વિના, સોનેટના આંતઃ/બાબુ સ્વરૂપને સમજ્યા વિના કોઈ સોનેટનું પ્રતિકાલ્ય શક્ય બને? (અભ્યાસીઓને પણ મારો આ પ્રશ્ન છે.) પણ કદાચ કોઈએ આ સ્તરે જઈ પોતાની ક્ષમતા બતાવી નથી, એટલે જ આજ સુધીના ઠિઠાસમાં આપણી પાસે સોનેટ - સ્વરૂપે થયેલ પ્રતિકાલ્યનો એક પણ નમૂનો નથી. (જો હોય, તો બતાવો, પ્લિએ!)

પણ ‘નિર્મિશ’ની વાત અલગ છે. (કહેત હું કે નિર્મિશ કા હું અંદરોભયાં ઔર !) હાલ મારું હાસ્ય પુસ્તક ‘સુરેશ દલાલ : નિર્મિશની નજરો’ પૂર્ણતાના આરે છે, જેમાં સોનેટસ્વરૂપે થયેલ પ્રતિકાલ્યનો પણ સમાવેશ છે. એ અન્યૂર્ધુ છે કે નહીં, એ તો અભ્યાસીઓ (?) નક્કી કર્યે!

- નિર્મિશ ટાકર

[B - 9 / 31, ONGC Colony, Phase - 1, Magdalla,
SURAT - 394 518, India]

e.mail : nirmish1960@hotmail.com

‘અસર’ “ઓપિનિયન”ની સફળતાનું નખ નિવેદન છે

૦ ભારોભાર આભાર, ‘અસર’ને આવકારવા બદલ, ‘અસર’ને ગુજરાતી સાહિત્ય અકાદમીમાં જીશાંતવા બદલ અને ‘અસર’ના પ્રતિભાવને “ઓપિનિયન”માં પ્રકાશિત કરવા બદલ. ‘અસર’ “ઓપિનિયન”ની જ અસર છે; “ઓપિનિયન”ની સફળતાનું નખ નિવેદન છે, પુરાવો છે કે ‘ઓપિનિયન’નું પોત્સાહન કેવું સબળ પેરક બળ છે. અયથા નવાદિતોની - અરે, તણ ગુજરાતના નવાદિતોની પણ - બથા, મથન - મથામજણને પ્રકાશન યશ થોડો જ નરીબ થાય છે? તમે “ઓપિનિયન” થકી અને નિશ્ચ પોત્સાહન ઢગલાબંધ આય્યું છે. એનું જીકું છું.

અવાર્યોન ગુજરાતી ગજલના શિરમોર ‘આદિલ’ મન્સૂરી સાહેબ ‘અસર’ને આપેલ પ્રતિભાવ બદલ હું એમનો ખૂબ આભારી છું. ગુજરાતી સાહિત્યના ધૂરંધર સેવકના લુંઝણા શબ્દો ખૂબ પોત્સાહક તો છે જ, પરંતુ એ ગુજરાતી સાહિત્ય પ્રત્યેની વજાદારી અને ફરજ - જવાબદારીના મૂક ઇશારા છે. એ અંગે સજાગ રહેવાની સૂક્ષ્મ, પ્રેરણ હુંમેશાં મળતી રહે એ જ નખ પ્રાર્થના છે. આધુનિક ગુજરાતી ગજલના આ પ્રણોતાને શત સલામ. ‘અસર’ પ્રકાશનમાં વરીલ, ધીરૂકા (ટાકર) અને મૂદ્યન્ય લિટરિશ ગજલકાર અદમ ટકચાવીનો સિંહજણો છે, એ ન વિસરી શકાય. આ નખ પ્રયાસને ગુજરાતી સમુદ્ધાય માણશે તો ખૂબ ગમશે, એટલે કે “ઓપિનિયન”ની યશકલગ્નિમાં આ એક નાનું પીંફું ઉમેરાશે.

હષાહજણા કલ્યાનો અશ શા

પ્રસારી પાંખ ઊભા વસવચા

અબુકતી દીકરીની હુંક જરા

પડણયા દીધ મન હુસવ શા

- ક્રુદુક થાંચી ‘બાબુલ’

[Park House, 71 Moorhead Lane, SHIPLEY, West Yorkshire,
BD18 4JN, U.K.]

ઉજળો યુ.કે. - પ્રવાસ તે જ મારી આનંદ કમાઈ

૦ આવતીકાલે ૧૦ નવેમ્બર, ૧૦ અંકટોબરના રોજ લંજનથી રવાના થયો તેને એક મહિનો થશે. હજુ મનનો એક હંડ જ્ઞાનો યુનાઈટેડ કિંડમનાં સંસ્કૃતાશીલી ભરેલો અકંબંધ. બીબીરીસી, સબરસ, માર્દિરોનાં વ્યાખ્યાનો અને ૧૭-૧૮ વર્ષ રજુ કરેલો એક પાત્રીયનો એક કલાકોનો પ્રયોગ. તો વળી, તમે આપેલી ‘નીરખને ગગનમાં’ ગુજરાતની તક. એ પછી બધું સમેયાંથું ‘એકતારો’ કાર્યક્રમમાં, આસ્તિત્વાઈ, હેમાબહેનના સંગે.

કટોલેન્જના આઠ દિવસ અને વૉર્કિન ને કેમ્બિજ સહીત લંજની ચાર મુલાકાતોએ કે દિવસના પ્રવાસને વ્યસ્ત મને ત્વરાપૂર્ણ રાખ્યો. ડેરોલ (હેરેલ પણ) પિટર કાર્યાલયનું ‘નાંડીકર’માં અવતરણ બન્દ રહેલું, એ પછી બધું જીએ મલકાઉં છું ને ક્યારેક લાગે છે હું એ પરિવારમાં પણ પહેલાંથી જ હતો. “નાંડીકર” સારેભાર અંક અહી આવીને તેયાર કર્યો. સરકારી અંડિક્સ જ્ઞાનો મારી સેવાની જ રાહ જોતી હોય; કામ પણ ખૂબ રચ્યું. ... તમે સૌઅં યુ.કે. - પ્રવાસ ઉજળો કરી આપ્યો તે જ મારી આનંદકમાઈ.

- શીલેશ ટેવાણી

[Prem Mangal, B.186, Sashtrinagar (Ajmera), Nana Mava
Road, RAJKOT - 360 005, India]

છષુદ્દર કે સરમે

૦ “ઓપિનિયન” - નવેમ્બર ૨૦૦૫માંના ‘એતાનશ્રી’ વિભાગમાંનું ‘કૃષ્ણાદિત્ય’નું મારા એક મખસુસ જવાબી પત્ર વિશેનું લખાશ વાંચ્યું.

‘યહુદીવેડા’ શબ્દપ્રયોગ સામે એમને વાંધો છે. કૂતરાવેડા! ઢેંકે કેટો કૂતરાં ભસે. એ તેમની ખાસિયત. એ રીતે પ્રજ્ઞાઓનાં વલણ, વૃત્તિ, ખાસિયત નિર્દેશતા શબ્દપ્રયોગો પણ હોય છે; જેમ કે ગંયાંદ્રેડા, ચમારવેડા, માંગણવેડા વગેરે. યહુદીવેડા એવો જ એક શબ્દપ્રયોગ છે. અફરોસ છે કે મારે આ સમજાવવું પડે છે. એ શબ્દના ઉપયોગથી કયું આકાશ ટૂટી પણ્યું કે ઈન્સાનિયત અને વસ્તુગત, વ્યક્તિગતનું અસરગત બુરાગાળા મચાવ્યું છે! - જરા ઈતિહાસગંથો ઉથલાવો, તમને મારી વાત કદાચ સમજાય.

પણ એમ લાગે છે કે એ વાત તમને કદાચ નહીં સમજાય. કેમ કે તમારા પત્રમાં મુસિલમદ્રેષ બોલે છે. શાદે શાદે લુચ્યાઈ સળવળે છે. વળી નેપથ્યમાં યહુદીપઠાંસેવન થઈ રહ્યું હોય એમ પણ લાગે છે. ૨.કા. ભણના શબ્દમાં કહું તો ગુલામ પજની એ ખાસિયત હોય છે! એમનાથી સારાઈની અપેક્ષા રાખી શકાય નહીં!

અને ૨.કા. ભણનો ઉલાપોહ! ટાંઠ ટાંઠ ફીશ! એમણે તો સમગ્ર વિપ્ર સમાજને મદદ માટે હાકલ કરી છે! કેમ ભાઈ, પાપ તમે કરો અને બચાવવા માટે સમજ આવો! સખણા બેસોને ૨.કા.જી।

એક વાત કહું, ૨.કા.જી! ચોપણાં છ્યાવવાં હોય ને તો પ્રથમ લખતાં શીખો. એ માટે જોઈએ તેજસ્વિતા, લેખનકળાની જ્ઞાનકારી અને સંસ્કરોની સુગંધ. - પણ અફરોસ, ગુલામોને એ સુલભ હોઈ શકતું નથી. - એટલે તો તમે ઉટપટંગ ને એલેક્લ લખી નાખો છો ને! અને આશ્વય કે એ વળી ‘વિચારપત્ર’માં છ્યાપાય છે! - છષુદ્દર કે સર મેં ચ્યેમેલી કાતેલ!

- દીપક બારોલીકર

[16 Whitchurch Drive, Old Trafford. MANCHESTER

M16 8BR, U.K.]

તેઓ હિંસા અને દુષ વિચારોથી કંટાળ્યા છે

૦ ‘કૃષ્ણાદિત્ય’ જીજો છે કે, મારી લગાઈ કોઈ વ્યક્તિ કે સમપદાય સામે નથી. મારી લગાઈ ધાર્મિક દુર્વિચાર અને દુરાચાર સામે છે. એટલે અમદાવાદ, અયોધ્યા અને બગદાદમાં થતી અને થયેલી ડિંસાનું મૂળ શોધવાનો યત્ન થઈ રહ્યો છે. મૂઢોને ખબર નથી કે, અયોધ્યા એટલે જ્યાં યુધ ન થતું જોઈએ એવી ભૂમિ. અયોધ્યામાં મંદિર થશે તો તેમાં ભગવાન દસ મિનિટ્સ બેસવા તૈયાર નહીં હોય! હું લાલકૃષ્ણ અહવાણી કરતાં ભગવાનને વધારે સારી રીતે ઓળખું છું! દીપકજી સામે ખાસ વાંધો એ છે કે, એમને માટે ઈસ્લામની શ્રેષ્ઠતા અને બીજા ધર્મોની અલ્યતા સત્યસિદ્ધ છે. બુરાખાની ચર્ચા નીકળી ત્યારે મારા ઉપર આશીર્પો થયેલા. એ વખતે અમુક શાશ્વત લોકો કાંઈ ઊભીને હસ્તા હતા! પાકિસ્તાનની મહિલાઓને બુરાખો બલાત્કારમાંથી બચાવી શક્યો નથી. એક અંગેજ પત્રકાર લાગે છે : ‘બુરાખો એટલે સ્ત્રીઓની સંપૂર્ણ પરવશતા અને માનવગૌરવનો અભાવ.’ હું છ વરસનો હતો ત્યારે કેટલીક ખેડૂત સ્નીઓ મારી લાજ કાઢતી હતી! તેથી મારા ગૌરવમાં વધારો થતો હતો એમ હું માનતો હતો! અત્યારે તેમની વકીલ, ડૉક્ટર કે પ્રોફેસર થયેલી પુત્રવધૂઓ મારી કે બીજા કોઈની લાજ કાઢે એ વિચાર બેન્દું છે.

બિટનના એક બુધ્ય તંત્રીએ છાપી માર્યું છે : ‘અમેરિકાને કારણ શિયા - સુની મતભદ્રાનું નિવારણ થઈ શકતું નથી.’ એ મતભેદ ૧૩૨૮ વર્ષ જૂનો છે. તેનું નિવારણ અશક્ય નથી. સાઉદી અરેબિયાના સુત્તાન અને રીચનના વજ આયાતુલ્લા એક બીજાને બેઠે, આરબ રિવાજ પમાણે એક બીજાને ગાલે શુભન કરે અને ડિસા તજવાનો ક્તવો બહાર પાડે તો સુધારો અવશ્ય થાય. એમ ન બને કારણ કે, ધર્મને નામે સત્તા અને સમૃદ્ધિ ભોગવાની તક કોણ જતી કરે? મને માનુષી ભગવાનો સામે વાંધો છે. તેનું કારણ પણ આ જ છે. એક બીજી વાત પણ બેણી સમજી લેજો. સાહિત્ય, સંગીત, કલા, કે અન્ય બુધ્યપ્રધાન પ્રવૃત્તિનો મુખ્ય આશ્રય ઉદાર માનવતા ન હોય તો આપવાઈનો વેશ જ બની રહે. બુરાખાની ડિમાયત કરનારની ગજલ વાંચવાનો મારી પાસે સમય નથી। લાલકૃષ્ણ અહવાણીને આશ્રય આપીને ગુજરાતીઓ કંવિક્ટ બન્યા છે. ધાર્મિક સંસ્થાઓ બરાબર ચાલે તો મનુષ્યનું કલ્યાણ થયા વિના ન જ રહે. છ ચોપડી ભજોલાઓની પક્કમાંથી ધર્મને મુક્ત કરવાની લાગ મોટી ઉંમરે આદરી છે! બીજી પિતામહ મોટી વધે મહાભારતની લગાઈમાં નહીંતા ગયા? હતાશા ત્યારે થાય છે કે, જ્યારે પી.એચ.ડી. થયેલા વહેમની નાનને પારખી શકતા નથી. નિર્દોષ બાળકોને ધર્મકૂરતાથી (મઝહબી ઝાનૂન) દૂર રાખવા માટે કાયદો કાંઈ કરી શકતો નથી. એક બીજાને ભૂસીના નાખવા માટે ધર્મનું આયોજન થયું નથી. ધર્મ એ કાંઈ બાલવાતી નથી. એટલા માટે પંચિમના લાખો ઉદારચિત સ્ત્રીપુરુષો તમામ ધર્મને તજી દઈને પરિશુદ્ધ માનવતાને ટેકો આપે છે. તેઓ ડિસા અને દુષ વિચારોથી કંટાળ્યા છે.

તેથી સાહિત્યના સંસ્કરકોષમાં એક પણ મુદ્રાનો ઉમેરો થયો નથી

પ્રભાતદેવ ભોજક કોઈ કાપણા વેપારીનો દુકાને બેસી રહે તો ‘સ્પષ્ટ કહત્વ’ અને શુદ્ધ ગુજરાતી લંજનમાં ઓછું સાંભળવા મળે: હાલ્યાભાઈ પટેલ, જગદીશ દવે, જોલરચાય મહેતા, વિપુલ કલ્યાણી, પોપટલાલ પંચાલ જેવાં પચારોકાન્માં નામો આપી શકાય તેમ છે. તેમની સાથે ચર્ચા કરી હોત તો જુદી જ અભિપ્રાય આપ્યો હોત. બોળજીજાનો પત્ર આદર્શ ગુજરાતીનો નમૂનો નથી! આલુપરાઠા માટે ગુજરાતીમાં શબ્દ નથી? બેટોવકામાં બે અનુનાસિક ખૂટે છે! આવી બાલતમાં નેવું ટક ગુજરાતીઓ કાળજી રાખતા નથી. ‘જં’ બોલવાની પરંપરા નાશ પામી છે! પ્રભાતદેવ કિર્દી કોટિના સંગીતકાર છે એ નક્કી કરવાનું કામ એમના શ્રોતાઓ ઉપર છોંઝું હોતો તો વધારે શોભત! આવા ઝગડામાં ન પહવાની સમ્પાદક સલાહ આપે છે. છતાં માણસની સામાન્ય બુધ્યિનું અપમાન થાય એવી વાત કાર્યકે સહન થઈ શકતી નથી.

નિર્મિશ ઠાકર જ્યોતિન્દ્ર દવેના સમકાલીન હોય તો મને નવાઈ લાગે! વ્યાસોચ્છિષ્ટ જગત્સર્વે એમ જ્યોતિન્દ્ર દવેએ પોતાને વિષે લખ્યું ત્યારે નિર્મિશ ઠાકર આ જગતમાં આંદ્રા મારતા નહીં હોય. ભાવાર્થ એ છે કે, વ્યાસજીએ એટલા બધા વિષયો છાવરી લીધા છે કે, બીજાઓ માત્ર તેમના અનુકરણ રૂપે જ કાંઈક લખી શક્યા છે. જ્યોતિન્દ્ર દવેની પ્રકૃતિ જેતાં એમણે આત્મશ્વાસા રૂપે નહીં પણ બદ ઉપહાસ જમાવવા માટે તેમ કલ્યાણ હોય એવી શક્યતા છે.

ભગવતીહુમાર શર્મ લાગે છે કે, સુરતના કવિઓએ ગજલ ઉપરાંત બીજું કાંઈક લખતું જોઈએ. ‘હતો હું હતી તું: નાંતો હું નાંતી તું’ જેવો ગજલ લખવા સિવાય સુરતના કવિઓએ બીજું શું આવે છે એ સવાલ પૂછવા જેવો છે! ગજલની બોલબાલા હોવાથી શાસ્ત્રીયસંગીતમાં

સ્વરબધા કરી શકાય એવી કવિતા અલ્ય જ દસ્તિગોચર થાય છે.

ચંડકાન્ત બદ્ધીને વખ્યું હતું કે વિનોદ ભણ લખે છે એ કરુણ ઘટના છે ! હવે બજીનાં વાખાણ કરતાં વિનોદ ભણની જીબ સુકાતી નથી ! બાધાણના પતનને મર્યાદા રહી નથી. તેનો આ પુરાવો છે. માત્ર લોકપિયતા એ જ સાહિત્યસર્જનનો મુખ્ય માપદંડ હોય તો “પ્લેબ્યું”ના તંત્રીને મહાન સાહિત્યકાર કહેવો જ પડે ! હુંસી પોટરની લેખિકાએ કરોડો બલે પેદા કર્યા હોય, તેના લેખનથી સાહિત્યના સંસ્કારકોષમાં એક પણ મુદ્રાનો ઉમેરો થયો નથી.

- ૨. કા. ભણ

[87 Hale Lane, Mill Hill, LONDON NW7 3RU, U.K.]

ચિન્હ મુદ્રાબાણીનો એક ક્રેટ સાંભળે છે :

ઈસે રૈયાદને કુછ ગુલને કુછ બુલબુલને કુછ સમજા
ચ્યાન મેં ડિતની માનીખેજ થી ઈક ખામોશી મેરી

ખુલ્લ શ્વય. આપણે વલ્લિબસી ચર્ચા હવે સર્વિયામ આટોફી વઈએ તો કેવું ?
દંકનો સહદ્ય આનાર અને દંકની અંતરમાની જમાપના સારે : તરી

આ દેશની ભાષા પણ આબદદી જ જોઈએ

૦ ૧૯મું વરસ ચાલે છે. તે પણ ૨૦૦૭ના મે માસમાં ૮૨ વરસમાં ફેરવાઈ જ્યો. એટલે જ્યાં સુધી શરીર કામ કરો ત્યાં સુધી “ઓપિનિયન” વાંચતો રહીશ.

માતૃભાષા વિષે “ઓપિનિયન”માં ઘણી ચર્ચા ચાલે છે. પણ આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશની ભાષા પણ આપણને આવગતી જોઈએ. અલબન્ટ, આપકો ભાષા આવગતી હોય તો તે અંગેજ ભાષા જલહી શીખી શકે. હિન્દી, હિન્દુસ્તાની પણ શીખ્યા અને આખરે હિન્દી ઉપર આવ્યા. અને આજે હિન્દી ભાષા ઉપરની પકડ જ ચાલુ રહી. હિન્દુસ્તાની ભૂલાઈ ગઈ. જો કે એ બધી ચર્ચાની પણ કંઈ જરૂર નથી.

“ઓપિનિયન” વાંચવાની મજા આવે છે.

- બળવત્ત પી. દેસાઈ

[31 Marlborough Road, Forest Gate, LONDON E7 8HA, U.K.]

મહેતા દેપ્તીની પીડ થાબદવાનું મન થાય છે

૦ “ઓપિનિયન”ના અંકટોબર ૨૦૦૭ના અંકના પહેલા પાને બિટિશ ગુજરાતીઓ વિષયક મકરન્દ મહેતાનો માહિતીસભર લેખ વાંચ્યો.

કોઈ પણ સંશોધનનું કામ ગૂઢ હોય છે. આ ઐતિહાસિક સંશોધન પાછળ લેખકની લગન, ધ્યેય અને મહેતાનું જોઈ શકાય છે. તમે “ઓપિનિયન”માં નોંધ્યું છે તેમ ‘આ પ્રકલ્પને સર્વસમાવિષ રાખવા તથા ચીલાચાલુ અને દેખીતા ચોક્કઠ બહાર પણ પણ નજર દીજવવાનો લેખકે પ્રવાસ કર્યો છે.’ અલબન્ટ, આ પહેલાં અવારનવાર વિવિધ માધ્યમો દ્વારા લેગી કરેલી આ વિષયને લગતી માહિતી પીરસીને “ઓપિનિયન” પણ વારકોની ભૂભ પોષણ પ્રયત્ન કર્યો છે.

લેખમાં નોંધવામાં આવેલા મુદ્રાઓમાં : ‘ગુજરાતીઓએ મંદિર અને મર્યાદના કલચરને ઓછું કરી રાજકારણ અને જીહેર જીવનમાં વધારે પ્રમાણમાં વ્યવસ્થિત તેમ જ સર્કિય રીતે જોગાંનું પડશે.’ એ મુશ્કે ખાસ ધ્યાન જોયે છે.

વળી, ‘નવી પેઢી અહીં જન્મી છે. અંગેજ બોલે છે. બધા સારે

ઓપિનિયન / Opinion

સહજતાથી ભણે છે એટલે રંગબેદનો પ્રક્ષ હવે બહુ રહ્યો નથી.’ એમ કહેતું વહેલું પહેલું છે. એ જ રીતે લાંચરુસ્ટ, ભાષાચાર, કામચોરી, સગાવવાદ અંગે પણ ‘કાગજ બધે કળા’, એમ કહી શકાય.

લેખમાં વિવિધ મુદ્રાઓનું તિવેચન જોતાં સંશોધન માટે રજા મહિનાનો સમય ઘણો ઓછો કહેવાય ! તેમ છતાં ય લપસસાં ચઢાણે હિંમતભેર આરોહણ કર્યા બદલ એમની પીઠ થાબહવાનું મન થાય છે ખરું. બાકી એમનાં ભાતામાં શું છે ? એ તો પીરસવામાં આવશે ત્યારે માણી શકાશે. ખૂબ ખૂબ અભિનંદન.

- જિગર નબીપુરી

[3, Shernhall Street, Walthamstow, LONDON E17 3EU, U.K.]

સંપાદકે સંદર્ભ સ્વીકારેલી આચારસ્થિતિનો રથ

ધર્મરાજના રથની માફક પૃથ્વી પર દોકલા લાગ્યો છે

૦ ‘ગુજરાતી લેકિસ્કાન્ન ઝાંક કોમ’ના રચયિતા રચિતાલ ચંદરયા પાંચ કરોડથી વધુ ગુજરાતીઓના સન્માનના અધિકારી છે. એમણે ‘જીમેલ રીપીન્નું સર્જન કરીને ગુજરાતીઓને ચિરઃસરણીય લેટ આપી છે જે માટે વિશ્વતસ્તરીય ગુજરાતીઓ એમના સંદા કાળ જીકી રહેશે. ધનશ્યામ ન. પટેલ એમને ‘આધુનિક એકલબ્ય’ કહી નવાજ્યા છે તે યથાયોગ્ય જ છે. ફરી ફરી એમને હાંટિક અભિનંદન !

ભીખુ પારેખના વ્યાખ્યાન ‘નહી કલ્યાણ કુટક્ષિક દુગ્દિતી તાત ગચ્છતિ’માં ‘એ-ટીનામી’ [Antinomy] મુદ્રિત થયું છે એ મુદ્રારાક્ષસની કરામત લાગે છે. કારણ synonym નો વિરોધધર્થાં શબ્દ છે ‘antonym’. ‘Antinomy’ એટલે (i) opposition between one law, principle, rule etc. and another (ii) Philos : a contradiction between two statements, both apparently obtained by correct reasoning.

Antonym એટલે a word opposite in meaning to another. [Webster's Encyclopedic Unabridged Dictionary of the English Language]. આથી antinomy નહી, પરંતુ antonym હોતું જોઈએ.

‘ભાષામાં ‘પાણી’ અને ભાષાનું ‘પાણી’’ અધિન ચૌહાણકૃત લેખ રચિક રહ્યો. એમાં થોડો ઉમેરો. ‘પાણી પૂછ્યું’ એટલે ભાવ પૂછ્યો, આવકાર આપવો. દા.ત. એમે સમરંભમાં હોશબેર ગયા પણ ત્યાં તો કોઈએ પાણી સરખું ન પદ્ધયું !

‘પાણી ફેરવું’ એટલે કર્યું કારવ્યું ધૂળમાં મેળવવું. નકામું કરવું ! તો ‘પાણી પાણું’ એટલે હરાવવું. ‘પાણીમાં આગ લગાડવી’ એટલે ઉશેરાટ ક્લાવો; અતિ ઉત્સાહિત કરવું. ‘અસર એતી કરો પૈદા કે લાગે આગ પાણીમાં.. - ‘શયદા’. અને અંતમાં ‘દંગે માર્યા પાણી જુદા ન પડે’ એટલે લોહીની સગાઈ અંતે તો એક થઈનું જ રહે.

સાટેભરના અંકમાં જ્યાત મ. પંજા માટે પૂરાં સનવાસાત પાનાં કણલ્યાં જ્યારે કે. કા. શાસ્ત્રી માટે કેવળ સાત શબ્દોમાં જ સામુદ્રાશિક ‘સાંજેનોધ’ લીધી ! લાગે છે અહીં શાસ્ત્રીજીનું ‘હિંદુત્વ’ આભીજ ગયું !

નવેભાર માસના અંકમાં રમણભાઈ તી. પટેલનું મંત્રય વાંચ્યું. અતિ નમતાપૂર્વક તેઓ લાગે છે : ‘તિવેચન કરવું એ મારા ગજા બણારની વાત છે.’ રમણભાઈ, વાર્તાવેખન, કાલ્યરચના, વિવેચન ઈચ્છાઈ વાંદમય સાહિત્યનું સર્જન એ કોઈ વાંદતવિશેખનો ઈજારો નથી. ટીકા તો થવાની

જ. એનાથી હતાશ બની કિમકટવ્યમૂઢ બને પાલવે નહીં. ગીતસંગીતકાર અવિનાશ વ્યાસની આકરી આવોચના ઉમાશંકર જોશીએ કરી હતી. ‘અવિનાશ વ્યાસ જોડકાણના કવિ છે.’ એમ કણાનું સ્મરણ છે. પરંતુ આમ છતાં, અવિનાશ વ્યાસના ગીતગરબાળાયન ગુજરાતના ગામડે ગામડે શાળાંલેજેમાં અને ચલચિત્ર ક્ષેત્રે ધૂમ મચાવતાં હતાં, એ પણ હકીકત છે। તમારું જે ધૂવવાક્ય છે ‘ના, હું તો લખીશાંને દઢતાપૂર્વક વળગી રહો અને વિવેચન ક્ષેત્રે પણ લગે રહો, રમજભાઈ!

‘ભાષાની ભમરાળ અને સર્જન સુમિરન ...’ હેઠળ પ્રવીષ્ટકુમાર સી. પટેલ ‘શશી’ રમજભાઈ ઈ. પટેલ રજૂ કરેલા કેટલાક મુદ્દાઓ અંગે લખે છે : ‘... અમુક ટેકનિકલ શબ્દો માટે કોઈ ગુજરાતી સહી શબ્દો છે પણ નહીં ! આ વિધાન ચચ્ચાસ્પદ છે. સંશોધન કર્યા વિના અંગેણું શબ્દોના પર્યાય કેવી રીતે પ્રાપ્ત થાય ? આપુને અન્યથી અનોખા હોવાનો શોખ ઘણી વેળા વિદૃષ્ટક જેવું વર્તન કરવા પ્રેરે છે. ‘મા’, ‘પિતા’, ‘પણી’, ‘શિક્ષક’ ખચિત જ સુંદર શબ્દો છે. પરંતુ અંગેણીની છાયા હેઠળ મોટા ભાગના ગુજરાતીઓ ‘મધર’, ‘કિધર’, ‘વાઈક’ અને ‘ટીચર’ શબ્દોનો નિયમિત ઉપયોગ કરે છે એ આધુનિકતાની કરણા છે. પ્રવીષ્ટકુમાર પટેલ ‘કાલેલકર અધ્યયન ચંથના પાન તરપથી ઉત્ત ઉથલાવશે તો એમને લગભગ ૫૦૦ અંગેણું શબ્દોના ગુજરાતી પર્યાય મળી રહેશે. નમૂના રૂપે થોડા પર્યાયો આ રહ્યા : (૧) album - ચિત્રમંજુષા, (૨) buffet dinner - સ્વેચ્છ જમજા, સ્વેચ્છ ભોજન, (૩) compositer - બીજાન-વીસ, (૪) directory - નિર્દેખિકા, (૫) high jump - અંગદ કૂડકો, (૬) long jump - હનુમાન કૂડકો.

અફ્ઝોસ સાથે નોંધનું પડે છે કે ગુજરાતી લેખકોએ કાકસાહેબે આપેલા પર્યાયોની અવહેલના કરી. આથી એ ચલણી બની શક્યા નહીં. અંગેણું તરકણું હણ બલારણું ગુંડાપણ એ માટે જવાબદાર છે.

રમણીકલાલ કા. ભણની કલમ તેજસ્વી અને આકર્ષક છે. એમનું લેખન હુમેશાં ધ્યાનાકર્ષક રહ્યું છે. ચાર વેદીના ગુજરાતીમાં કરેલા અનુવાદ માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ ! નવેમ્બર અંકમાં એમણે કરેલાં તારણો સાથે સંમત થતું જ પડે. ‘બે હજર વરસથી ગુલામ રહેલી પણ્ણનું આ લક્ષ્ણ છે;’ એ કહ્યું પણ વાસ્તવિક વિધાન છે. હાલમાં જ દક્ષિણ મુંબઈની ‘અંજુમન - એ - ઈસ્લામ’ શાળામાં હોલીવુડની અભિનેની એ-જેલીના જેલી અને બેઠ પીટને ચમકાવતી કિલ્મ ‘અ માઈટી હાર્ટનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તેમના અંગરખકોએ એક મહિલા સાથે અશીષ વર્તન કર્યું હતું; બાળકોને ધક્કા માર્યા હતા અને લોકોને ‘જલી ઈન્ડિયન’ કહી ધૂતકાર્યા હતા. હિનુસ્તાનમાં હિંદ્દીઓ સાથે જ ગોરાઓનું આતું અપમાનજનક વર્તન ! આ સામે ઊછાપોહ થયો, પરંતુ સરકાર ખામોશ રહી !

અંસ્ટ્રોલિયન ડિકેટ ટીમના કેપ્ટન રિકી પો-ટીઝે પાંચમી નવેમ્બરે ચેમ્પિયન્સ ટ્રેનીની જીત બાદ બીસીસીઆઈના પ્રમુખ શરદ પવાર સાથે અસત્ય વર્તન કર્યું. અંગળીના ઈશ્વારે પવારને ટ્રોફી આપવા કહ્યું અને તે સ્વીકાર્ય બાદ પવારને બજેબે વખત ધક્કા માર્યા. અને પવાર ? હસતા હસતા કેરકુદી કરતા રહ્યા ! એ વેળા પવાર જોકર (રંગલો) જેવા દેખાતા હતા. એક ટીવી ચેનલ પર ઉપરના બને દષ્ટો આ લેખકે બે વખત નિહાળ્યાં છે. બેદ છે કે આવા અધ્યાત્મિક કૃત્યો પ્રત્યે કોઈની લાલ આંખ થઈ નહીં. આજાદીના ૫૦ વર્ષ બાદ પણ હિંદીઓ માનસિક

ગુલામીમાંથી મુક્ત થઈ શક્યા નથી. સુશેષું કિમ્બ બહુના !

‘ગુજરાત્યુ’ વિભાગમાં શરદ આર. શાહનો પત્ર ખૂબ જ કૂરેહપૂર્વકની દંધાદારી જહેરબબર છે. આનાથી સંપાદકે સ્વયં સ્વીકારેલી આચારસંહિતાનો રથ ધર્મરાજીના રથની માફક પૃથ્વી પર દોડવા લાગ્યો છે.

- અમૃત દેસાઈ

[35, Sherrick Green Road, Dollis Hill, LONDON NW10 1LB, U.K.]

ગુજરાતી કવિતાનો એક ભાવ વારસો

પરથમ પરણામ મારા ...

૦ રામનારાયણ વિ. પાઠક ‘શેખ’

પરથમ પરણામ મારા, માતાજીને કહેજે રે

માન્યુ જેણે મારીને રતનણ;

ભૂખ્યા રહે જમાજ્યા અમને, જગી ઊંધાજ્યા, એવા

કાયાનાં કોધલાં જતનણ.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજે રે

ધરથી બતાવી જેણે શેરીણ;

બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,

હુંગરે દેખાડી ઊંચે દેરીણ.

ગીજ પરણામ મારા, ગુરુજીને કહેજે રે

જજ્યા કે ન જડિયા, તોયે સાચાણ;

એકનેય કહેજે એવા સૌનેય કહેજે, જે જે

અગમનિગમની બોલ્યા વાચાણ.

ચોથા પરણામ મારા, બેરુઓને કહેજે રે

જેની સાથે ખેત્યા જગમાં ખેલજી;

ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;

હસાની ધોવરાવ્યા અમારા મેલજી.

પાંચમા પરણામ મારા, વેરીઝાને કહેજે રે

પાદુએ ઉધાજ્યાં અંતરદ્વારણ;

અજ્ઞાક્યા દેખાજ્યા અમને થેરા ઉલેચાબ્યા જેણે

ઉંડા ઉંડા આતમના અંધારણ.

છા પરણામ મારા, જીવનસાથીને કહેજે

સંસારતાપે દીધી છાંયણ;

પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે,

આતમના કહેજે એક સાંઈંઝ.

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજે રે

દોરાનાં કીધાં જેણે મનેખજી;

હરવા કરવાના જેણે મારગ ઉધાજ્યા રૂડા

હારોહાર મારી ઊરી મેખજી.

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજે જેણે

લીધા વિના આલિયું સરવસસણ;

આલ્યુ ને આલશે, ને પાલ્યાં ને પાળશે, જ્યારે

ફરી અહીં ઉત્તરશે અમારો હસણ.

(અનુસંધાન છેલ્લા પાન પરેથી)

દાઢી ઊંચી કરીને ફર્યા કરે એટલું જ. આમ તેમ આંદો મારવા ને થોડું ઘણું ચરી ખાતું. એટલું જ કામ કરે. એ વાત જુદી. પણ પોતે બકરો એટલે બકરો, એટલે બકરો, બસ!

બકરી કહે, આ ભુટુરિયાનું ધ્યાન રાખતાં રહેજો ને એમને જરાતરા શીંગડાં મારતાં શીખવાડો. વખત પહે કામ લાગે:

'હા હા, બહુ સારં. મને ખબર છે બધી. તું તારે મારગ જાને,' બકરો બકરીને છાંઝો કરે અને પાછો આડ સાથે શીંગડાં અફળાવવા માંડે. બકરી કટાળોને પોતાને મારગ હાલતી થાય. એને બકરાની વાતો બહુ ખૂંસે. 'ધર મારું, ભુટુરિયાં તારાં' એ ક્યાંની વાત? પણ એ કોને કહેવા જાય? 'દુનિયાની રીત જ એવી છે, મારી બાઈ!' ડાઇઝમરી મોતી બકરીઓ એને એ જ શીખ આપે.

આમ ને આમ વખત વીતાતો ગયો. ભુટુરિયાની ચિંતા કરવામાં, એમનું લાલનપાલન કરવામાં, નવું બનાવેલું ધર સજ્જાવવા, શક્ષાગરવા, શોભાવવામાં બકરીને ઘક્કી મજા આવે. એટલે જીવ પણ એ એમાં જ રાખે ને?

એક દિવસ સાંજ પહે બકરી ધરે આવી, ને જુઓ છે તો ધરની ભીતોમાં બાકોરાં પહેલાં, છત તૂટી પહેલી અને ભુટુરિયાં ગાયબ! બકરો એક કોરે આડ પાસે ઉભેલો, શીંગડાં અફળાવતો.

બકરીના મોંમાંથી હાયકરો નીકળી ગયો. 'હાય હાય, મારું ધર તૂટી ગયું. બચ્ચાં ગાયબ! કોણ હશે એ કણમુખો? નક્કી પેલા બાંડિયો - બુચિયો.' એણે રોક્કળ માંડી. બકરી પોકે પોકે રૂએ છે. બકરો હજી ય શીંગડાં ઘસતો ઊભો છે. વચ્ચે વચ્ચે બોલે છે. 'બહુ થયું, શીદને કરે છે આત્મો કકળાત?'

એટલામાં ધરની અંદરની કોઈમાંથી કાળિયું બહાર નીકળ્યું. એણે માંડીને વાત કરી. બાંડિયો - બુચિયો દીવાલ તોડીને ધરમાં ધૂસ્યા. બીજીં ભુટુરિયાને ઉડાવી ગયા. પોતે બીજાનું માર્યું કોઈમાં ધૂપાઈ ગયુંતું એટલે બચી ગયું. કાળિયાએ કહ્યું, 'તારો અવાજ સાંભળીને હું બહાર આવ્યું. મને બહુ લિક લાગ્યી, મા.' એમ કહીને કાળિયું બકરીને વળગી પદ્યું.

બકરીને રોતું તો આવતું જ હતું. હેવ એને ગુસ્સો ય ચાંચ્યો. બકરો કહેતો'તો, 'બાંડિયો - બુચિયો મારા ભાઈબંધો છે.' આવી તે કેવી ભાઈબંધી? પથર સાથે, આડ સાથે માથું ઘસ ધ

સ કરીને શીંગડાં મજબૂત કરતો'તો, ભુટુરિયાનું

ધ્યાન રાખવા ધરની આસપાસ કરતો'તો, તે આવું ધ્યાન રાખ્યું? અરે, કંઈ નહીં તો ભુટુરિયાને બચાવવા ય શીંગડાં ન વાપર્યો?

રોતી - કકળતી બકરીએ બકરાને પૂછ્યું, 'શું થયું આ? તને ખબરે ય ન પડી?'

'ના પડી, તો?' બકરાએ કહ્યું.

'પણ આપકાં તો ભુટુરિયાં ગયાં ને? ને તારા બાઈબંધો તે આવા?' બકરીએ પૂછી જ નાય્યું.

'બહુ કચકચ નહીં કરવાની, જ ધરમાં બધું સરણું કર. પાછું નવેસરથી ધર બનાવવું પહે. ધર છે તો તમે છો, સમજ્યા?' બકરાએ ખીજીછીને કહ્યું.

બકરીને આધ્યાત્મ લાગ્યો હતો ભુટુરિયાં ગયાંનો, ધર તૂટ્યાનો. ધર અનું હતું. એણે મહેનતથી બનાવેલું, શક્ષાગારેલું, સજ્જાવેલું, શોભાવેલું. બકરો, 'મારું ધર - મારું ધર'

કરતો'તો તે ય મૂંગો મોકે સાંભળી લીધેલું. આધ તથી એ મૂઢ બની ગઈ. જુદો એના પગ તળેની જમીન ખરી ગઈ અને એ ઊંડો ખાડમાં સરકી પડી. મીઠું, મજાનું ધર, રૂંડ, રૂપાણાં ભુટુરિયાં, સજ્જોંસ જ્ઞાવેલો સંસાર. બહુ જુદો ગાયબ! અને બકરો બેપરવાઈથી બોલે છે, 'પાછું બધું નવેસરથી બનાવવું પહે, કામે લાગ.'

હા, નવેસરથી તો બનાવવું જ પહે ને? ભુટુરિયાં ગયાં તો બલે, આવું મોંચેલ ધર થોડું બગડવા દેવાય? બકરાને તો એ જ વિચાર આવે ને? પણ બકરીનું શું? દોડાંડો, માથાશેડ કરીને આઠ વાનાં એકઠાં કરીને એણે ધર બનાવ્યુંતું. બકરો 'મારું ધર - મારું ધર' બોલતો તો તો ય મન મનાવી લીધુંતું. એ શીંગડાં ઘસત્વામાં વખય કાઢે ને બાંડિયો - બુચિયો ભુટુરિયાને ઉઠાવી જાય તે ય એણે ચલાવી લેવાનું? ન નવેસરથી ધર બનાવવાનું?

બકરીનો કકળાટ, એનું રૂદન, એની વેદના, એનો આધ્યાત્મ, એની ખોટ, એનું શું? કંઈ નહીં?

બકરી બેઠી રહી, બેઠી જ રહી, બેઠી જ રહી. હાલ્યાચાલ્યા વિના, જઈ બનીને, શૂન્યમાં તાકતી વિચારહીન થઈને બેઠી જ રહી. એનું મન મૂંઝેલું છે. શું કરવું - શું ન કરવું કંઈ સમજ્યતું નથી.

બકરો હજી ય એની જાગી પરવા નથી કરતો.

ભુટુરિયાં ગયાં એનું તો જુદો એનું કંઈ દુઃખ નથી, બીજી ગયેલા, રોતા, મૂંગાતા કાળિયાની ય એની ચિંતા નથી. એ તો બલડે છે, 'મારું મહામૂલું

ધર તોડી ગયા પેલા!'*

હજુ બકરી બેઠી જ રહી હતી. એક રાત, બીજે દિવસ, બીજી રાત. બકરીને કંઈ સાનભાન નથી. કાળિયું ય એની પહેલે બહુ છે, રેછ છે એને છાનું રાખવાની ય એને પરવા નથી જાણે।

બીજી રાત વીતી. સવાર પજ્યું. સૂરજનાં સોનેરી ડિરણો બકરીના ધરની તૂટેલી છત પરથી બકરીની પીઠ પર પજ્યાં, એની આંખમાં અંજાયાં. બકરીને જુદો ભાન પાંચ આવ્યું. એ જ વખતે બકરીએ કંઈક નક્કી કરી લીધું.

'ધર થશે, નવેસરથી થશે, પણ આ ધર નહીં.' એણે નિશ્ચય કર્યો. એ નવું ધર બનાવવશે. એના આ ધરમાં ગોળની ભીતો નહીં હોય, શેરીના સાંભળી છત નહીં હોય અને એ છત ટોપરાંથી છવાયેલી નહીં હોય. તો શું થયું? બલે માટીનું હોય, ધાસકુસથી છવાયેલું હોય તો એ ધર એનું હેણે, બકરીનું હેણે.

બકરીને ખબર છે, બકરા વિના એકલા ધર બનાવવું મુશ્કેલ છે. બકરાનો અહધો - અધૂરો, અણગમાથી આપેલો સાથ તો ય સાથ તો હતો. એનો અભાવ એને સાલવાનો છે. ગામ - સીમ - જગલમાં કોણ એને એકલિને ધર બનાવવામાં મદદ કરશે એની અને ખબર નથી. તો ય એ પોતાનું ધર બનાવવશે. એના કાળિયા ભુટુરિયાને એ ધર વિનાનું નહીં રાખે. એને ધર બનાવવાના વાનાં કંઈ રીત મળે ન ખબર છે, ધર બનાવતાં ય આવડે છે. તો હર શેનો? શેની ચિંતા?

બકરી ઊભી થઈ ગઈ. એણે હેક ઊંચી કરી, જગમગતા પગ સ્થિર કર્યા, જમીન પર પછાડ્યા, પોતાનાં શીંગડાં તૂટેલા ધરની દીવાલ સાથે અફળાવ્યાં ને કાળિયાને સાથે લઈને એ તૂટેલા ધરની બધાર નીકળી ગઈ. ગામના બીજે છેડે પોતાનું, પોતાની મહેનતનું, પોતાને માટે એને પોતાના કાળિયા ભટુરિયા માટે ધર બનાવવા. 'તે ધર મારું હેણે, મારું ધર.' બકરીએ નિધરિ કરી લીધો.

બકરો હજુ ય આડ સાથે શીંગડાં અફળાવતો ઊભો તો. બકરીએ એના તરફ નજરે ન નાખી, એ ચાલી નીકળી, એના નાનકડા, વહાલા, મીઠા કાળિયા ભટુરિયાને સાથે લઈને. પાંચ વળને નહીં જેવાના નિશ્ચય સાથે.



આ ઘર મારું ... મારું ?

એક ગામ હતું. ગામના સીમાડે એક બકરી રહેતી હતી. એના સાત ભટુરિયાં અને બકરાની સાથે જાળા છાંચે પોગાં રહે બધાં. બકરીનો રોજ સવાર પડે સીમમાં, ગામમાં ચારો ચરવા જ્યા, સાંજ પડે પાછી આવે ત્યારે બકરાને અને ભટુરિયાંને ય ખાવાજોગ લેતી આવે, એમને ખવાડવે અને નિરાંતે રહે. એક વાર બકરાએ બકરીને કહ્યું, 'મને થાય છે કે ઘર બનાવીએ.' બકરીને એ વાત ગમી ગઈ. પોતાનું ઘર થાય તે કોણે ન ગમે? બકરી કહે, 'હા, ચાલો, ઘર બનાવીએ. આમ ય તે ભટુરિયાં ઘરમાં રહે તો મને ય નિરાંત ને?'

હવે બકરી તો સમજે કે ઘર કાંઈ એમ જ ન જાય. આઠ વાનાં બેગાં કરવાં પડે. એ બેગાં કરવા મહેનત કરવી પડે, દોડાડોડી કરવી પડે. કાંઈ કેટલી ય માથાજીડ કરીએ ત્યારે ઘર બને. બકરીને એમ કે બકરાએ સામે થઈને ઘર બનાવવાની વાત કરી છે તો એ ય આ વાનાં બેગાં કરવાં દોડાડોડ - માથાજીડ કરવા લાગશે જને?

એણે બકરાને કહ્યું : 'ચાલો, આપણે ઘર બનાવવા વાનાં બેગાં કરીએ.'

બકરો કહે, 'એમ કરને તું જ વાનાં બેગાં કરી લાવ. બધું ભેગું કરેલું સાચવંય ય પહોને ને? હું અહીં રહીને સાચવીશ. તું ઉપડ, કેટલું કામ છે, ખબર છે?"

બકરીને થયું, 'એમ તો એમ.' એને પોતાનું ઘર બનાવવું હતું. મનગમતું ઘર બનાવવું હતું. એટલે એ દોડાડોડ કરવા તૈયાર હતી. બકરી સવારી સાંજ ચરતી જ્યા, ફરતી જ્યા ને ઘર માટે વાનાં બેગાં કરતી જ્યા. કાયાથી ય એ ઘસાય ને માયાથી ય એ જ સ્તો. બકરાએ કદી પૂછ્યું ય નહીં વાનાં કચાંથી આવ્યાં, કઈ રીતે આવ્યાં?

આ તરફ બકરો તો ખાસ આધોપાંશો ય થાય નહીં. વાત કરે ભટુરિયાંને સાચતું હું. એ બહારની જાળની પાસે જ રહે. આ સાથે શીંગાં ભટકાડાં કરે, પથ્થર પર શીંગાં દસ્યા કરે. મને પડે તો આમતેમ થોડા આંંદા મારે. જે મને તે થોડું ચરી લે ને વખત કાઢી નાખે. ભટુરિયાં એમને કષે તેમ દોડાડોડ કરતાં હોય બકરાને એમની ખાસ પરવા નહીં.

થોડા હિવસમાં બકરીએ ઘર બનાવવા જોગ

બધો સામાન ભેગો કર્યો ને ઘર બનાવ્યું. ઘરે ય તે કાંઈ કેટું? ગોળની ભીતો ચણી, શેરડીના સાંનાની છત બનાવી, ઉપર ટોપરાં ગોઠવીને છાપરનું કર્યું. બકરીનું રૂંગ રૂપાણું મીઠું મધુરું ઘર બની ગયું. બકરી રાજી રાજી થઈને ગાય છે:

ગોળ કરી ભીતીની ને શેરડી કેરા સાંના ટોપરાં ઘર થાયા, મેં તો ઘર રૂંગ બનાવ્યા મારાં ઘર રૂંગ બનાવ્યા.

બકરીએ હોણે હોણે ઘર સજ્જાવ્યું, શાણગાયું, શોભાવ્યું. જોનાર દંગ રહી જ્યા એવું સુંદર મજાનું ઘર બનાયું. બકરાને ભટુરિયાં સાથે બકરી યે ઘરમાં રહેવા માંગ્યું.

બકરી ખૂબ ખુશ હતી. પોતાની મહેનતે, પોતાને ગમતું ઘર બનાવીને કોકા ખુશ ન થાય? બકરી તો ગતી જ્યા છે, હસી જ્યા છે. હરખબેર દોડાડોડ કરતી જ્યા છે. સવારથી સાંજ ચારો ચરતાં ય એને જાણે થાક જ નથી લાગતો. સાંજ પડે મીઠા-મધુરા ઘરમાં પેસાતાં જ જાણે એનો થાક કુરર દઈને ઊરી જ્યા છે.

આવું સુંદર ઘર બનાયું એ જોઈને બકરો રાજી

થયો. એ ફરતો જ્યા ને સૌને કહેતો જ્યા, 'આવો આવો, જુઓ આ મારું ઘર. કેવું સરસ છે!'

બકરી આ સાંભળીને વિચાર કરે, 'આ ઘર બનાવવા દોડાડોડ, માથાજીડ મેં કરી. આટલું સજ્જાવ્યું, શાણગાયું મેં, બકરાએ તો સણીના બે કટકા ય નથી કર્યા. ન બોલ્યા કરે છે. 'મારું ઘર, મારું ઘર'. એણે બકરાને કહી જોયું, 'સરસ બનાયું આપણું ઘર, નહીં?' બકરાએ કુંગરાઈને કહ્યું

'બનાવનાર કોકા? હું કાંઈ જેવું તેવું ઘર બનાવું?' બકરી ચક્કિત થઈ ગઈ. આ શું બોલે છે બકરો? એને ખોટું ય બહુ લાગાયું. પણ બકરાની સાથે રહેલું ને જે તે વાતોમાં મગજ બગાડવાનો શો અર્થ? એવો વખતે ય કચ્ચી હોય બકરી પાસો? ન હિમતે ય થોડી ઓછી કે બકરાની સામે બોલવા બેસો. એણે મન વાયું, 'બકરો, ભલે બોલે રાજે મારું ઘર - મારું ઘર. હું મનમાં સમજું હું ને, એટલે બસ!' બકરીના સપ્તે ય ભટુરિયાં નાનકડાં હતાં. રૂપાણાં, વહાલાં લાગે એવાં. એમાં સૌથી નાનું ભટુરિયું હતું તો કાળિયું પણ બહુ મીઠાં. બકરીને એ બહુ વહાલાં. કાળિયું પાછું હતું ય

ચંચળ ને ચબરાક પલકવારમાં બધું સમજું

જ્યા. બકરો તો ચરવા જ્યા ને નયે જ્યા પણ બકરી રોજ સવારથી સાંજ ચરવા જ્યા છે, સાંજ પડે ઘેર પાછી આવે છે, ઘરની સંભાળ લે છે, ભટુરિયાંને સાચવે છે. બકરાને ય રાજી રાજી છે ને ખુશી ખુશી સંસાર ચલાવે છે.

બકરી-બકરાનું ઘર હતું ગામની રીતે. એક તરફ ગામ, બાળ તરફ વગળો. એ વગળમાં બાંડિયો ને બુચિયો નામના બે વડું રહેતા હતા. એ બંને વારે ઘડીએ બકરીના ઘરની આસપાસ આંંદ્રા મારે. બકરી ન હોય ત્યારે તો ખાસ. કાળિયું ભટુરિયું એ જોયા કરે. એણે એક વાર બકરાને કહ્યું, 'મા, પેલા બાંડિયો - બુચિયો આપણા ઘર બાજુ બહુ આવે છે, હો!' એવાત સાંભળીને બકરી ચેતી ગઈ. બાંડિયા - બુચિયાને શું પડી છે અહીં આવવાની? એણે વિચાર્યુ. એણે બકરાને વાત કરી. 'આ બાંડિયા - બુચિયાની દાનત મને બરાબર નથી લાગતી.'

'કેમ, શું છે?' બકરાએ એ બકરીની સામું ય જોયા વિના જાડ સાથે શીંગાં અફળાવતાં પૂછ્યું.

'એ બેની નજર આપણાં ભટુરિયાં પર હોય એવું લાગે છે.' બકરીએ પોતાની દહેશત કરી.

બકરો ખજાડ હસવા માંજ્યો, 'બાંડિયો - બુચિયો ને તારા ભટુરિયાં' હીછીછી, 'એમને શું કામ છે તારા ભટુરિયાનું?' બકરાએ પૂછ્યું. બકરીને 'તારાં ભટુરિયાં' શબ્દો ના ગમ્યા પણ એને કામ સાથે કામ હતું.

'શું તે વળી, ઉપારી જ્યા, મારી ખાય, બીજું શું?' બકરીએ કહ્યું.

'ઉહ, શેના મારી ખાય? એ બાંડિયો-બુચિયો મારા ભાઈબંધો છે. મને મળવા આવે છે, તારાં ભટુરિયાંને માટે નહીં.' બકરાને પોતે બાંડિયા-બુચિયાનો ભાઈબંધ એવાતનું ઘણ્ણું અભેમાન.

બકરી વિચારે છે, 'બાંડિયો - બુચિયો', ને તારા ભાઈબંધો? વડું ને બકરાની ભાઈબંધી કીઠી કરેણે ય જાણી છે? આ બકરાને સમજાવનું એની તાકત બહારની વાત હતી. બકરાને પોતાના શીંગાંનું, પોતાની દાઢીનું, મજબૂત પઠી ને પગની જરીઝોનું એટલું તો અભિમાન કે બકરીને તો એ સાવ એલફેલ જ ગણો.

જે કે બકરો એના શીંગાં જાડ સાથે અફળાવે, ખરીએ પથરા પર પણજ્યા કરે,

(અનુસ્થાન પાનાં ૨૭૫)